

SHREE BUDDHISAGARSURI JAIN GRANTHIMALA NO. 2

SHREE SAPTATI-SHATA-
STHANA-PRAKARANAM

AUTHORISED BY SOMA-TILAK-SURI
AND
SANSKRIT *CHHAYA* WRITTEN
BY SHREEMAD RUDDHISAGAR SURI

Researched and Revised by
MUNI HAMENDRASAGAR

Vir Samvat 2460

Vikram Samvat 1990 Copies 1000

Buddhisagarsuri Samvat 9

Price Rs 0-5-0

Published By

SHREEMAD BUDDHISAGARSURI JAIN GNANA MANDIR
VIJAPUR (OWRATI)



Printed by Gurbhind Lalhas Shah
At The Vaidya's Press, Lonopith-Bharuagar

श्रीमुद्रिसागरसूत्रिप्रथमाला न २

श्रीमोमतिलकसूरिपिरचितम्

श्रीसप्ततिशतस्थानप्रकरणम् ।



श्रीमद्-मुद्रिसागरसूरिकृत-
सस्कृतछायाम हित

संपादक'-मुनिहेमन्द्रसागर'

वीर स २४६०

वि स १९९०

दु स ९

प्रत १०००

मूल्यम् ०-५-०



નિવેદન



પ્રખર પ્રતિભાગાળી અને જિનશાસન પ્રલાવક અનેક
જૈનાચાર્ય મહાગજેએ સસ્કૃત અને પ્રાકૃત ભાષામા અનેક
પ્રકરણુ ગ્રંથો રચી ભવ્યઆત્માએ ઉપર મહાન ઉપકાર કર્યો છે

જૈનશાસ્ત્રગત રહસ્યને સુગમતાથી જાણી આચરી જીવન વિગુહ
જનાવી શકાય તે માટે વિવેચનની અનેક આચાર્ય પુગવેએ
પ્રવૃત્તિની રચના કરી છે તે પ્રકારે પૈકી શ્રી મહત્તિશાનન્ધાન
પ્રવૃત્તિની રચના જીનામુ આત્માએના ઓધ માટે તપ્પાગઠા
ધિપતિ શ્રીમાન્ સોમતિલકસૂરિજીએ કરી છે શ્રી ધર્મધોષ
સૂત્રિના શિષ્ય શ્રીમોમપ્રભસૂરિ યથા તેઓના નિદાન્ શિષ્ય
સોમતિલકસૂરિ હતા શીવનરગીણી વૃત્તિના રચયિતા શ્રી
મોમતિલકસૂરિ કરતા આ આચાર્ય જુદા છે તેમનો જન્મ
વિ સ ૧૩૫૫ માઘ માસમા, નીશા વિ સ ૧૩૬૬ મા
આચાર્યપદ ૧૩૭૩ મા અને સ્વર્ગ ગમન ૧૪૦૪ મા થયુ
તેઓશ્રીએ કરેલા ગ્રંથ નિરમાણ ! !—જુહત્ નવીન ચેત્રમમામ,
મહત્તિશાનન્ધાનપ્રકરણુ અને અનેક મ્તુતિ મ્તોત્ર મગ્ધ વિગેરે
આચાર્યશ્રી મર્જમાન્ય હતા તે મમયમા થયેલા વિદ્વાન્ આચાર્ય
જિનપ્રભસૂરિજીએ પોતાના જનાવેલા સાનનો મ્તોત્રો સોમતિલક
સૂરિજીને મમર્ષણુ કર્યા હતા વિશેષ ઐનિદ્વામિક જાગત અન્ય
ગ્રંથોથી જાણી લેવી

આ પ્રકરણ અથવા આચાર્યશ્રીએ તીર્થંકર દેવોના પ
 કથાઓ વિગેરે રચિત અગ્રો ટુકમા વર્ણવેલ છે દરેક જોન
 આ અથ અભ્યાસ કરવા યોગ્ય છે આ પ્રકરણ અથ નરિસા
 ગરસૂરિ મયોજીત મન્દૂત હાયા અને બાલાન- આ નમ્યા
 તરકથી છપાઇ બહાન પાડવામા આનેવ છે આ અથ ખાન
 અભ્યાસકોને ઉપયોગી હોનાથી તમજ કરવાની મૂવના
 યવાથી મૂલ અને સસ્કૃત હાયા સહીત કાપી (૧૦૦૦) અવગ
 છપાવી છે આ અથ છપાવવામા કોઈની મદદ મળી નથી તેથી
 પડતર કરતા જુગ કીમત પાવ આના નાખેલ છે મન્દૂત
 હાયા આચાર્યશ્રી રિદ્ધિસાગરસૂરિજીએ કરી છે આ અથનુ
 સંશોધન કાર્ય મુનિ મજારાજશ્રી મુનિશ્રી જયમાગજીએ મ્દેવ છે
 આ અથની પાછળ આ માર્થી મુનિશ્રી જયમાગજીએ મ્દેવ છે
 "આત્મભાવના" રાખવામા આવવ છે આત્માર્થી જનોને ખામ
 મનન કરવા યોગ્ય છે આ અમ્યા તરકવી આચાર્યશ્રી અન્નિત
 સાગરસૂરિ રચિત શોભનમુનીશ્ર પ્રણિત મુનિચનુવિ શનિ ઉપર
 'મરલા' નામની ટીકા-અનુનાદ મ્દેવિ રોતરતાકર સાગ
 ૧ અવનાદિ સમ્બંધ મુભાનિતરતનાકર, વિ પુસ્તકો છપાય છે
 તે ઘોડા જ અમયમા બહાર પડશે

11 ૧૦-૭-૩૪ } {

શ્રી સુ લી. સંકેરા
 જૈન જ્ઞાન મહિ
 વિજાપુર




॥ ३० ॥

श्रीमोमतिरुत्सुखिरचितम् ।

श्रीसप्ततिशतस्थानप्रकरणम् ।

श्रीमद्-ऋद्धिसागरसुखिरुत्तन्त्रायासहितम् ।



मिरिरिमहाजिणिदे, पणमिय पणमिरसुरासुरनरिंटे ।
सव्वन्नु गयमोह, सुहदमणजणियजणयोहे ॥ १ ॥

तेमि चिय चरणार्ड-पणरुल्लाणगरमा ममासेण ।
पत्तेय पुब्बभवा-इठाणमत्तरिमय बुच्छ ॥ २ ॥

आदिनाथ नमस्सुत्थ, गुरुञ्च सुगसागरम् ।
सप्ततिशतस्थान-च्छायाऋद्धि ररोम्यहम् ॥ १ ॥

श्रीश्रुपभान्निनेन्द्रान्, प्रणम्य प्रणमसुराऽसुरनेन्द्रान् ।
सर्वज्ञान् गतमोहान्, शुभदशनाचनितजनयोधार् ॥ १ ॥

तेषामेव च्यवनादि-पञ्चन्याणकत्र मात्ममासेन ।
प्रत्येक पूर्वभवा-दिरथानसप्ततिशत वक्ष्ये ॥ २ ॥

जड रि हु गणणाटया, जिणाणठाणा ह्यति तहवि इह ।
उक्किट्टसमयमभय-जिणमखाए इमे ठनिया ॥ ३ ॥

यद्यपि हि गणनातीतानि, निनाना स्थानानि भवन्ति तथापीह ।
दृष्टप्रसमयसमभव-जिनमर्यायेमाणि स्थापितानि ॥ ३ ॥

भय १ दीय २ गित्त ३ तदिमि ४, विजय ५ पुरी ६
नाम ७ रज्ज ८ गुरु ९ मुत्त १० । निणहेउ ११ मग्ग १२
आउ १३, तेरमठाणाई पुच्चमवे ॥ ४ ॥

भेवद्वीपक्षेत्रैतद्विक्-विजयपुरीनामरा-धगुरक्षुत्तम् ।

निनहेतुर्भंगालु-म्वयोदशस्थानानि पूर्वभवे ॥ ४ ॥

चुइमामाड १४ उडु १७ रा-मि १६ वेल १७ सुविणा
१८ विपारगा १९ तेसि । गच्चठिड २० जम्ममासा-इ २१
वेल २२ उडु २३ रामि २४ जम्मरया २५ ॥ ५ ॥

च्युतिमासागुडुराशि-वेलास्यप्रानि विचारकास्तेषाम् ।

गर्भस्थितिचन्ममासा-दिवेलोडुराशिजन्मारका' ॥ ५ ॥

तस्सेम २६ देस २७ नयरी, २८ जणणी २९ जणया य
३० ताण दुण्ह गई ३१ । ३२ । दिमिडुमरी ३३ तपिच्च ३४,
हरिमखा ३५ तेसि किचाइ ३६ ॥ ६ ॥

तच्छेष देश नगरी, जननीजनराश्च तेषा द्वयाना गतिः ।

दिवकुमारमस्तकृत्य, हरिमर्या तेषा वृत्त्यानि ॥ ६ ॥

गुत्त ३७ वसो ३८ नामा ३९, मामन्नविसेमओ दु नाम-
त्था ४० । ४१ लछण ४२ फण ४३ तणुलकरण ४४, गिहि-
नाण ४५ चन्न ४६ स्प ४७ बल ४८ ॥ ७ ॥

गोत्र वगोनामानि, सामान्यत्रिशेषतोद्विनामार्था ।

लाञ्छनक्षणतनुलक्षण—गृहिज्ञान वर्णरूपबलम् ॥ ७ ॥

उत्सेहा ४९ ऽऽय ५० पमाणऽ ५१—गुलेहि देहस्म तिन्नि
माणाड । आहार ५२ पिनाह ५३ कुमा-र ५४ निनइ ५५
चक्रिच ५६ कालो य ॥ ८ ॥

उत्सेघात्मप्रमाणाऽ—गुलेहेह्म्यत्रीणि प्रमाणानि ।

आहारोपिवाह कुमा-रनृपतिचक्रित्कालश्च ॥ ८ ॥

लोयतियमुर ५७ दाण ५८, वयमासाट य ५९ रिक्व
६० रासि ६१ वज्रो ६२ । तन ६३ मित्रिया ६४ परिवारा
६५, पुर ६६ यण ६७ तरु ६८ मुट्टि ६९ वेला य ७० ॥९॥

लोकान्तिमसुरदान, प्रतमासात्ति च ऋक्षराशिप्रय ।

तप गिविकापरिवारा, पुरवनतम्मुष्ट्रिवेलाश्च ॥ ९ ॥

मणनाण ७१ देवदूस ७२, तम्मट्टिट ७३ पारण च ७४
तकालो ७५ । पुर ७६ दायग ७७ तैमि गट्ट ७८, दिव्वा ७९
वसुहार ८० तित्यतरो ८१ ॥ १० ॥

मनोज्ञान देवदूप्य, तस्य म्थिति पारण च तत्काल ।

पुरदायकास्तेषा गति—र्दायाणि वसुधारा तीर्थतप ॥१०॥

तह भिग्गाहा ८२ विहारो ८३—छउमत्थत्त ८४ पमाय
८५ उवमगा ८६ । कवलमामाड ८७ उइ ८८, रासी ८९
ठाण ९० वण ९१ रुम्त्वा ९२ ॥ ११ ॥

तथाऽभिग्रहा विहार , छद्मस्थत्य प्रमादोपसर्गा ।

केवलमासाद्युद्धूनि, राशि स्थान वन वृक्षा ॥ ११ ॥

तम्माण ९३ तपो ९४ वेला ९५, अदोसया ९६ अडसया
य ९७ वयणगुणा ९८ । तह पाडिहर ९९ तित्तु-प्पत्ती १००
तकाल १०१ कुच्छेया १०२ ॥ १० ॥

तन्मान तपोवेलाऽ-दोपताऽतिशयाश्च वचनगुणा ।

तथा प्रातिहार्यतीर्थो-त्पत्तितत्कालव्युच्छेदा ॥ १० ॥

गणि १०३ मिस्मिणि १०४ सावय १०५ म-द्धि १०६
भत्तनि १०७ जक्ख १०८ जक्खिणी नामा । गण ११०
गणहर १११ मुणि ११२ मज्झ ११३-सावय ११४ सद्धीण
११५ केवल्लिण ११६ ॥ १३ ॥

गणिशिष्याश्रावकश्राद्धी,-भक्तनृपयक्षयश्रिणीनामानि ।

गणगणधरमुनिमयति-श्रावकश्राद्धीना केवलिनाम् ॥ १३ ॥

मणनाणि ११७ ओहि ११८ चउदम-पुच्ची ११९ वेउ
व्वि १२० वाड १२१ सैमाण १२२ । तहणुत्तरोपपाइय १२३
पइन्न १२४ पत्तेयजुद्धाण १२५ ॥ १४ ॥

मनोज्ञा यवधिचतुर्दश-पूर्विक्रियवादिशेषाणाम् ।

तथाऽनुत्तरोपपातिक-प्रकीर्णप्रत्येकबुद्धानाम् ॥ १४ ॥

आएम १२६ साहु १२७ भाणय १२८, वयाणमुव
गरण १२९ चरण १३० तत्ताण १३१ । सामाडअ १३२-
पडिक्कमणा-ण केवसखाय १३३ निसिभत्त १२४ ॥ १५ ॥

आदेशमाधुश्चावक-त्रतोपकरणचरणतत्त्वानाम् ।

सामायिकप्रतिक्रमणा-नामेव सदस्या च निशिमक्तम् ॥१५॥

ठिङ् १३५ अट्टिङ्कप्यो १३६ क-प्पमोहि १३७ आ-
स्मय १३८ मुणिसरूव १३९ । सजम १४० धम्मपमेया
१४१, तहेन वत्थाण वन्नाई १४२ ॥ १६ ॥

स्थित्यस्थितिरूप कल्प-विशोधिरावश्यक मुनिस्वरूपम् ।

सयमधमप्रभेदा-स्तथैव वस्त्रस्य वर्गादि ॥ १६ ॥

गिहि १४३ वय १४४ केवलिकालो १४५, सच्चाउ
१४५ तह य मुक्खवमामाई १४७ । उड्डु १४८ रासि १४९
ठाण १५० आमण १५१, ओगाहण १५२ तर १५३
परीवारा १५४ ॥ १७ ॥

गृहित्रतनेत्रलिकाल, सर्वायुस्तथा च मोक्षमासादि ।

उडुराणिस्थानासन-वगाहनातप परीवारा ॥ १७ ॥

वेला १५५ अर १५६ तस्सेस १५७, तह जुग १५८
परिआयअतगडभूमी १५९ । मुक्खवपह १६० मुक्खविणया
१६१, पुव्वपनित्ती य १६२ तन्डेओ १६३ ॥ १८ ॥

वेलाऽरतन्डेप, तथायुगपर्यायान्तदृद्भूमि ।

मोक्षपथमोक्षविनया, पूर्वप्रवृत्तिश्च तन्डेद ॥ १८ ॥

सेमसुयपवित्त १६४ तर १६५, जिणजीवा १६६ रुद्
१६७ दरिसण १६८ च्छेरा १६९ । तित्थे उत्तमपुरिसा
१७०, सतरिमय होंति जिणठाणा ॥ १९ ॥

शेषश्रुतप्रवृत्त्यन्तर-जिनजीवा रुद्रदर्शनाश्चर्यम् ।

तीर्थे उत्तमपुरुषा , सप्ततिशत भवन्ति जिनस्थानानि ॥१९॥

ति १ दु २ इग ३ दुहिअ दम ४ इ य ५, चउदस
६ दुसु गार ७-८ दम ९ चउद १० नर ११ । नर १२
अड १३ वारम १४ नर १५ मग १६, ठाणाड गाहमोलसगे ॥२०॥

त्रिद्वयेकद्वयधिकादशाऽष्ट च, चतुर्दशद्वयोरकाणांश्च चतुर्दशनव ।

नवाष्टद्वादश नरसप्त-स्थानानि गाथापोडशके ॥ २० ॥

उमह १ ममि २ सति ३ सुन्वय ४ नेमीमर ५
पास ६ वीर ७ सेसाण ८ । तेर १ मग २ नर ३ नर
४ नर ५, दम ६ मगरीमा य ७ तिन्नि भवा ८ ॥ २१ ॥

ऋषभशशिगान्तिसुव्रत-नेमी वरपार्श्वरीरशेषाणाम ।

त्रयोदशसप्तद्वादशनवनर-दशसप्तविंशतिश्च त्रयोभवा ॥२१॥

वन १ मिहुण २ सुर ३ महबल ४, ललियग य ५
वयरजष ६ मिहुणे य ७ । मोहम्म ८ मिज ९ अचुअ
१०, चकी ११ मव्वह १२ उममे य १३ ॥ २२ ॥

धनमिथुनसुरमहाजल-ललिताद्वाश्च वधनहमिथुन च ।

मौधमवैद्याऽन्युत-चक्रिसर्वाधरूपभाश्च ॥ २२ ॥

सिरिवमनिपो १ सोह-म्मसुरनरो २ अजियसेणचकी ३
य । अचुअपहु ४ पउमनिवो ५-य वजयत ६ य चद-
पहो ७ ॥ २३ ॥

(७)

श्रीवर्मनृप मौघम-सुरवरोऽजितसेनचक्री च ।

अच्युतप्रभु पद्मनृप-श्च धैर्यते च चन्द्रप्रभ ॥ २३ ॥

सिरिसेणो अभिनदि ४ १, जुयल २ सुरा ३ अमि-
यतेय सिरिविजय ४ । पाणय ५ नल हरि ६ तो हरि-नरए
खयरन्चुए दो रि ७ ॥ २४ ॥

श्रीयेणोऽभिनन्तिता, युगलमुराऽमिततेन श्रीविजया ॥

प्राणते बलहरी ततो हरी, नरके खेचरोऽन्युते द्वारपि ॥ २४ ॥

वजाउह सहमाउह, पियपुत्त ८ गिविज तडय नरमे ९ वा ।
मेहरहदरहा तो १०, मचट्टे ११ सति गणहारी १२ ॥ २५ ॥

वश्यायुधसहस्रायुधौ, पितापुत्रौ प्रेवेयके तृतीये नवमे वा ।

मेधरथन्दरथावथ, सव्याथ गान्तिगणधरौ ॥ २५ ॥

सिक्केउ १ सुहम २ कुवेर-दत्त ३ तिइयरुप्प ४ बलकु-
टलओ ५ । वमे ६ मिरिम्मनिवो ७, अवराइय ८ सुवओ
नरमे ९ ॥ २६ ॥

शिक्केतु मौघम कुवेर-दत्तस्तृतीयरुप्पे बलकुण्डलरु ।

बद्धे श्रीवर्मनृपोऽ-परानिते मुत्रतो नवमे ॥ २६ ॥

धण धणप्रइ १ मोहम्मे २, चित्तगट्टे सेयरो य रयणप्रई ३ ।
माहिदे ४ अवराइय, पीडमई ५ आरणे ६ ततो ॥ २७ ॥

धनोधनवती सुधर्मे, चित्रगति ऐचरश्च रत्नप्रती ।

माहेन्द्रऽपरानित, प्रीतिमती-आरणे तत ॥ २७ ॥

सुपहृदो सखी वा, जसमद्भञ्जा ७ वराह्यविमाणे ८ ।
 नैमिजिणो राडमई ९, नयमभवे दो वि सिद्धाय ॥२८॥

सुप्रतिष्ठः शगो वा, यशोमतीभार्याऽपराजितविमाने ।
 नैमिजिनो राजीमती, नयमभवे द्वावपि सिद्धौ च ॥ २८ ॥

कमठमरुभूडभाया २ कुम्बुडअहिहृत्थि २ नरयमहसारे
 ३ । सप्पखयन्ति ४ नारय, अञ्चुजसुर ५ सवरनरनाहो ॥२९॥

कमठमरुभूतिग्रन्धू, कुम्बुडाऽहिहृत्ती नरयमहसारे ।
 सर्पदेवरन्द्रानारकाऽन्युतसुरी शररनरनाधौ ॥२९॥

नारयगेविजसुरो ७, मीहो निरटं ८ अ नरयपाणयगे ९ ।
 भव कट्टविप्पो पामो १०, मजाया दो वि दसमभवे ॥ ३० ॥

नारयपैवेयकसुरो, सिंहो नृपतिश्च नरप्रणतपे ।
 भव (ध्रात्वा) कठविप्रपार्श्वो, मजातो द्वावपि दशमभवे ॥३०॥

नयसारो १ मौहम्मे २, मरीह ३ वमे य ४ कोसिअ ५ सुहम्मे ६ ।
 भमिउण पुममित्तो ७, सुहम्म ८ गिज्जोअ ९ ईमाणे ॥३१॥

अगिभूड ११ तडयरूपे १२, भारदाओ १३ महिद
 १४ ससारे । थावर १५ वमे १६ भव वि-स्मभूइ १७ सुक्के
 १८ तिविद्धहमी १९ ॥ ३२ ॥

अपहृहाणे २० सीहो २२, नरण २२ भमिउण चकिपि-
 यमित्तो २३ । सुक्के २४ नदणनरवइ २५, पाणयकूपे २६
 महावीरो ॥ २७ ॥ ३३

नयसार सौधम, मरीचिर्ब्रह्मे च कौणिक सुधर्मे ।
भ्रान्त्वा पुष्पमित्र , सुधर्मेऽग्निद्योत ईशाने ॥ ३१ ॥

अग्निभूतिन्तृतीयकल्पे, भारद्वाचोमाहेन्द्रे समारे ।
स्थाधरोत्रहो भवे त्रि-ध्वभूति शुक्ले त्रिष्टुष्टरि ॥ ३२ ॥

अप्रतिष्ठाने सिंहो-नरके भ्रान्त्या चत्रिप्रियमित्र ।
शुक्ल नन्दननृपति , प्राणतन्त्रुपे महावीर ॥ ३३ ॥

मत्तण्डमिमे भणिआ, पयडभवा तेमि सेमयाण च ।
तडयभवदीयपमुह, नायव्व रम्भमाणाओ ॥ ३४ ॥

मत्तानामिमे भणिता , प्ररुटभवास्तेभ्य जेपाणाम ।
तृतीयभरद्वीपप्रमुख, ज्ञातज्य घदयमाणत ॥ ३५ ॥

जन् ४ धायड ८ पूक्खर १२, दीया चउ चउ जिणाण
पुव्वमवे । धायड विमलाडतिगे १५, जन्मतिप्पमुहन-
वगे ॥ २४ ॥ ३५ ॥

जयूधातकीपुग्गर-द्वीपाश्चतुश्चतुजिनाना पूर्वमवे ।
धातकी विमलादित्रिके, जन्मू शान्तिप्रमुखनवके ॥३५॥

बारस पुव्वविदेह, १२ तिन्नि कमा भरह १३ एरणय १४ भरहे
१५ । पूव्वविदेह तिन्नि अ १८, मल्लिपरविदेहि १९ पण-
भरहे ॥ २४ ॥ ३६ ॥ मज्झिममेरुनगाओ, धायडपुक्खरगयाई
भरहाई । सित्ताड पुव्वखड, खडरियारो न जनुम्मि ॥ ३७ ॥

द्वाण्डा पूर्वविदेहे, त्रय भ्रमाद्भरतैरवतभरतेषु ।
पूर्वविदेहे त्रयश्च, मल्लि परविदेहे पञ्च भरते ॥ ३६ ॥

नलिनीगुल्म पद्मो-त्तरश्च तथा पद्मसेनपद्मरथौ ।
दृढरथमेघरथावपि, सिंहाग्रहोधनपतिश्चैव ॥ ४५ ॥

वैश्रमण श्रीरर्मा, मिद्धाथ सुप्रतिष्ठ आनन्द ।
नन्दननामा पृथ, प्रथमश्चकी नृपा शेपा ॥ ४६ ॥

वज्रसणो १ अरिदमणो २, सभतो ३ विमलराहणोअ
तहा । सीमवर ५ पिहितान्मव ६, अरिदमण ७ जुगधरगुरु
अ ८ । ४७ ॥ मवजगणदगुरु ९, मत्थाहो १० वज्रदत्त ११
वज्रनाहो १२ । तह मवगुत्तनामो १३, चित्तरहो १४ विम
लवाहणजो १५ ॥ ४८ ॥ घणरह १६ सवर १७ तह मा-हु-
सवरो १८ तह य होट वरधम्मो १९ । तह य सुनदो २० नदो
२१, मन्म २२ नामोअरो अ २३ पुट्टिलजो २४ ॥ ४९ ॥

पद्मसेनोऽरिदमन , सभ्रातोविमलवाहनश्च तथा ।
सीमन्वर पिहिताश्रवोऽ-रिदमनो युगन्धरगुरुश्च ॥ ४७ ॥
सर्वगणानन्दगुरु , मस्ताघोवञ्जत्तवञ्जनाभौ ।
तथा सर्वगुप्तनामा, चित्ररथोविमलराहनर ॥ ४८ ॥
घनरथ सवरन्तथा, साधुसवरन्तथाऽस्मि वरधर्म ।
तथा च सुनन्नेनदोऽ-तियशा नामोत्त्रश्चपोट्टिलक ॥ ४९ ॥

पद्मो १ दुवालसगी, सेसा इकारमगमुत्तधरा २४ । पद्म
१ चरमेहि २ पुट्टा, जिणहऊ वीस ते अ इमे ॥ ५० ॥

प्रथमोद्गादशाङ्गी, शेपा एकादशाङ्गसूत्रधरा ।
प्रथमचरमाभ्या मृष्टा-जिनहेतवोविंशतिस्ते चेमे ॥ ५० ॥

अरिहत १ मिद्ध २ पवयण ३, गुरु ४ थर ५ उहुस्सुए
६ तत्रस्तीमु ७ । वच्छल्लयाइ एमि, अभिक्खनाणोवओगे
८ अ ॥ ५१ ॥ वसण ९ त्रिणए १० आव-म्मएअ ११ सील ;
१२ वए १३ निरडआरो । खणलय १४ तव १५ चियाए
१६, वेयावच्चे १७ समाही अ ॥ ५२ ॥ अपुब्बनाणगहण १८,
सुअमत्ती १९ परयणे पभावणया २० । सेमेहि फामिया पुण,
एग दो तिन्नि मच्च वा ॥ ५३ ॥

अर्हत्सिद्धप्रवचन-गुरुप्रविरवहुश्रुततपस्विपु ।
वत्सत्तया हि तेषु, अमीग्गज्ञानोपयोगे च ॥ ५१ ॥

दर्शनविनयावश्यके, शीलत्रते निरतिचार ।
क्षणलवतपस्त्यागे, वेयावृत्त्ये भमाधिञ्च ॥ ५२ ॥

अपूर्वज्ञानग्रहण, श्रुतभक्ति प्रवचने प्रभावनत्रा ।
शेषे सृष्ट्या पुन-रेवो द्वौ त्रय सर्व वा ॥ ५३ ॥

सबद्धे १ तह विजय, २ मत्तमगेरिज्जय ३ दुसु जयत
४-५ । नरम ६ छट्ट गेवि-ज्जय ७ तओ वेजयतच ८ ॥ ५४
आणय ९ पाणय १० अञ्चुअ ११, पाणय १२ महमार
१३ पाणय १४ विजय १५ । तिसु सबद्ध १६ जयत १७,
अनराडज २० पाणपचेव २१ ॥ ५५ ॥ अनराडअ २२ पाण-
यग २३ पाणयग २४ मिभेअ पुव्वमजमग्गा ॥ धम्मस्स १५
मज्झिमाउ, सेमाणुक्कोमय २३ तदिम ॥ ५६ ॥

सर्वार्थं तथा विनय, सप्तममैवेयक द्वयोर्नयन्तम् ।

नवम षष्ठ मैवे-यक ततो वैनयन्तञ्च ॥ ५४ ॥

आनतप्राणताच्युत-प्राणतसहस्रारप्राणत विजयम् ।

त्रिषु सर्वार्थनयन्त,-मपराजितप्राणत चैव ॥ ५५ ॥

अपराजितप्राणतम्, प्राणतस्मिमे च पूर्वभस्वरगा ।

धर्मस्य मध्यमायु-स्तन्दि शेषाणामुत्कृष्टम् ॥ ५६ ॥

तित्तीस १ तिचीम २, गुणतीस ३ दुसु तितीस ४-५

डगतीस ६ । अडवीम ७ तिचीम ८ गुणवीस ९ वीम १०

वावीस ११ ॥ ५७ ॥ वीस १२ द्वारम १३ वीस १४, वचीस

१५ कमण पचसु तितीस २० । वीम २१ तितीस २२ वीम

२३, वीमयरा २४ पुषमनआउ ॥ ५८ ॥ पूर्वभवायु ॥ १३ ॥

त्रयन्त्रिंशत्त्रयस्त्रिंश-दशोत्रिंशद्द्वयोस्त्रयस्त्रिंशद्वक्त्रिंशद्-

अष्टाविंशतिस्त्रयस्त्रिंश-त्रेकोत्रिंशतिर्द्विंशतिर्द्वाविंशति ॥ ५७ ॥

त्रिंशतिरष्टादशविंशति-द्वात्रिंशत्त्रमेण पञ्चसु त्रयस्त्रिंशत् ।

त्रिंशतिस्त्रयस्त्रिंशद्द्विंशति-विंशति सागरा पूर्वभवायु ॥ ५८ ॥

चहुलामाढचउत्थी, १ सुद्रायडमाइतेरसी कमसो २ । फग्गुण

अडमि ३ वयसा-ह चउत्थि ४ सावणि य गीयाअ ५ ॥ ५९ ॥

चहुलापाढचतुर्थी, शुद्धा वैशाखत्रयोदशी क्रमश ।

फाल्गुनाऽष्टमी वैशा-ख चतुर्थी श्रावणद्वितीया च ॥ ५९ ॥

माहस्मकसिण छट्टी ६, भदद्वमि चित्तमामपचमिआ ८ ।

फग्गुणनरमी ९ चइसा-ह छट्टि १० तहजिड छट्टीअ ११ ॥ ६० ॥

माघस्य कृष्णपक्षी, भाद्रपदमी चैत्रमामपन्नमिषा ।
फाल्गुननरमी वैशाखपक्षी तथा ज्येष्ठपक्षीच ॥ ६० ॥

निद्धमि सुद्धनरमी १२, ततो वडसाहवाग्सी सुद्धा १३ ।
सावणरमिणा मत्तमि १४, विमाहमिय १५ भद्वे रुन्हा ॥ ६१ ॥

ज्येष्ठस्य सुद्धनरमी, ततो वैशाखद्वादशी शुद्धा ।
श्रावणशुक्ला सप्तमी, वैशाखमिता भाद्रपदकृष्णा ॥ ६१ ॥

श्रावणरमिणा नरमी १७, फल्गुणमिषयीअफल्गुण-
चउत्थी १९ । माघणि २० अस्मिणपूनिम २१, कत्तिय
चहुला दुवालमिआ ॥ २२ ॥ ६२ ॥

श्रावणकृष्णा त्रयोदशी, फाल्गुनमितद्वितीया फाल्गुनचतुर्थी ।
श्रावणाऽऽश्विनपूर्णिमा, कार्तिककृष्णा द्वादशिका ॥ ६२ ॥

अमिआ पित्तचउत्थी २३, अमादसिय छट्टि २४ चव-
णमामार्ई । इत्यन्नत्यसि पयड, अभाणिअमहिगाग्ओ नेय ॥ ६३ ॥

अमिता चैत्रचतुर्थी, अपानसितपक्षी च्यवनमामादि ।
इत्यमन्यथाऽपि प्रकट-भभणितमधिकारतो ज्ञेयम् ॥ ६३ ॥

भूमभविस्मजिणाण, पुषणुपुषीइ वट्टमाणण । पच्छाणु-
पुषियाण, रह्याणतिहीउ अन्नुत्त ॥ ६४ ॥

भूतभविष्यजिणाना, पूर्याऽनुपूर्या वर्तमानानाम् ।
पश्चाऽनुपूर्या यास्ता, पन्दाणतिथयोऽन्योऽन्यम् ॥ ६५ ॥

उत्तरमादा १ रोहिणि २, मिअमीम ३ पुणवधू ४
महा ५ चित्ता ६ । चडमाह ७ पुराहा ८ मूल ९ पुष
१० मयणो ११ मयमिमा य १२ ॥ ६५ ॥ उत्तरमद्व १३
रेवड १४, पुस्म १५ भरणि १६ कत्तिया य १७ रेवड
अ १८ । जस्मिणि १९ मयणो २० जस्मिणि २१, चित्त
२२ त्रिमाहु २३ त्तरा २४ रिक्म्या ॥ ६६ ॥ च्ययननभत्राणि ।

उत्तरमादा रोहिणी, मृगशीर्षपुनवधू मया चित्रा ।

विशारदाऽनुराधामूल, पूर्वाश्रवणगतमिया च ॥ ६५ ॥

उत्तरमाद्रपनोरेवता, पुष्योभरणी कृत्तिका च रेयती च ।

अश्विनी ऋणमश्विनी, चित्रा विशारदोत्तरा ऋक्षा ॥ ६६ ॥

घणु (१) वसह (२) मिधुण (३) मिधुणो (४), सीहो
(५) कना (६) तुला (७) अली (८) चैव । घणु (९)
घणु (१०) मयरो (११) कुमो (१२), दुसु मीणो
(१३-१४) कवडो (१५) मेमो (१६) ॥ ६७ ॥

विस (१७) मीण १८ मेम १९ मयरो २०, मेमो २१ कना
२२ तुला २३ य कना २४ य । इअ चरण रिक्तरासी,
जम्मेदिक्खाए नाणे वि ॥ ६८ ॥ च्ययनराशय ॥

घनवृषभौ मिधुनमिधुनौ, सिंह कन्या तुला अलिश्रैव ।

घनघनमकराः कुमो-द्वयोर्मानि कर्कटो मेप ॥ ६७ ॥

वृषमीनमेपमकरा-मेप कन्या तुला च कन्या च ।

इमे च्ययनराशयो-नन्मनि दीक्षाया ज्ञानेऽपि ॥ ६८ ॥

सुहवेला निसिअद्ध, जिणाण २४ एमेव एगसमयमि ।
सुइमासाइ नियारो, भरहेरवएसु सव्वेसु ॥ ६९ ॥

च्युतिवेला निशाद्धं, जिनानामेवमेवैकसमये ।
च्युतिमासादिविचारो—भरतैरवतेषु सर्वेषु ॥ ६९ ॥

गय १ वमह २ सीह ३ अभिसे—य ४ दाम ५ ममि ६
दिणयर ७ झय ८ कुम ९ । पउममर १० सागर ११
विमा—णभरण १२ रयणा १३ ऽग्गि १४ सुविणाड ॥ ७० ॥

गन्धुपभमिहाऽभिषेका—दाम शशिदिनकरा ध्वन कुम्भ ।
पद्मसर सागरविमा—न भरनरत्नाऽप्रय स्वप्ना ॥ ७० ॥

नरयउवट्टाण इह, भवण मग्गच्छुयाण उ विमाण ।
वीरुमहसेमजणणी, नियसु ते हरिउमहगयाद ॥ ७१ ॥

नरफोद्धृत्तानामिह, भवन स्वर्गाच्च्युताना तु विमानम् ।
वीरपभशेपजननी, नियमात्तानहरिवृषभगजादीन् ॥ ७१ ॥

दुनरयरुप्पगिविजा, हरी अ १ तिनरयविमाण एहि जिणा २ ।
पढमा चक्कि ३ दुनरया, थला ४ चउसुरेहिं चक्कि ३ थला ४ । ७२

द्विनरककल्पप्रवेयकाद्, हरयस्त्रिनरकविमानेभ्योजिता ।
प्रथमाशक्तिणो द्विनरकाद्—बलास्तुर्यसुरेभ्यश्चक्रिवला ॥ ७२ ॥

जिणचकीण थ जणणी, निअति चउदस गयाइ वर
सुमिणे । सग १ चउ २ ति ३ इगाइ ४ हरि १-वल २
पट्टिहरि ३ महलि अ ४ माया ॥ ७३ ॥ (स्वप्नानि)

निचमिणाअ जननी, नियमाअतुर्दशागचादियररप्रान ।
सत्र अतुअपेभादीअ, हरिअहप्रनिअग्मिअष्टलिअमाता ॥ ७३ ॥

पदमम्म थिया इदा, सेमाण जणय सुविणमत्थविऊ ।
अट्टविआरिसु सुहे, सुविणे चउदस जणणिदिहे ॥ ७४ ॥

प्रथमस्य पिता इन्द्रा, शेषाणा जनना स्वप्नाअस्रविद ।
अर्थेअ व्यचारयअ गुभान, रप्रानाअतुर्दस जननीअष्टान ॥ ७४ ॥

दु २ चउत्थ ४ नमम ९ बारस १२-तेरस १३ पनरस
१५ सेमगअमठिई । मासा अठ ८ नव ९ तदुवगि, उमहाइ
कमेणिमे दिअसा ॥ ७५ ॥

द्विचतुर्थेनवमहादश-त्रयोदशपञ्चदशशेषगमस्थिति ।
मामा अष्टनव तदुपरि, ऋषभादी अमादिमे दिअसा ॥ ७५ ॥

चउ १ पणवीस २ छदिण ३, अठवीस ४ छष ५ छच्चि
६ गुणवीस ७ । सग ८ छवीस ९ छ १० च्छ य ११, वीसि
१२ गवीस १३ छ १४ छवीस १५ ॥ ७६ ॥

अतु पञ्चमिणतिपट्टिदिना-न्यष्टाविशति पट्टपट्टचेकोनविशति ।
सप्तपट्टविशति पट्टपट्ट, विशतिरेषविशति पट्ट पट्टविशति ॥ ७६ ॥

छ १६ प्यण १७ अह १८ मत्त १९ इ य २०, अह
२१ इ २२ छ २३ सत्त २४ हुतिगन्मदिणा । इत्तो उमहाइ
जिणा-ण जम्ममामाड बुच्छामि ॥ ७७ ॥

पट्टपञ्चाऽष्ट मत्ताऽष्ट च, अष्टाऽष्टपट् मत्त भवन्ति गर्भदिनानि ।
इत्तोवृषभान्निनाना, जन्ममासाणि वक्ष्यामि ॥ ७७ ॥

चित्तबहुलद्विमी १ मिअ-माहद्विमी २ मग्गचउदमी ३ माह
। मिअविअ ४ वडमाहद्विमी ५, कत्तिअगे कमिण वारमिआ ॥७८॥

चेत्रबहुलाऽष्टमी श्वेत-माघाष्टमी मार्गचतुर्दशी माघे ।

मितद्वितीया वैशाखाष्टमी, कार्तिके कृष्णद्वादशिका ॥७८॥

जिद्विमीअ ७ पौमवसिणा ८, य वारमी मग्गपचमी चेव ।
कसिणा य माहवारमि १०, फग्गुणवारमि ११ चउदमिआ १२॥

ज्येष्ठसिता पौषकृष्णा, च द्वात्रिंशिमार्गपञ्चमी चेव ।

कृष्णाच माघद्वात्रिंशी, फाल्गुनद्वात्रिंशी चतुर्दशिका ॥ ७९ ॥

माहस्म सुद्धतइया, १३ तह वडमाहम्मि तेरसी कसिणा ।
१४ माहसिअतइय १५ जिद्वे, रुमिणा तेरमि १६ त्रिमाह-
चउदसिआ १७ ॥ ८० ॥

माघस्य शुद्धतृतीया, तथा वैशाखे त्रयोदशी कृष्णा ।

माघमिततृतीया ज्येष्ठे, कृष्णा त्रयोदशी वैशाखचतुर्दशिका ॥८०॥

सियमग्गदसमि १८ गारमि १९, बहुलद्वमि जिद्ध २०
सावणे मासे २१ । मारणसियपचमि २२ पो-मवमिणदसमि
२३ मियचित्तेरमिया २४ ॥ ८१ ॥ जन्ममामादि ॥

सितमागदशम्यकादशी, बहुलाष्टमी ज्येष्ठश्रावणे मासे ।

श्रावणमितपञ्चमी पौष, -शृष्णादशमी सितचैत्रत्रयोदशिका ॥ ८१ ॥

रता २२ रिक्खा ३३ रागी २४, पुविं भणिया इहावि
रिनेया, मखिज्जकालरूप, तडयरयत उमहजम्मो ॥ १ ॥ ८२ ॥

वला ऋश्राणि राण्य, पूर भणिता इहाऽपि विसेया ।

सख्येयकालरूप, नृतीमारकान्ते ऋपभनन्म ॥ ८२ ॥

अजियम्म चउत्थारय-मज्जे २ पच्छद्वि सभराईण १७।
तस्मति अराईण २४, चिणाण जम्मो तहा मुक्खो ॥ ८३ ॥

अनितस्य चतुर्थारक-मध्ये पश्चाद् सभयानीनाम् ।

तस्यान्तेऽराणीना, चिनाना जन्म तथा मोक्ष ॥ ८३ ॥

सुसमसुसमा य १ सुसमा, २ सुममदुममा य ३
दुसम सुममाय ४ । दुसमा य ५ दुममदुममा ६-रसप्पि-
णुस्सप्पिणी छ अरा ॥ ८४ ॥

सुपमसुपमा च सुपमा, सुपमदु पमा च दु पमसुपमा च ।

दु पमा च दु पमदु पमा, -ज्यरापिणुत्सर्पिणीपडरका ॥ ८४ ॥

मागरकोडाकोडी, चउ १ ति २ दु ३ इग ४ समदुचत्तमहसुणा ।
वाममहसेगवीमा ५, इगवीस ६ कमा छ अग्यमाण ॥ ८५ ॥

सागरकोटाकोट्य-श्रुतुखिद्वयेकममद्विचतु महसोना । वर्षसहस्रैकविं-
शति-रेकविंशति क्रमात् पठरकमानम् ॥८५॥ जिनाऽरका ॥२५॥

जमाउ इगुणनउई-पक्षनियानुयमिय अरयसेसे ।
पुरिमतिमाण नेय, तेण हिअमिम तु सेमाण ॥८६॥

जमत एकोननरति-पक्षनिजायुर्मितमर्कशेपम ।
प्रथमान्तिमयोर्जेय, तेनाऽधिकमिद तु शेपाणाम् ॥ ८६ ॥

अजियस्म अरयकोडी-लक्खा पनाम १ वीस २ दम
३ एगा ४ । कोडिमहमदम ५ एगो ६, कोडिसय ७
कोडिदस ८ एगा ॥ ८७ ॥

अजितस्यारककोटी-लक्षा पञ्चाशद्विंशतिदशैका ।
कोडिसहस्रदशैका, कोटिशत कोटिदशैका ॥ ८७ ॥

चायालमहस्सुण, इअ नयगे अट्टगे पुणो इत्तो ।
पणमद्वि लक्खचुलसी, महमहिअ होइ वरिसाण ॥८८॥

द्विचत्वारिंशत्सहस्रोन्-मितिनवकेऽष्टके पुनरित ।
पञ्चपष्टिलक्षचतुरशिति-महस्याधिक भवन्ति वर्षाणाम् ॥८८॥

अयरमय १ छायाला २, सोलम ३ मग ४ तिन्नि ५
पलिअपायतिग ६ । पलियस्स एगुपाओ ७, ररिमाणे कोडि-
सहसो य ८ ॥ ८९ ॥

अतरगत पट्चत्वारिंशत्, षोडशसप्तत्रीणि पत्यपादत्रिकम् ।
पत्यस्यैरुपादो—वर्षाणा कोटिसहस्रश्च ॥ ८९ ॥

तिसु चुलसिमहस्सहिया, १ पणमट्टि २ इगार पच लक्खा
य ३ । चुलसीमहसा १ तो स—डुदुमय २ पामस्स अरसेस ३
॥ ९० ॥ (जन्मारकशेषमाल)

त्रिषु चतुरशीतिसहस्राधिका , पञ्चपट्टिरेकादश पञ्चलक्षाश्च ।
चतुरशीतिसहस्राणि तत , सार्द्धद्विशते पार्श्वस्मारशेषम् ॥ ९० ॥

दुसु कोमला १-२ कुणाला ३, दुसु कोसल ४-५ वच्छ
कासि ७ पुवो अ ८ । मुन्न ९ मलय १० मुन्न ११ गा १२,
पचाला १३ कोमला १४ मुन्न १५ ॥ ९१ ॥ तिसु कुरु १८
विदेह १९ मगहा २०, विदेह २१ कौमट्ट २२ कासि
२३ तह पुवो २४ ।

देमा इमे जिणाण, जम्मस्स इमाओ नयरीओ ॥ ९२ ॥

द्वयो कोशलकुणालौ, द्वयो कोशला वच्छ काशी पूर्वश्च ।
शून्यमलयशून्याङ्गा , पञ्चाला कोशला शून्यम् ॥ ९१ ॥

त्रिषु कुरवो विदेहमगधा—विदेहकुशार्त्ता काशी तथा पूर्वः ।
देशा इमे जिनाणा, जन्मन इमा नगर्ष ॥ ९२ ॥

इक्खागभूमि १ उज्झा २, सावत्थी ३ दोसु उज्झ ४-५
कोसवी ६ । वाणारसि ७ चदपुरी ८, कायदी ९ भदिलपुर
१० च ॥ ९३ सीहपुर ११ चप १२ कपि—छ १३ उज्झ १४

रयणपुर १५ ति गयपुर १८ मिहिला १९ । रायगिह २०
मिहिल २१ मोरिय-पुर २२ वाणारसिअ २३ कुडपुर २४
॥ ९४ ॥ जन्म नगर्य ॥ २८ ॥

इक्ष्वाकुभूभ्ययोध्या, श्रावस्तीद्वयोरयोध्या कौशाम्बी ।

षाराणसी चन्द्रपुरी, कावन्दी भदिलपुरश्च ॥ ९३ ॥

सिहपुर चम्पा काम्पित्या—ऽयोध्या रत्नपुरत्रिपु गनपुर मिथिला ।

राजगृह मिथिला सौ—र्यपुर वाणारसी च कुण्डपुरम् ॥ ९४ ॥

मरुदेवि १ विजयदेवी २, सेणा ३ सिद्धत्थ ४ मगल
५ सुमीमा ६ । पुहवी ७ लक्ष्मण ८ रामा ९, नदा १० विण्डू
११ जया १२ सामा १३ ॥ ९५ ॥ सुजसा १४ सुषय १५
अडरा १६, सिरि १७ देनि १८ पमावई य १९ पउमवई
२० । वप्पा २१ सिजा य २२ वामा २३, तिमलादेवी अ
२४ जिणमाया ॥ ९६ ॥ इति जिनजनन्य ॥ २९ ॥

मन्देवी विजयदेवी, सेना सिद्धार्था मङ्गला सुसीमा ।

पृथ्वी लक्ष्मणा रामा, नन्दा विष्णुर्जया श्यामा ॥ ९५ ॥

सुयशा सुव्रताऽचिरा, श्रीदेवी प्रभावती च पद्मावती ।

वप्रा गिवा च वामा, त्रिशलादेवी च चिनमातर ॥ ९६ ॥

नाही १ जियसत्तु २ जिया-रि ३ संवरो ४ मेह ५
घर ६ पड्डनिवो ७ । महसेण ८ सुगिव -९ ददरह १०,
विण्डू ११ वसुपुञ्ज १२ कयनम्मो १३ ॥ ९७ ॥ सिहसेण १४

माणु १५ विससे-ण १६ छर १७ सुदरिमण १८ कुभय १९
मुमित्तो २० । विजओ २१ समुद्रविजया २२ ५-ससेण २३
मिद्धत्थ २४ जिणपिअरो ॥ ९८ ॥ चिनननका ॥

नाभिर्जितशत्रुर्जितारि , सधरो मेघो धर प्रतिष्ठनृप ।
महसेन मुमीव दृढरथा-विष्णुर्वसुपूज्य वृत्तवर्मा ॥ ९७ ॥

सिहसेन भानुविश्वसेना , सूर मुर्शेन कुम्भ सुमित्र ।
विचय समुद्रविजयो-ऽश्वसेन सिद्धार्थो जिनपितर ॥ ९८ ॥

अट्ट जणणीउ मिद्धा, नाही १ नागेसु मत्त ईमाणे ।
अट्ट य सणकुमारे, माहिंढे अट्ट पिअरो य ॥ ९९ ॥ वीरस्म
पदमपिअरो, देवाणढा अ उसमदत्तो अ । सिद्धापच्छिमपिअरो,
पुण पत्ता अच्चुए वारि ॥ १०० ॥

अष्टजनन्य सिद्धा-नाभिर्नागेषु सप्त ईशाने ।
अष्ट च मनत्कुमार, माहेन्द्रेऽष्टपितरअ ।
वीरस्य प्रथमपितरौ, देवानदा चर्पभदत्तअ ।
मिद्धौ पश्चिमपितरौ, पुन प्राप्तावन्युते वाऽपि ॥ १०० ॥

मेरुअह १ उड्डलोया २, चउदिमिस्अगाउ ५ अट्ट पत्तेअ ।
चउविदिसि ७ मज्जरुयगा ८, इइति छप्पअदिसि कुमरी ॥ १०१ ॥

मेरोरधउर्ध्वलोका-शतस्रोदिमुचकादष्ट श्रत्येकम् ।
शतस्रोविदिश्मध्यरुचका-दागण्डन्ति पट्टपद्माशहिकुमार्ये ॥ १०१ ॥

सवङ्क १ मेह २ आय-सगा य ३ भिङ्गार ४ तालियटा य ५ ।
चामर ६-जोई ७ रक्ख ८, करेति षअ कुमारीओ । १०२ ।

सवर्त्तमेपादशेका-अ भृङ्गार तालवृन्तअ ।

चामर ज्योती रक्षा, बुर्त्तन्त्येतानि कुमाय ॥ ७ ॥ १०२ ॥

भुवणिंद रीम २० वतर-पह दुतीस च ३२ चदसुरा दो २ ।
कप्पसुरिंदा दम १० इअ, हरिचउसट्टिति जिणजम्मे । १०३ ।

भुवनन्द्राविंशतिर्व्यन्तर-द्वात्रिंशच्च चन्द्रमूर्धौ द्वौ ।

कल्पसुरेन्द्रान्शेति, हर्यश्चतु षष्टिर्यन्ति तिनचन्मनि ॥ १०३ ॥

पडिस्सपचरूप-क ठवणण्हाणगरागपूयाई ।

वन्धाहरणअमयरम, अट्टाहियमाइ हरिकिच्च ॥ १०४ ॥

प्रतिरूपपञ्चरूपाऽ-द्वस्वापनाङ्गरागपूजादि ।

वस्त्राभरणाऽमृतरसा-ष्टाद्विकमानि हरिवृत्त्वम ॥ १०४ ॥

गौयमगुत्ता हरिव-स मंभया नेमिसुवया दो वि ।

कामवगोत्ता इक्खा-गुत्तमजा सेम चासीम ॥ १०५ ॥

गौतमगोत्रौ हरिव-सभयौ नेमिसुवतौ द्वावपि ।

काश्यपगोत्रा इक्खा-कुत्तमजा शेपा द्वात्रिंशति ॥ १०५ ॥

उमहो १ अजिओ २ मभंवे ३, अभिनटणे ४ सुमिह ५
सुप्पह ६ सुपामो ७ । चदपह ८ सुविहि ९ सीयल १०,
मिज्जमो ११ वामुपुजो अ १२ ॥ १०६ ॥ विमल १३

धर्मस्वभावाद्धर्मा—गर्भे माताऽपि धार्मिनाऽधिकम् १६ ।

शान्तिकरणाच्छान्ति—शोऽशिवोपशमकरणात् (१६) ॥ ११५ ॥

कुपुत्ति महीड ठिओ, भूमीठिअरयणधूमसुविणाओ । १७ ।

वमाइवृद्धिकरणा, अरो महारयणअरसुविणा १८ ॥ ११६ ॥

कुपुत्तिमहा म्थितो—भूमिस्थितरत्नरूपस्वप्रत १७ ।

यदाणि वृद्धिकरणा—अरो महारत्नाकरस्वप्नात् १८ ॥ ११६ ॥

मोहाईमल्लजया, मल्ली अरमल्लमिजडोहलओ १९ । सुणिसुवओ

जहत्या—मिहो तहवाणि तारिमीगब्भे २० ॥ ११७ ॥

मोहाणिमल्लजया—मल्लिअरमाल्यग्यादोहदत् १८ ।

मुनिमुत्रतो यवाथाऽ—मिबस्तथाम्नाऽपि तादृशी गर्भे १९ ॥ ११७ ॥

रागाडनामणेण, गर्भे पुररोहिनामणाउ नमी २१ ।

दुरिअतरुचकनेमी, रिद्धमणीनेमिसुविणाओ ॥ २२ ॥ ११८ ॥

रागाडिनामणेन, गर्भे पुररोधिनामनाअमि २१ ।

दुरिततरुचकनेमी—रिद्धमणिनेमिस्वप्नत २२ ॥ ११८ ॥

भावाण पामणेण निमिजणणीमप्पपासणा पामो २३ ।

नाणाडघणकुलाई—ण वद्धणो वद्धमाणो य ॥ २४ ॥ ११९ ॥

भावाण दशनेन, निणि जननीसर्पदर्शनात् पार्श्वे २३ ।

ज्ञानादिधनकुला—दीना वर्द्धतो वर्द्धमानश्च २४ ॥ ११९ ॥

अहवा भाजारिजया, वीरो दुद्धसुरगामणीकरणा २४ ।
सामान्यविसेसेहिं, क्रमेण नामत्यदारदुग ॥ १२० ॥

अथवा भाजारिजया—द्वीरोदुष्टसुग्वामनीकरणात् २४ ।
सामान्यविशेषाभ्या, क्रमेण नामार्थद्वारद्विक्रम ॥ १२० ॥

गो १ गय २ हय ३ कवि ४ कुचा ५—रत्तपउम ६
सत्यिया ७ ससी ८ मयरो । ९ मिरिञ्छ १० खग्गि
११ महिमा १२, वराह १३ सेणा अ उज्जच १५ ॥ १२१ ॥
हरिणो १६ छगलो १७ नटा—वत्त १८ कलम १९ कुम्म
२० नीलउप्पलया २१ । सख २२ फणीमर २३ सीहा २४,
निणोरुठिअरोमलञ्छणया । १२२ ॥

गोगाहयपिक्खौञ्चा—रत्तपद्मस्वस्तिक्खौ श्णी मकर ।
श्रीवत्तमग्गिमहिपा—वराह सेनश्रवञ्छ ॥ १२१ ॥

हरिण छागोनन्दा—वर्त्त कलशवूर्मनीलफमलानि ।
शखफणीश्वरसिंहा—जिनोरुस्थितरोमलाञ्छनानि ॥ १२० ॥

इग १ पण २ नव ३ य सुपासे, पासे फणतिन्नि १
सग २ इगार ३ कमा । फणिमिज्जासुविणाओ १, फणिदम
न्तीइ २ नन्नेसु ॥ १२३ ॥

एक पञ्च नव च सुपार्थे, पार्थेफणाम्त्रय सप्तैकादशक्रमात् ।
फणीन्द्रशय्यास्वप्नात्, फणीन्द्रभक्त्या नान्येषु ॥ १२३ ॥

अद्भुत्तरो सहस्रमो, मन्वेसिं लक्षणाइ देहेसु ।
 मद्भुत्तरोहि ति नाणा, जाव गिह पच्छिमभराओ ॥१२४॥
 अष्टोत्तर सहस्र, सर्वेषा लक्षणाणि देहेषु ।
 मत्तिभ्रुतावधि शनत्रय, यावद् गृह पश्चिमभयत ॥ १२४ ॥
 पउममसुपुञ्ज रत्ना, मत्सिसुविही सेअ नमिसुणि काला ॥
 मल्ली पामो गीला, कणयनिहा मोल सेमजिणा ॥१२५॥

पञ्चवासुपूयौ रक्तौ, शशिसुविर्धौ श्वेतौ नमिसुनी षालौ ।
 मद्दिपार्धौ नीलौ, कनकनिभा षोडश शेषनिना ॥ १२५ ॥

सर्वसुरा जड स्व, अगुह्यप्रमाणय विउपिआ ।
 निणपायगुह्य पइ, न मोहण त जर्हिगालो ॥ १२६ ॥

गणहरआहारअणु-त्तरा य जात्र वणचक्खिवासुबला ।
 मडलिया जा हीणा, छट्ठाणगया भवे सेमा ॥ १२७ ॥

सर्वसुरा यदि रूप,-महृष्टप्रमाणक विबुर्चयु ।
 जिनपादाङ्गुष्ठ मति, न शोभते तत्तथाऽङ्गार ॥ १२६ ॥

गणघटाऽक्षरकाऽनु-त्तराश्च यावद्द्वयन्तरचक्रियासुबला ।
 माण्डलिका यावद् हीना, पटस्थानगता भवेयु शेपा ॥

निर्दर्शहि बला बलिणो, कोडिमिलुक्खमेवसत्तिणो हरिणो ।
 तद्गुणमला चक्की, निणा अपरिमिअबला सच्चे ॥१२८॥

हरिसमयच्छेद्यत्थ, वीरेण पयडिअ बल नियय ।
मेरुगिरिकपणेण, हेउअभावा न सेमेहिं ॥ १२९ ॥

नृपतिभ्यो बला बलिन, कोटिशिलोल्पेपशक्तयोहरयः ।
तद्द्विगुणत्रलाञ्छक्रिणो-जिना अपरिमितबला सर्वे ॥ १२८ ॥

हरिसमयच्छेदार्थ, वीरेण प्रकटित त्रल निनकम ।
मेरुगिरिकम्पनेन, हेत्वभावात् शेषे ॥ १२९ ॥

पणघणुमय १ पन्नद्वसु ८, दम पणसु ५ पणद्वसु अ
८ घणुहहाणी । नरकर २३ मत्तुस्सेहो २४, आयगुलमीममय
सन्वे २४ ॥ १३० ॥ उत्सेधागुलदेहमान ४९-आत्मागुलदेह-
मान च ५०

पञ्चशतधनु पञ्चाशदष्टसु, दशपञ्चसु पञ्चाष्टसु च धनुर्हानि ।
नवकरमसोत्सेधा-वात्माङ्गुलविंशतिशतमिता सर्वे ॥ १३० ॥

चउघणुबारसदुग, उमहायगुलपमाण अगुलय । ते उमहो
वीसमय, चारगुलहाणि जा सुविही ॥ १३१ ॥ त्रीसमदुअगुल-
हा-णि जाय णत्तो तयद्ध जा नेमी । सगतीसमा पासो, त्रीरि-
गवीसम पन्नामा ॥ १३२ ॥ [प्रमाणाङ्गुलदेहमानम्]

चतुर्धनुर्द्वादशाशद्विक, -मृपमात्मागुल प्रमाणाङ्गुलम् ।
ते ऋपमोविंशतिशत, द्वादशाङ्गुलहानिर्यावत्मुविधि ॥ १३१ ॥

विंशत्यशद्विकङ्गुलहानि-र्यावदनन्त नदद्धं यावन्नेमि ।
सप्तविंशत्यशा पार्श्वो-वीर एकविंशत्यशा पञ्चाशा ॥ १३२ ॥

सब सिसुणो अमय, तो उत्तरवृरुफठे गिह उसहो ।
ससा उ ओयणार्ह, भुजिसु निमिष्टमाहार ॥ १३३ ॥

सधेसि वयगहणे, आहागे उग्गमाडपरिसुद्धो ।
मल्लि नेमि मुत्तु, तेमि पिनाहो अ भोगफला ॥ १३४ ॥

मनें गिणवोऽमृत, तत उत्तरवृरुफठे गृह ऋपभ ।
शेषास्तु-ओदनादि, बुभुत्तिर निमिष्टमाहारम ॥ १३३ ॥

सर्वपा धनमरण, आहार उद्गमादिपरिशुद्ध ।
मल्लि नेमि मुक्त्वा, तथा पिनाहश्च भोग्यफलान् ॥ १३४ ॥

वीम १ द्वारम २ पनरम ३, मड्डुदुवालम ४ दसेर ५
सड्डुमगा ६ । पण ७ अड्डाइयलकत्वा ८, पुच्चमहसपन्न ९
पणवीस १० ॥ १३५ ॥ समलकत्वा इगवीस ११, द्वार १२
पनर १३ मड्डु सत्त १४ सड्डुदुग १५ । तो महमा पणवीमा
१६, पउणचउवीम १७ इगवीम १८ ॥ १३६ ॥ वाससय
मल्लिजिणे १९, पणमयरी २० पचवीम २१ तिन्नि सया २२
। चामाई तीम २३ तीस २४, कुमरत्त अह निरइकालो ॥ १३७ ॥

निशत्यष्टादशपञ्चदश, मार्द्धद्वादश दणैव साद्धसम ।
पञ्चार्द्धद्विल-वाणि, पूवसहस्रपञ्चाशत्पञ्चविंशति ॥ १३५ ॥

समलश्रौकविंश-त्यष्टादशपञ्चदशसाद्धमत्तसाद्धद्विकम् ।
तत सहस्रपञ्चविंशति, पादोनचतुविंशतिरेकविंशति ॥ १३६ ॥

वर्षशत महिचिने, पञ्चसप्तति पञ्चविंशतिस्त्रीणिशतानि । -
वर्षाणि त्रिंश-त्रिंशत्, कुमरत्वमथनृपतिनाल ॥ १३७ ॥

तेमद्विपुबलमखा १, निपन्न २ चउचत्त ३ महृल्लत्तीम ४ ।
गुणतीम ५ सहृद्गवीस ६, चउदस ७महृल्ल ८ अद्द ९ द्द १० १३८

त्रिपट्टिपूर्वलभाणि, त्रिपञ्चाशच्चतुश्चत्वारिंशत्पट्टिंशत् ।
एकोनत्रिंशत्साद्वैकत्रिंशति-श्चतुर्दश साद्वैकपट्टिंशत् ॥ १३८ ॥

अनियाओ जा मुनिही, पुबंगा तानिमेऽद्विया नेया ९ ।
इग १ चउ २ अड ३ वारम ४, सोल ५ वीम ६ चउवीम
७ जडवीमा ८ ॥ १३९ ॥

अनितानात्तमुनिधि, पूर्वाङ्गानि तानदिमान्यधिकज्ञेयानि ।
एचत्तुगष्टदादश-पोडशत्रिंशतिचतुत्रिंशत्यष्टाविंशतय । १३९ ।

तो ममलक्ख दुचत्ता १२, तो मुन्न तीम १३ पनर १४
पच तओ १५ । सहम पणवीम १६ तत्तो, पउणचउपीम १७
इगवीस १८ ॥ १४० ॥

तत ममलभा द्विचत्वारिंशत्, तत शून्य त्रिंशत्पञ्चदश पञ्च तत ।
महत्तपञ्चविंशति-स्तत पाणेत्तचत्तुविंशतिरेकविंशति ॥ १४० ॥

मुन्न १९ पनर २० पण २१ तत्तो, ति मुन्न २४ रज्ज
च चक्किलो वि । सतीकुधुअराण, सेमाण नदिय चक्कित्त ॥
१४१ ॥ (राज्यकाल ५५ चक्रित्तकाल ॥ ५६ ॥)

शून्य पञ्चदशपञ्चतन-स्त्रिशून्य राज्यञ्च चन्द्रिकालोऽपि ।

शान्तिबुन्ध्वराणा, शेषाणा नास्ति चन्द्रित्वम् ॥ १४१ ॥

बभामि किन्डरार्ड-अतरठियनअभिमाणवत्थवा ।

अट्टयराऊ भवा, लोयतमुग इअभिहाणा ॥ १४२ ॥

ब्रह्मणि कृष्णराज्य-न्तरस्थितनचविमानवास्त्वव्या ।

अष्टसागराबुर्भेज्या-लोमान्तमुग इत्यभिधाना ॥ १४३ ॥

सारस्मय माइचा, वण्हि वण्ण गदतोय तुसिआ य ।

अद्यानाह अगिवा, रिट्टा वीहिंति जिणनाहे ॥ १४४ ॥

मारस्वता आदित्या-रिद्वरुणगदतोयतुपिताश्च ।

अन्यावाधाऽऽश्रेया-रिष्टा त्रोधन्ति तिननाथान् ॥ १४५ ॥

दिणि दिति जिणा वणणे-गजोडि अडलक्ख पायगस जा ।

त कोडितिमय अडसी, असीडलक्खा हवइ ररिसे ॥ १४६ ॥

दिने ददति त्रिना कनरैक-सोत्थपट्टक्षा प्रातराश यावत् ।

सत्कोन्निप्रिसत्तमप्टाशीति-रणीतिलक्षा भवन्ति उर्ये ॥ १४७ ॥

जम्म व मासपक्खा, नगर सुवयस्स सुद्धफग्गुणिओ ।

नमिरीराण वयमी, कसिणा आमादमग्गसिरा ॥ १४८ ॥

जन्मव मासपक्षा -परन्तु सुजनस्य शुद्धफाल्गुनिक ।

नमिरीरयोत्रैते, कृष्णावापाडमार्गशीर्षे ॥ १४९ ॥

अट्टमि १ नवमी २ पुत्रिम, ३ दुदसि ४ नवमि ५
तेरमी तिग ८ छट्ठी ९ । वारसि १० तेरमि ११ पनरमि १२

चउत्थि १३ चउदमिअ १४ तेरसीआ १५ ॥ १४६ ॥ चउ-
दमि १६ पचमि १७ गारमि १९, वारसि अ २० नवमि
२१ छ्ठी अ २२ । एगारमि २३ दममि २४ तिदि, वयमि
उडुरासिपुव व ॥ १४७ ॥

अष्टमी नरमी पूर्णिमा, द्वादशी नरमी त्रयोदशी त्रिने पष्टी ।
द्वादशी त्रयोदशी पञ्चदशी, चतुर्थी चतुर्था च त्रयोदशी ॥ १४६ ॥

चतुर्दशी पञ्चम्येनादशी, द्वादशी च नरमी पष्टी च ।

एकादशी दशमी तिथि-त्रेन च्छुरागय पूर्वमिव ॥ १४७ ॥

कुमरत्ते पदमरण, वसुपुत्रो महिनेमि पामो य ।

वीरो पि अ पवट्या, मेमा पच्छिमयमि निरा ॥ १४८ ॥

कुमरत्ते प्रथमवयमि, वासुपूज्योमहिनमीपार्श्वश्च ।

वीरोऽपि च प्रव्रजिता, शेषा पश्चिमयत्रसि नृपा ॥ १४८ ॥

सुमन्सु निचभक्त, महिपामाण अट्टमो आमि ।

वसुपुत्रस्म चउत्थ, वयमि सेमाण छट्टतरो ॥ १४९ ॥

सुमतेर्नियमकत, महिपार्श्वेवोष्टममासात् ।

वासुपूज्यस्य चतुर, त्रते शेषाणा पष्टतप ॥ १४९ ॥

मिनिया मुदमणा सु-प्यमा य मिद्वत्थ अन्थमिद्धा य ।

अभयकरा य निवुड-करा मणोहर मणोरमिया ॥ १५० ॥

श्वरपहा सुकपहा, विमलपहा पुहनि त्रदिघ्ना य ।

सागरदत्ता तह ना-गदत्त मवट्ट विनया य ॥ १५१ ॥

- तह वेजयतिनामा, जयति अपराजिया य देवबुरू ।
 वारवड अ विमाला, चदपहा नरसहमबुज्हा ॥ १५२ ॥
- शिषिका मुर्शना सु-प्रभा च सिद्धार्थोऽर्थमिद्धा च ।
 अभयङ्करा च निवृत्तिकरी, मनोहरा मनोरमिका च ॥ १५० ॥
- सूरप्रभा, शुक्रप्रभा, विमलप्रभा पृथ्वी देवञ्जिना च ।
 सागरदत्ता तथा ना-गदत्ता सर्गार्था विजया च ॥ १५१ ॥
- तथा वनयन्ती तामा, जयन्त्यपराजिता च देवबुरू ।
 द्वारवती च विशाला, चन्द्रप्रभा नरसहस्रोद्या ॥ १५० ॥
- वसुपुञ्जो छमयजुओ, मल्ली पामो अ नरतिमयसहिया ।
 चउमहमजुओ उसहो, डगु गीरो सेस सहमजुया ॥ १५३ ॥
- वासुपूज्य पन्शतयुतो-महि पाश्वश्वनरत्रिशतमहित
 चतु सहस्रयुत ऋषभ-एकोवीर शेपा महन्त्रयुता ॥ १५३ ॥
- नेमी वारवडए; सेमा जम्मणपुरीसु पवडआ ।
 मिद्धत्थरणे उमहो, निहारगहमि वसुपुञ्जो ॥ १५४ ॥
- तह वप्पगाइ धम्मो, नीलगुहाए अ सुव्वयजिणिंदो ।
 पामो अ आममपए, वीग्जिणो नायसडमि ॥ ७५५ ॥
- सेमा महसचरणे, निम्पता सोगतस्तले सव्व ।
 कपपचमुट्टिलोआ, उसहो चउमुट्टिकयलोओ ॥ १५६ ॥
- नेमिर्दारवत्या, जेया जन्मपुरीपु प्रज्जिता ।
 सिद्धार्थधने ऋषभो-विहारगेहे वासुपूज्य ॥ १५४ ॥

- तथा वप्रगाया धर्मो—नीलगुहायाञ्च सुत्रतजिनेन्द्र ।
 पार्श्वश्चाश्रमपदे, वीरजिनो हातगण्डे ॥ १५५ ॥
- शेषा महाम्राध्रवने, निष्प्रान्ता अशोक्तकृतये मर्ध ।
 कृतपञ्चमुष्टिलोचा—ऋषभश्चतुर्मुष्टितृत्तलोच ॥ १५६ ॥
- सुमद्मिअममह्ली—नेमीपामाण दिक्ख पुव्वह्ण ।
 सेमाण पच्छिमण्हे, जाय च चउत्थमणनाण ॥ १५७ ॥
- “ सुमतिश्रेयासमहि—नेमिपाश्राना गीथा पूर्वाहे ।
 शेषाणा पश्चिमाहे, जात च चतुर्थमनोज्ञानम ॥ १५७ ॥
- मको अ लक्खमुल्ल, सुरदूस ठणई मत्तजिणखधे ।
 वीरस्स वरिममहिय, मयावि सेमाण तस्म टिट्ठे ॥ १५८ ॥
- इत्थञ्च लक्खमून्य, सुरदूप्य स्थापयति सर्वनिनम्मन्धे ।
 वीरस्य धर्ममधिक, मदापि शेषाणा तस्य म्भिति ॥ १५८ ॥
- उमहस्स य इक्खपुरमो, सेमाण पारणमि परमन्न ।
 त वरिसेणुमहस्स य, सेसजिणाण तु वीअदिणे ॥ १५९ ॥
- ऋषभस्य चेशुरस, शेषाणा पारणे परमान्नम् ।
 तद्वर्षेणर्षभस्य च, शेषनिनागान्तु द्वितीयग्निने ॥ १५९ ॥
- हत्थिणपुर अउज्झा, भागत्थी तह अउज्झ रिजयपुर ।
 वमतथल च पाडलि—सड तह पउमसड च ॥ १६० ॥
- सेअपुर सिद्धपुर, मिद्धत्य महापुर च धन्नरूड ।
 तह वद्धमाण मोमण—समदिर चैव चक्कपुर ॥ १६१ ॥

- रायपुर तह मिहिला, रायगिह तह च हीड वीरपुर ।
 वारवई झोयकड, बुल्लाग पारणपुगड ॥ १६० ॥
 हस्तिनापुरमयोध्या, श्रावस्ती तथाऽयोध्याविजयपुरम् ।
 ब्रह्मस्थल पाटलिग्रण्ड, तथा पद्मरण्ड ॥ १६० ॥
 श्वेतपुररिष्टपुर, सिद्धाथमहापुर च धान्यरुडम्
 तथा वर्द्धमानमौमनस्य, मन्दिर् चैव चक्रपुरम् ॥ १६१ ॥
 राजपुर तथा मिथिला, राजगृह तथा च भवति वीरपुरम् ।
 द्वारवती कोपकट, बुल्लाग पारणपुराणि ॥ १६२ ॥
 मिजम रभद्रत्तो, मुग्दिदत्तो अइददत्तो अ ।
 पउमो अ सोमदवो, महिद तह मोमदत्तो अ ॥ १६३ ॥
 पुस्मो पुणवसू तह, नट सुनदो जओ अ विजओ अ ।
 तत्तो अ धम्मसीहो, सुमित्त तह वग्घसीहो अ ॥ १६४ ॥
 अवराइअ त्रिससेणो-अ वभदत्तो अ दिन्न वरदिन्नो ।
 धन्नो वहुलो अ इमे, पढमजिणभिक्षदायारो ॥ १६५ ॥
 श्रेयासो ब्रह्मदत्त, सुरेन्द्रदत्तश्चेन्द्रदत्तश्च ।
 पद्मश्च सोमदेवो-महेन्द्रस्तथासोमदत्तश्च ॥ १६३ ॥
 पुष्य पुनर्वसुस्तथा, नन्दसुनन्दौ जयश्चविजयश्च ।
 ततश्चघर्मसिंह, सुमित्रस्तथा व्याघ्रसिंहश्च ॥ १६४ ॥
 अपराणितो विश्वसेनश्च, ब्रह्मदत्तश्च दिन्नवरदिन्नौ ।
 धन्यो वहुलश्चेमे, प्रथमजिनभिक्षादातार ॥ १६५ ॥

अद्वय तन्मयसिद्धा, सेमा तन्मि उ भव च तद्वृषा ।
सिद्धिमांसति मगासे, जिणाण पडियन्नपवजा ॥ १६६ ॥

अष्टौ च तद्भवसिद्धा, शेपास्तस्मिन्नेव भव वृत्तीये वा ।
सत्पर्यति मफाणे, तिनाना प्रतिपन्नप्रत्रय्या ॥ १६६ ॥

पण दिवा जलवृमुमा-ण उट्टि वसुहार चेलउक्खेयो ।
दुदुहिच्चुर्णा सुराण, अहो सुदाण ति घोमणया ॥ १६७ ॥

पञ्चदिव्यानि जलवृमुमा-ता वृष्टिर्वसुधारा वेगोक्षेप ।
दुन्दुभिध्वनि सुराणा-महो ? सुदाण त्रिघोषणया ॥ १६७ ॥

सद्दुवालमकोटी-सुवन्नमुट्टी य द्दोइ उक्कोसा ।
लक्खा सद्दुवालम, जहन्निया द्दोइ वसुधारा ॥ १६८ ॥

साद्धद्वान्शरोटी-मुवर्णवृष्टिश्च भवत्युवृष्टा ।
लक्खा सार्द्धद्वान्श, जपन्यथा भवति वसुधारा ॥ १६८ ॥

बारट्ट छमाय तयो, गुरु आइममज्झचरिमतित्येसु ।
तेसि चहुभिग्गहा द-वमाड वीरम्मिमे अहिआ ॥ १६९ ॥

द्वान्शाऽष्टपट्टमामास्तपो-गुर्वादिममध्यचरमतीर्यपु ।
तेषा बह्वभिग्गहा द्रव्या-ज्यो वीरस्येमेऽधिआ ॥ १६९ ॥

अचियत्तुगहनिमण, निच्च जेमट्टकायमोणेण ।
पार्णापत्त गिहिय-टण अभिग्गहपणगमेअ ॥ १७० ॥

अप्रीतिमद्गृहनिवसन, नित्य व्युत्सृष्टकायमौनेन ।
पाणिपात्रग्रहिय-न्दनमभिग्गहपञ्चमेतन् ॥ १७० ॥

आरियमणारिणु, पद्मस्य य नेमिपामचरिमाण ।
सेमाण आरिणु, छउमथत्ते विहारो अ ॥ १७१ ॥

आर्याऽनार्येषु, प्रथमस्य च नमिपामचरमाणाम ।
शेषाणामार्येषु, छद्मस्यत्र विहारश्च ॥ १७१ ॥

वाममहस्स १ वारम २, चउडम ३ अट्टार ४ वीस ५
वरिमाइ । मासा छ ६ नव ७ तिन्नि अ ८, चउ ९ तिग
१० दुग ११ मिक्कग १२ दुग च १३ ॥ १७२ ॥

ति १४ दु १५ क्कग १६ सोलमग १७, वामा
तिन्नि अ १८ तहय होरत्त १९ । मासेवारम २० नवग २१,
चउपन्न दिणाड २२ चुलसीट ॥ २३ ॥ १७३ ॥

पक्खणियमङ्कवारम २४ वामा छउमथत्तकालपरिमाण ।
उग्ग च तपोक्कम्म, निसेमओ वट्टमाणस्स ॥ १७४ ॥

वर्षसहस्र द्वादश-चतुर्दशऽष्टादशविंशतिर्वर्षाणि ।
मामाः पट् नव त्रयश्च, चतुस्त्रिंशद्विकमेकद्विक च ॥ १७० ॥

त्रिद्वेषेकानिपोहश-वर्षाणि त्रीणि च तथैवाहोरात्रम् ।
मासेकादशात्रक, चतुष्पञ्चाशदिना यशीति ॥ १७३ ॥

पक्षाधिकमासद्वादश-वर्षाणिच्छद्मस्थकालपरिमाणम् ।
उग्र च तप कर्म, विशेषतो उर्द्धमानस्य ॥ १७४ ॥

वयटिणमेग पुन्न, छमासिअ वीअय पणटिण्ण ।
नव चउमासिअ दु तिमा-मिअ अट्टाइज्जमासिआ दुन्नि । १७५ ।

छ दुमासिअ दु दिवड्वय-मामिअ चारम तहंगमासी अ ।

चारत्तरद्धमामिअ, पडिमा चारडुमैहिं च ॥ १७६ ॥

दो चउ ञम स्वमणेहि, निरतर भदमाडपडिमतिग ।

दुमयगुणतीम छट्टा, पारणया तिमयगुणवन्ना ॥ १७७ ॥

प्रतन्निमेक पूण, पाण्मामिक द्वितीय पञ्चन्निनोम ।

नय चातुर्मासिकानि, द्वेत्तिमासिके साद्धद्विमासिके द्वे ॥ १७५ ॥

पट्टद्विमासिकानि द्वे सार्द्धे-मानिके द्वाण्श तर्थाण्मासिकानि ।

द्विसत्तनिरर्द्धमामिकानि, प्रतिमाद्वाण्ग्याष्टमैश्च ॥ १७६ ॥

द्विचतुर्दशअणै-निरन्तरं भद्रादिप्रतिमात्रिकम् ।

द्विशतैकोनत्रिंशच्छष्ठानि, पारणकानि त्रिंशतैकोनपञ्चाशत् ॥ १७७ ॥

वीरु १ महाण २ पमाओ, अतमुट्टत्त तहव होरत्त ।

उवमग्गा पामम्म य, वीरम्म य न उण सेमाण ॥ १७८ ॥

वीरर्षभयो प्रमाणे-ऽन्तर्मुहत्तै तर्थाहोरात्रम् ।

उपसर्गा पार्श्वम्य, वीरस्य च न पुा णेपाणाम ॥ १७८ ॥

फग्गुणिगारमि किण्हा, सुद्धा एगारसी अ पोसम्म ।

कत्तियउहुला पचमि, पोमम्म चउदमी धवला ॥ १७९ ॥

चित्ते गारमि पुन्निम, तह फग्गुणकिण्हछट्टिमत्तमिआ ।

सुद्धा कत्तिअतडआ, पोममि चउदमी उहुला ॥ १८० ॥

माहेऽभावमि मिअविअ, पोसे मासमि धउलछट्टी अ ।

वइसाहसामचउदमि, पोसे पुन्निम नयमि सुद्धा ॥ १८१ ॥

सिअचित्ततइअ कत्तिअ-वारमि एगारमि अ मग्गमिरे ।
फग्गुणवारसि सामा, मग्गमि इगारमी निमला ॥ १८२ ॥

आमोअमाअमी चि-त्तरहुलचउत्तिव निमाहमिअढममी ।
केअलमामाइ इमे, भणिया पुव न उडुरासी ॥ १८३ ॥

फाल्गुनवृष्णैकादशी, शुद्धैकादशी च पौषस्य ।

कार्तिकबहुला पद्मिनी पापस्य चतुर्दशी वज्रा ॥ १७९ ॥

चैत्रैकादशी पूर्णिमा, तथा फाल्गुनवृष्णपष्टी मत्तमिका ।

कार्तिकशुद्धतृतीया, पौषस्य चतुर्दशी बहुला ॥ १८० ॥

माघऽमात्रास्या सितद्वितीया, पौष मासे धवलपष्टी ।

वैशाखश्यामचतुर्दशी, पौषे पूर्णिमा शुद्धनवमी ॥ १८१ ॥

श्वेता चैत्रवृतीया कार्तिक-द्वाद्दश्यादशी च मार्गशीर्षे ।

फाल्गुनश्यामा द्वादशी, मार्गे एकादशी निमला ॥ १८२ ॥

आश्विनामावस्या चैत्र-बहुलचतुर्षी वैशाखसितदशमी ।

केअलमासाअय इमे, भणिता पूर्वमिबोडुराशय ॥ १८३ ॥

वीरोमहनेमीण, जमिअवहि पुरिमताल उज्जिते ।

केअलनाशुप्पत्ती, सेमाण जम्मठाणेसु ॥ १८४ ॥

वीररुभनमीना, वृभिकावहि पुरिमतालउज्जयन्ते ।

केवल्लानोत्पत्ति, शेषाणा जन्मस्थानेषु ॥ १८४ ॥

उमहम्म य मगढमुह, उजुवालिअनइतडमि वीरस्म ।

सेमजिणाण नाण, उप्पन्न पुण चयरणेषु ॥ १८५ ॥

ऋषभस्य च शकटमुखे, ऋषुवाडुकाननीतट वीरस्य
शेषनिनामा ज्ञान-मुत्पन्न पुनर्ग्रतनपु ॥ १८५ ॥

नग्गोह १ मत्तयन्नो २, माल ३ पिआलो ४ पियगु
५ छत्ताह ६ । मिरिमो ७ नागो ८ मल्ली ९, पिलुख ११
तिंदुयग ११ पाडलया १२ ॥ १८६ ॥

जवू १३ अमत्थ १४ दद्विर-न्न १५ नदि १६ तिलगा
य १७ अयग १८ अमोगो १९ । चपग २० वडलो २१
वेडम २२, घाडअ २३ मालो अ २४ नाणतरू ॥ १८७ ॥

न्यमोध मत्तपर्ण, माल प्रियाल प्रियगु उत्राम ।
शिरीषोनागोमल्ली, पिलुद्धतिन्दुकपाटलिफा ॥ १८६ ॥
जम्ब्वधत्यदधिपर्ण-नन्नीतिलकाश्चाम्रकोऽगोष ।
चम्पककुली वेतम-घातकीसालाश्च ज्ञानतरव ॥ १८७ ॥

ते जिणतशुवारगुणा, चेडअतरणो वि नवरि वीरस्म ।
चेडअतरुवरि सालो, एगारमघणुहपरिमाणो ॥ १८८ ॥

ते जिनतनुद्वादशगुणा-श्रैत्यतरवोपि नरर वीरस्य ।
चेत्यतरूपरि माल-एगारमघणु परिमाण ॥ १८८ ॥

अट्टमभत्तमि कए, नाणमुमहमल्लिनेमिपासाणम् ।
वसुपुञ्जस्म चउत्थ, सेसाण छट्टमत्ततपो ॥ १८९ ॥

अट्टमभक्त वृत्ते, ज्ञानमृषभमल्लिनेमिपार्शानाम् ।
वासुपूज्यस्य चतुर्थे, शेषाणा पष्टमत्तप ॥ १८९ ॥

नाण उमहाईण, पुवण्ह पठिमण्हि वीरस्म । (वानवेला)
॥९५॥ तवमि पि अठाम्म, न हुति दोमा इमे ते अ ॥ १९० ॥

पानमृषभाणाणा पूर्वाह्नपश्चिमाह्नि वीरस्य ॥
मर्षपामप्यष्टाश्व, न मन्ति दोषा इमे ते च ॥ १९० ॥

पंचेव अतगया, मिच्छनमनाणपरिइ कामो ।
हामहग रागदोगा, निना ह्याम्म इमे त्थोसा ॥ १९१ ॥

पञ्चैवान्तरया—मि यात्ताऽत्तामपरिति काम ।
हाम्यात्पिङ्गागडेपौ, निद्राऽष्टादोमे दोषा ॥ १९१ ॥

हिमाइतिग कीला, हामाईपचग चउक्काया ।
मयम उरअन्नाणा, निदा पिम्म इअ च दोमा ॥ १९२ ॥

हिमान्तिरिक्कीटा, हारयादिपञ्चन चतुष्कपाया ।
मदमत्सरमज्ञान, निनाप्रेमेति च दोषा ॥ १९२ ॥

जम्मप्पभिइ चउगे, निणाण इक्कार घाइरम्मखओ ।
सुरनिहिअइगुणवीम, चउत्तीस अट्ठमया उ इमे ॥ १९३ ॥

जन्मप्रभृतिचत्वारो—जिनानामेकादशघातिवर्मक्षयात् ।
सुरनिहितैकोऽधिपति—असुनिशदतिशयास्त्रिमे ॥ १९३ ॥

सैअमलामयरहिय, दह सुहगघरूपसजुत्त ।
निविस्ममवीभत्त, गोखीरनिह रुहिरमस ॥ १९४ ॥

स्वेदमलाऽऽमयरहितो—देह शुभगन्धरूपसयुक्त ।
निविद्धमवीभत्स, गोश्रीरनिभ रुधिरमामम ॥ १९४ ॥

न य आहारनिहारा, अडमयरहिआण जति दिट्ठिपहे ।
सामो अ कमलगधो, इअ जम्मा अडसया चउरो ॥ १९५ ॥

न च आहारनिहारा-चतिशयरहिनाना यातोत्पिपथे ।
श्रामश्च कमलगन्ध-एते जन्मनोऽतिशया-वृत्वार ॥ १९५ ॥

तिरिनरसुराण कोडा-कोटीओ मिति जोयणमहीए ।
मव्वमभामाणुगया, राणी भामडल पिट्ठे ॥ १९६ ॥

तिर्यग्गरसुराणा, कोटाकोश्वोमान्ति योजनमह्याम ।
सर्वेषा भापानुगता, राणी भामण्डल पृष्ठे ॥ १९६ ॥

स्यमइरईडमारी, टमरदुभिक्ख अबुट्ठिअडुट्ठी ।
जोयणस्य सराल, न ह्ति इअ रुम्मखयजणिया ॥ १९७ ॥

रुजोरेरेतिमारी-डमरदुभिक्खमवृष्टिरतिवृष्टि ।
योजनदत्ते सपादे, न भवन्त्येते कमभयजनिता ॥ १९७ ॥

पायारतिगममोगो-मीहासणधम्मचक्कउररा ।
छच्चायचमरदुदुहि-रयणझया कणयपउमाइ ॥ १९८ ॥

पणअन्नसुमवुट्ठी, सुगवनलवुट्ठि वाउ अणुकूलो ।
छ रिउ पण इदियत्था-णुहलया दाहिणा मउणा ॥ १९९ ॥

नहरोमाण अउट्ठी, अहोमुहा कटया य तरुनमण ।
सुरकोडिजहण्णेण वि, जिणत्तिए इअ सुराहि कया ॥ २०० ॥

प्रानारत्रिकमगोक, मिहानाधर्मचक्कचतुरूपाणि ।
छत्रत्रयचामरदुन्दुभि-रत्तन्ध्यजकनरुपद्धानि ॥ १९८ ॥

पञ्चमणकुसुमवृष्टि, सुगन्धनलवृष्टिर्वायुरनुकूल ।

पङ्क्तुपञ्चन्द्रियार्था-अनुकूला दक्षिणा शकुना ॥ १९९ ॥

नखरोन्मामवृद्धि-रघोमुरगा कण्टकाश्च तरुनमनम् ।

सुरकोटीनघन्यनाऽपि, विनान्तिवे एते सुरकृता ॥२००॥

ते चउरो व अयाया-वगमाडमजो दुरतघाइखया । -

नाणाइसओ पूआ-ऽमओ वयणस्मडसओ अ ॥ २०१ ॥

ते चत्वारो वाऽपायाऽ-पगमाऽतिशयो दुरन्तघातिक्षयात् ।

ज्ञानाऽतिशय पूजा-ऽतिशयो वचनस्याऽतिशयश्च ॥२०१॥

वयणगुणा मग सद्दे, अत्ये अडवीम मिलिअ पणतीस ।

तेहि गुणेहि मणुना, जिणाण वयण कमेण डम ॥ २०२ ॥

वचनगुणा सप्त शब्द-ऽवऽष्टात्रिंशतिर्मिलिता पञ्चत्रिंशत् ।

त्रिंशत् त्रैगुणैर्मनीञ्ज, जिनाना वचन क्रमेणेदम् ॥ २०२ ॥

वयण मकारगमी-रघोमउवयास्द्रचयाजुत्त ।

पडिनायनर दस्त्रि-न्नमहिअमुवणीअराय च ॥ २०३ ॥

वचन सस्कृतगम्भीर-घोपोपगरोदात्ततायुत्तम ।

प्रतिनादर दाक्षिण्य-महितमुपनीतरागश्च ॥ २०३ ॥

सुमहथ जवाहय-ममसय तत्तनिट्टिअ मिट्ट ।

पच्छाअुचिय पटिहय-परत्तर हिययपीट्ठर ॥ २०४ ॥

अन्नुन्नमामिअय, अभिजाय अडमिणिद्वमहुर च ।

समल्हा परनिटा-वज्जिअमपडनपमग्जुअ ॥ २०५ ॥

पयडक्त्वरपयप्रक, सत्तपहाण च कारगाइजुअ ।

ठविअविसेसमुआर, अणेगजाई विचित्त च ॥ २०६ ॥

परमम्मनिभमाई, -विलवपुच्छेयस्सेअरहिअ च ।

अदुअ धम्मत्थजुय, सलाहणिज्ज च चित्तकर ॥ २०७ ॥

सुमार्धमयाहत्त-मसदाय तत्त्वनिष्ठित शिष्टम् ।

प्रस्तावोचितप्रतिहत्त-परोत्तर हृदयप्रीतिकरम् ॥ २०४ ॥

अयोऽन्य माभिनाश्व-मभिनातमनिस्तिग्धमधुरञ्च ।

स्वशापापगनिंदा-वर्जितमप्रकीर्णप्रसरयुतञ्च ॥ २०५ ॥

प्रकटाश्वरपद्वाक्य, सत्त्वप्रधानञ्चकारवादियुतम् ।

स्थापितनिशेषमुत्तर-मनेकजातिविचित्रञ्च ॥ २०६ ॥

परमर्मनिधमाणि-विश्वव्युच्छेत्स्वन्गहितञ्च ।

अद्भुतधर्माधियुत, श्लाघनीयञ्चचित्रकरम् ॥ २०७ ॥

किंकिच्छि १ कुसुमवुट्टी २, दिव्वज्जणि ३ चामरा ४
ऽऽमणाड च ५ । भावल्य ६ भेरि ७ उत्त ८, जिणाण इअ
पाडिहराड ८ ॥ २०८ ॥

कङ्केद्धि कुसुमवृष्टि-दिव्यध्वनिश्चामराणि च ।

भावल्य भेरि छत्र, जिनानामिति प्रातिहार्याणि ॥२०८॥

तेवीमाए पढमे, धीए वीरस्म पुण भमीमरणे ।

मया च तिथ ममुप्पन्न ॥ २०९ ॥

त्रयोविंशते प्रथमे, द्वितीये वीरस्य पुन समवसरणे ।

सद्य प्रमगणधर, श्रुतञ्च तीर्थं समुत्पन्नम् ॥ २०९ ॥

इगतित्था जा तित्थ, वीअस्सुप्पञ्जए अ ता नेयो ।

पुबिल्लित्थिनालो, दुममत पुण चरमतित्थ ॥ २१० ॥

केवल्लिनालेण जुओ, इगस्म वीयस्स तेण पुण हीणो ।

अतरकालो नेओ, जिणाण तित्थस्म कालो वि ॥ २११ ॥

उसहम्स य तित्थाओ, तित्थ वीरस्म पुबलक्खट्ठिय ।

अयरगओडिकोडी, चागीसमहम्सवासुणा ॥ २१२ ॥

एकतीर्थाद्यावत्तीर्थं, द्वितीयस्योत्पद्यते तात्रञ्ज्येय ।

पूर्वस्य तीर्थकालो-टु पमान्त पुनश्चरमतीर्थम् ॥ २१० ॥

केवल्लिनालेन युन-एणस्य द्वितीयस्य पुनर्हीन ।

अन्तरकालो ज्ञेयो-जिनाना तीर्थस्य कालेऽपि ॥ २११ ॥

ऋषभस्य च तीर्थान्, तीर्थं वीरस्य पूर्वलक्षाधिकम् ।

सागरैककोटी कोटी, द्वाविंशतिमहस्रवपाना ॥ २१२ ॥

इग १ इग २ तिगे ३ ग ४ तिग ५ इग, ६ इगस

इअ गाग्गल्लिअचउभागे । त्रिति न्ने इअ पल्लिए, सुवि ७

हाइमु मत्तित्थते ॥ २१३ ॥

एकैकत्रिकैकत्रिकैकवासा-इत्येनात्पत्त्यचतुर्थभागा ।

श्रुवत्यन्य इति पत्न्यानि, मुनिभ्यादीना सप्ततीर्थान्ते ॥ २१३ ॥

पुढरीअ १ सीहसेणा २, चारूरू ३ वज्जनाह ४ चम-
रगणी ५ । सुअ ६ विदम्भो ७ दिन्नो ८, वराहओ ९ नद
१० कुच्छुम ११ सुभूमा १२ ॥ २१४ ॥

मदरु १३ जसो १४ अरिद्धो १५, चक्काउह १६ सब
१७ कुम १८ भिसओ अ १९ । मल्ली २० सुभो २१ वरद-त्त
२२ अज्जदिन्नि २३ ढभूहगणी २४ ॥ २१५ ॥

पुण्डरीक सिंहसेन-आरूरूर्ध्वअनाभचमरगणी ।

सुद्योतविदर्भदिन्ना-वराहकोनन्दकौस्तुभसुभूमा ॥ २१४ ॥

मदरयसोऽरिष्टा-अवायुधशयकुमभिपजाअ ।

महि सुभोपरदत्त-आर्यदिन्न इन्द्रभूतिगणि ॥ २१५ ॥

वभी १ फग्गुणि २ मामा ३, अजिआ ४ तह कासवी
५ रई ६ सोमा ७ । सुमणा ८ वारुणि ९ सुजसा १०,
धारिणि ११ धरणी १२ घरा १३ पउमा १४ ॥ २१६ ॥

अज्जमिवा १५ सुइ १६ दामिणि १७, रक्खिअ १८
बन्धुमइ १९ पुप्फउह २० अनिला २१ । जखदिन्न २२
पुप्फचूला २३, चदणवाला २४ पवत्तणिया ॥ २१७ ॥

ब्राह्मी फाल्गुनी श्यामाऽ-जिता तथा काश्यपी रति सोमा ।

सुमना वारुणी सुयशा-धारिणी धरणी घरा पद्मा ॥ २१६ ॥

आर्या शिवा श्रुतिर्दामिनी, रक्षिका बन्धुमती पुष्पवत्यनिला ।

यक्षदिन्ना पुष्पचूला, चन्दनवाला प्रवार्त्तिन्य ॥ २१७ ॥

सेअस नद सुजा, सखो उमहस्म नेमिमार्ण ।
सहिसुभदा महगु-ध्वया सुनदा य सुलसा य ॥ २१८ ॥

गणहरपरत्तिणीजो, पदमा भणिआ जिणाण सव्वेसि ।
सद्धा सद्धी अ पुणो-चउण्ह सेसाणमपसिद्धा ॥ २१९ ॥

धेयास नद सुयोत-अग्गा ऋपभनेन्यादीनाम् ।
श्राद्धी सुभद्रा महासु-अता सुनन्दा च सुलसा च ॥ २१८ ॥

गणधर प्रवर्त्तिन्य , प्रथमा भणिता जिनाना सर्वेषाम् ।
श्राद्धा श्राद्धयश्च पुन-अतुणां शेषाणामप्रसिद्धा ॥ २१९ ॥

भरह १ सगर २ मिअसेणा, अ ३ मित्तविरिओ ४
अ सचविरिओ ५ अ ॥ तह अजिअसेणाराया ६ दानविरिय
७ मघवराया ९ य ॥ २२० ॥

जुद्धविरिय ९ सीमधर १०, तिविद्धमिण्हू ११ दुविद्धु १२
अ सयभू १३ ॥ पुरिसुत्तमविण्हू १४ पुरि-मसीहु १५
कोणालयनिओ अ १६ ॥ २२१ ॥

निवइरुवेग १७ सुभूमा १८-अजिअ १९ विजयमहो अ
२० चकिहरिमणो २१ ॥ कण्हो २२ पसेणई २३ से-णिओ
२४ य जिणमत्तरायाणो ॥ २२२ ॥

भरत सगरोगृगसेन-अ मित्रवीयश्च मत्स्यवीर्यश्च ॥
तथाऽजितसेनराजो-दानरीर्योमघवराचश्च ॥ २२० ॥

युद्धवार्य सीमधर-स्त्रिपृष्ठविष्णुर्द्विपृष्ठश्च स्वयम्भू ॥

पुण्योत्तमविष्णु पुरुय सिंह कोणालकनृपश्च ॥ २०१ ॥

नृपतिकुबेर सुभूमोऽ-जितोविनयमहश्च चम्प्रिहरिपेणः ॥

कृष्ण प्रमेनवित्थ-णिकश्च तिनभक्तराजा ॥ २०२ ॥

वित्तीह सङ्ग्रामरम, लक्ष्मे पीड्ड दिति कोडीओ ॥

चकी कणय हरिणो, रयय निरई सहसलक्ष्मे ॥ २२३ ॥

भक्तिविहवाणुरूव, अन्ने मि अ दिति इन्ममाईया ॥

सोऊण जिणागमण, निउत्तमणिउत्त एसुवा ॥ २२४ ॥

वृत्त्या मार्द्धवादन-लक्ष्णाणि प्रीत्या ददति कोटी ॥

चम्प्रिण वनरहरयो-रजतनृपतय महस्त्रलक्ष्णाणि ॥ २२३ ॥

भक्तिविभवानुरूप-मन्येपि न्तीभ्यादयश्च ॥

श्रुत्वा जिनागमन, नियुक्तानियुक्तेषु था ॥ २२४ ॥

जक्खा गोमुह महज-कर तिमुहजकमेमतुचरुकुमुमो ।

मायग विजयअजिया, रमो मणुएमर कुमारो ॥ २२५ ॥

छम्मुह पयाल किन्नर, गरुडो गधवतह य व्रक्तिदो ॥

सकुनर वरुणभिउडी, गोमेहोपासमायगो ॥ २२६ ॥

यक्षा गोमुरो महायक्ष-स्त्रिमुखो यक्षस्तुषु कुसुम ॥

मातगो विजयोऽजितो-श्रद्धा मनुवेशर, कुमार ॥ २२७ ॥

पण्मुत्त पाताल किन्नरो, गरुडोगन्धर्वस्तथा च यक्षेन्द्रः ॥
सकुयेरोरुण्णो भ्रुकुटि-गोमिध पार्श्वोमातङ्गः ॥ २२६ ॥

दनीओचकेमरि १, अजिया २ दुरिआरि ३ कालि ४
महाकाली ५ ॥ अच्चुअ ६ सता ७ जाला ८, सुतारया ९
सोग १० मिरिउच्छा ११ ॥ २२७ ॥

पररा १२ प्रिजय १३ कुम १४ प-न्नइत्ति १५ निव्वाणि
१६ अच्चुया १७ धरणी १८ ॥ चडरु १९ इदत्त २०
गघा-रि २१ अय २२ पउमानई २३ सिद्धा २४ ॥ २२८ ॥

देव्यश्चमेश्वर्यजिता, दुरितारि कालीमहाकाली ॥

अच्युता शान्ता ज्वाला, सुतारयाऽशोका श्रीवत्सा ॥ २२७ ॥

प्रवरा त्रिनयाऽङ्कुशा, प्रघ्नन्नि निर्वाण्यच्युता धरणी ॥

वैरोरुया वत्तागा-घा-र्येभ्या पद्मावती सिद्धा ॥ २२८ ॥

चुलसीइ १ पण नवइ २, विहियसय ३ सोलहियस
च ४ मय ५ ॥ सगहियसउ ६ पण नवई ७, तिणवइ ८
ठामी ९ गसि १० छमयरी ११ ॥ २२९ ॥

छावट्टी १२ सगनन्ना १३, पन्न १४ तिचत्ता १५ छती
१६ पण तीमा १७ ॥ तिचीम १८ ट्ठावीमा, १९ ठार २
सतरि २१ गार २२ दम २३ नय २४ ॥ २३० ॥

गण गणहरसख इमा, वीरस्म इगारगणहरा नवर
चउदममया दुवन्ना, सवके गणहरा हुति ॥ २३१ ॥

चतुरशीति १ पञ्चनवति २-द्वर्धधिकशत ३ षोडशाधिकशत
४ च शत ५ ॥ मन्नाधिकशत ६ पञ्चनवति ७-स्त्रिनवति ८
ष्ठाशीति ९ रेकाशीति १० षट्सप्तति ११ ॥ २०९ ॥

पत्पष्टि १२ सप्तपञ्चाशत् १३, पञ्चाशत् १४ त्रिचत्वारिं-
शत् १५ षट्त्रिंशत् १६ पञ्चत्रिंशत् १७ । त्रयस्त्रिंशत् १८ षष्टाविं-
शति १९-अष्टादश २० सप्तदशिका २१ दश २२ नव २३
अष्ट २४ ॥ २३० ॥

गणगणधरम्बर्यैषा, वीरस्यैकादशगणधरा नवर ॥ चतुर्दश-
शतद्विपञ्चाश-सर्वाङ्क गणधरा भवन्ति ॥ २३१ ॥

चुलमिमहम १ तोलरखा, इग २ टो ३ तिन्नेत्र ४ तिन्नि-
तीमा य ५ । तिन्निपतीमा ६ तिन्निअ, ७ महदुग ८ दुन्नि
३ इगलखो १० ॥ २३२ ॥

महमा चुलमि ११ त्रिमत्तरि, १२ अडमट्टि १३ छसट्टि
१४ तहय चउमट्टी ॥ १५ तामट्टि १६ मट्टि १७ पन्ना १८,
वत्ता १९ तीमाय २० वीमाय २१ ॥ २३३ ॥

शद्वार २२ मोल २३ चउटम २४, महमा उसहाड्याण-
शुणिसखा ॥ अट्टावीस लकवा, अडयाल महस्म सबके ॥ २३४ ॥

चतुरशीति सहस्राणि, ततोल्भमेक द्वेत्रीण्येव त्रीणि विंश
तेषु ॥ त्रीणि च त्रिंशत् त्रीणि च-मार्द्धद्वे द्वे एकलक्षम् ॥ २३५ ॥

सहस्राणि चतुरशीतिद्विसप्तति-रष्ट्रपष्टि षड्पष्टिस्तथा च
 चतु पष्टि ॥ द्विपष्टि पष्टि पञ्चाशत्, चत्वारिंशत् त्रिंशच्च विंश
 तिश्च ॥ २३३ ॥ अष्टादश षोडश चतुर्दश-सहस्राणि ऋषभा
 दीना मुनिसरया ॥ अष्टाविंशतिलक्षा-प्यष्टचत्वारिंशत्सहस्राणि
 सर्वाङ्क ॥ २३४ ॥

सजडलम्बातिन्निय १, तिन्नियतीमाय २ तिन्निछत्तीसा
 ३। छच्चयतीमा ४ पचय, तीसा ५ चत्तारि-त्रीसाय ६ ॥ २३५ ॥
 चउरोतीमा ७ तिन्निअ, सीया ८ इगलक्ख वीम महसहिओ
 ९ ॥ लक्खोयसजड छग १०, लक्खोतिमहस्म ११ लक्खोय
 १२ ॥ २३६ ॥ इगलक्खो अट्टसया १३, महसविसट्ठी १४
 विसट्ठि चउरमया १५। इगमट्ठि छसय १६ सट्ठी, छमया
 १७ मट्ठीअ १९ पणपन्ना १९ ॥ २३७ ॥ पन्न २० इग चत्त
 २१ चत्ता २२, अडतीम २३ छतीम २४ सहम मवग्गे।
 चउआललक्खमहमा, छायाला चउमया ठहिया ॥ २३८ ॥

सयतीना त्रिलक्ष, त्रीणि च त्रिंशत् त्रीणि षट्त्रिंशत्।

षट् च त्रिंशत् पञ्च च, त्रिंशत् चत्वारि विंशतिश्च ॥ २३५ ॥

चत्वारि त्रिंशत् त्रीणिचा-शीतिरेकलक्ष विंशतिसहस्राधिसम्।

लक्ष च सयतिषट्, लक्ष त्रीणि सहस्राणि लक्ष च ॥ २३६ ॥

एकलक्षमष्टाशत्, सहस्राणि द्विपष्टिर्द्विपष्टि चतु शतम्।

एकपष्टि षट्शत पष्टि, षट्शत पष्टिश्च पञ्च पञ्चाशत् ॥ २३७ ॥

लक्ष्मणापथ १ पण २ छत्राय, त्रिगु पञ्चम नवगु चतुर नवगु
 त्रिगु । मध्वीणि कमा तदुपरि, महत्मा चउपक्ष १ पणयाला २
 ॥ २४३ ॥ छत्रीम २ मन्त्रीमा ४, मोलम ५ पण ६ तिन
 रईत्र ७ इगनरह ८ । इगदधरि ९ अद्वयधरा १०, अद्वयाल
 ११ छत्रीम १२ चउवीता १३ ॥ २४४ ॥ चउदस १४ तेरम
 १५ तिनरह १६, मगामीई १७ विगचरी १८ मयरी १९ ॥
 पक्ष २० डयाल २१ छत्रीमा २२, गुणयाल २३ द्दरम
 २४ महत्मा ॥ २४५ ॥

लक्षा पक्ष पञ्चम न, त्रिगु पक्ष नवगु चत्वारि नवगु त्रीणि ॥
 धात्रीमा नगात्तदुपरि, महत्माणि चतुःपञ्चाशाम् पञ्चमत्वारिंशत्
 ॥ २४३ ॥ पञ्चिंशत्तमत्वारिंशत्, पाठ्य पञ्चत्रिंशत्तमत्वारिंशत् ।
 मन्त्रीमात्तमत्वारिंशत्-त्रिंशत्तमत्वारिंशत् चतुर्विंशत्तमः ॥ २४४ ॥ चतु
 र्दश त्रयोदशत्रिंशत्-दशानीतिर्दशत्तमः मन्त्रीमा ॥ पञ्चाशत्तम
 त्वारिंशत् पञ्चिंशत्-दशानीत्यत्वारिंशत्तमत्वारिंशत् महत्माणि ॥ २४५ ॥

पणपक्षदस अद्वया-लीमसहम्मा च गायया मत्ते ।

इगरीटी पण लक्ष्म्या, अद्वयीम महम्ममध्वीजो ॥ २४६ ॥

पञ्चपञ्चाशत्तमत्वारिंशत्-त्रिंशत्तमत्वारिंशत्तमत्वारिंशत्तमः मन्त्रीमा ।

मन्त्रीमात्तमत्वारिंशत्-दशानीत्यत्वारिंशत्तमत्वारिंशत्तमः ॥ २४६ ॥

उसहम्मवीमसहम्मा १, धीमावारीम पाधि अजिअम्म २

३ चउत्तम ४ तरम ५, धारसि ६ दारसदम ७ दम

॥ २४७ ॥ पणमयरी ९ मयरी १० पणम-द्वि ११

मट्टि १२ पणपन्न १३ पन्न १४ पणयाला १५ ॥ तेआला
 १६ बत्तीमा १७, दुवीमरातोअ अडवीस १८ ॥ २४८ ॥
 चार्वीम १९ ठार २० सोलम २१, पणरम २२ टम २३ मगमयाई
 केवलिणो । सच्चग्गमेगलक्खो, छहत्तरीमहमसयमेग ॥२४९॥

अपभस्य विंशतिसहस्राणि, विशतिर्द्वाविंशतिर्वाप्यनितस्य ।
 पञ्चदश चतुर्दश त्रयोन्ना, द्वादशैकान्ना ततश्च ॥ २४७ ॥
 पञ्चसप्ततिस्सप्तति पञ्चपष्टि, पष्टि पञ्चपञ्चाशत्पञ्चाशत्पञ्च
 चत्वारिंशत् । त्रिचत्वारिंशद्द्वात्रिंशद्, द्वात्रिंशतिर्वाऽप्याविंशति
 ॥ २४८ ॥ द्वात्रिंशत्यष्टान्श पोडश-पञ्चान्श न्श मत्तशतानि केव-
 लि । सर्वाभमेक एअ, पन्मप्तनिमह्माणि शतमेक ॥ २४९ ॥

मणनाणि चारमहमा, मट्टुमग मयाई मट्टु उमया वा ॥
 त्तोन्नारममहमा, पणसयपचमयमट्टा वा ॥ २५० ॥ चारस-
 हस मट्टुमय ३, ण्णारसमहस छमयपचामा ४ ॥ दशमहम
 सट्टु चउमय ५, तो दममहमा य तिन्नि मया ६ ॥ २५१ ॥
 सट्टा इगनवडसया ७, असीइ ८ पन्नत्तरीइ ९ पणसयरी १० ॥
 सट्टी ११ मट्टी १२ पणप-न्न १३ पन्न १४ पणयाल १५
 चत्तमया १६ ॥ २५२ ॥ चत्तहिय तितीममया १७, इगण
 अहिया य पचवीसमया १८ ॥ मट्टुमतरमय १९ पनरम २०,
 बारम पन्नाहिय मट्टीवा २१ ॥ २५३ ॥ दश २२ सट्टुसत्त
 २३ पणमय २४, मत्ते मणनाणि एग लम्भा य ॥ पणयाली-
 ससहस्ता, पचमया इगनवडअहिया ॥ २६४ ॥

मनोदानिनो द्वाशसहस्रा , मार्द्धमप्तगतानि सार्द्धपट्ट
शतानि वा ॥ ततो द्वादशमहस्या , पञ्चशतपञ्चशतमाद्धवा २५०
द्वादशमहस्याणि मार्द्धगत-मषादशमहस्याणि पट्टशतानि पञ्चासत् ।
दशमहस्याणि मार्द्धचतु शतानि, ततो दशसहस्राणि च त्रिशतानि
॥ २१ ॥ मार्द्धेकनयनिशता-न्यगीति पञ्चसप्तति पञ्चसप्तति ।
पष्टि पष्टि पञ्चपञ्चाशत्, पञ्चाशत्पञ्च चत्वारिंशत् चत्वारिंशत्
॥ २५० ॥ चत्वारिंशत्धिकत्रयस्त्रिंशत्गता-न्येवपञ्चाशदधिक-
पञ्चविंशतिशतानि ॥ मार्द्धसप्तदश शतानि पञ्चाशत्, द्वादशप-
ञ्चाशत्त्रिंशत् पष्टिर्वा ॥ २५३ ॥ दशसाद्धमत्तपञ्च शतानि, सर्व-
मनादानिन एकला च । पञ्चचत्वारिंशत्सहस्रा , पञ्चशता
न्येकनवत्यविंशत् ॥ २५४ ॥

अह ओहिनाणिनई १, चउनई २ छन्नवई ३ अठान-
वई ४ ॥ एयाईमयाडैतओ, इगार ५ दम ६ नव ७ अड ८
सहस्मा ॥ २५५ ॥ चुलसी ९ विसयरि १० सट्टी ११, चउ-
पन्न १२ डयाल १३ तहयतेयाला १४ ॥ छत्तीस १५ तीस-
सया १६, पणविस १७ छत्रीस १८ चावीमा १९ ॥ २५६ ॥
अड्डार २० सोल २१ पनरस २२, चउदस २३ तेरमसयाअव-
हिनाणी ॥ लम्बो तित्तममहसा, चत्वारिमयाइमवक ॥ २५७ ॥

अथावधिहानिनोनवति-अतुणवति पणवतिरष्टनवति ।
एतानि शतानि तत-मषादश शतानवाष्टसहस्राणि ॥ २५५ ॥
चत्वारिंशत् द्विसप्तति पष्टि , चतु पञ्चाशदष्टचत्वारिंशत् त्रिच-

त्वारिंशत् ॥ षट्त्रिंशत् त्रिंशत्त्रय, पञ्चविंशति षड्विंशति द्वाविंशति
 ॥ २६ ॥ अष्टादशषोडशपञ्चदश, चतुर्दश त्रयोदशतान्यवधिज्ञा
 निन ॥ छत्रयस्त्रिंशत्सहस्राणि, चत्वारिंशतानि सर्वाङ्क ॥ २५७ ॥

चउदमपुवीसद्वा-सगयाला १ मत्तवीमवीमहिआ २ ।
 सड्विगर्वासं ३ पनरम ४, चउतीम ५ तहतिरीमसया ६ ॥ २५८ ॥
 तीसहियरीस ७ वीस ८, पनरस ९ चउदमय १० तर ११
 रागमया १२ ॥ इकार १३ दम १४ नर १५ द्य १६, छमया-
 सयरा १७ छदमअहिआ १८ ॥ २५९ ॥ छचसयाअडमद्वा १९,
 पणद्ध २० पचम २१ तओमयाचउरो २२ ॥ अध्युद्ध २३
 तिगय २४ मन्वे, चउतीमसहम्म दुगहीणा ॥ २६० ॥

चतुर्दशपूर्विण सार्द्धमप्त-चत्वारिंशत् मप्तविंशतिविंशतिर-
 विंश ॥ सार्द्धविंशति पञ्चदश, चतुर्विंशतिस्तथा त्रयोविंशतिश-
 तानि ॥ २५८ ॥ त्रिंशत्त्रिकविंशतिविंशति, पञ्चदश चतुर्दश
 त्रयोदश द्वादशशतानि ॥ एकादशदशनवाष्टौ च, षट्शतानिमप्ततिः
 षड्दशाधिकानि ॥ २५९ ॥ षट्शतान्यष्टषष्टि, पञ्चार्द्धपञ्चमत्त
 शतानि चत्वारि ॥ सार्द्धत्रीणि त्रिंशत्, सर्वं चतुर्विंशत्सहस्राणि
 द्विहीनानि ॥ २६० ॥

वीससहस्ता छमया १, वीमचउमय २ गुणीस अडमया
 ३ ॥ इगुणीसठार चउमय ५, मौलडमय ६ पनरतिमया ७
 ॥ २६१ ॥ चउदम ८ तेरम ९ वारस १०, पगागम ११ दस
 १२ नव १३ द्वा १४ मगमहसा १५, सड्वी १६ इगुवन्नसया

१७, तिमयरि १८ गुणतीम १९ वीमया २० ॥ २६२ ॥
 पना २१ पनरसि २२ गारम २३, सत्तमयाइ ४ विउविलद्धि
 मुणी ॥ मच्चअडहिय दुमया, पणयाल महस्म दो लक्खा २६ः

विंशतिमहम्मा पद्दशतानि, विंशतिश्चतु शतमेकोनविंशत्यप्प
 तानि । एकोनविंशत्यष्टादश चतु शत, पोट्ठाप्पशतपञ्चदशत्रिंशती
 ॥ २६१ ॥ चतुर्दश त्रयोदशद्वादशै—कादशदशनवाष्टसप्तसहस्रा
 षष्टिरेकपञ्चाशच्छतानि, त्रिमत्तत्वेकोनत्रिंशद्विंशतिशतानि २६ः
 पञ्चाशा पञ्चदशमादश, सप्तशतानि वैक्खियलब्धिमुनय । स
 ऽप्पच्चिद्विंशते, पञ्चचत्वारिंशत्तमहम्माणि द्वेल्ले ॥ २६३ ॥

वाडमुणिवारमहमा, सट्टुल्लमया य १ बार चउरसया २
 बारमि ३ गारम ४ तह दस, चउसय सट्टा छमट्टा वा ।
 ॥ २६४ ॥ मय छन्नवई ६ चुलमी, ७ छमयरि ८ मट्टी ९
 डवन्न १० पन्नास ११ । सगच्च दुचत्तामा, १२ छत्तीम १३
 दुतीम १४ जडवीस १५ ॥ २६५ ॥ चउवीस १६ वीस
 १७ मोलम १८, चउत्स १९ बारम २० दम २१ ड २२
 छ २३ चउरो २४ । मच्चम्मि उ लक्खो, उरीम सहमा य
 दुन्नि सया ॥ २६६ ॥

यादिमुनयोद्वात्तमहम्मा, मार्द्धपट्टशतानिद्वादशचतु शतानि ॥
 द्वात्तशैनादश तथा ऽदश, मार्द्धचतु शतानि मार्द्धपट्टशतानि वा । २६४।
 शतानि पण्णवन्निश्चतुरसीनि, पट्टमप्रति पष्टिरष्टपञ्चाशत् पञ्चा-
 शत् । समचत्वारिंशद् द्विचत्वारिंशद् वा, पट्टत्रिंशद्द्वात्रिंशदष्टावि-

- अगार्दसु अत्रदा, नाणीहि पयामिआ य जे ते अ ।
 आएमा वीरस्म य, पचमया णेगह चेसि ॥ २७१ ॥
- कुरुडुकुरुडाण नरओ, वीरगुट्टेण चालिओ मेरू ।
 तह मरुत्वी सिद्धा, अचत्त थापरा होउ ॥ २७२ ॥
- बलयागार मुत्तु, सयभुरमणमि सब आगारा ।
 मीणपउमाणएव, बहु आएमा सुअअवद्धा ॥ २७३ ॥
- अगान्निप्यवद्धा-ज्ञानिभि प्रकाशिताश्च ये ते च ।
 आदेशा वीरस्य च, पचशतान्यनेकधाऽन्येषाम् ॥ २७१ ॥
- कुरुटोत्कुरुटयो नैरधो-वीराऽङ्गुष्ठेन चालितो मेरु ।
 तथा मन्देवी सिद्धा, अत्यतस्थावरा भूत्वा ॥ २७२ ॥
- बलयागार मुक्त्वा, स्वयभूरमणे सब आकरा ।
 मीनपद्मानामेव, बहुधाऽऽदेशा सूत्राऽवद्धा ॥ २७३ ॥
- साहुगिहीण वयाड, कमेण पण वार पढमचरिमाण ।
 अनेसि चउ वारस, चउत्थ पचमवणगत्ता ॥ २७४ ॥
- साधुगृहस्थव्रतानि, क्रमेण पञ्च द्वादश प्रथमचरमयो ।
 अन्येषा चत्वारि द्वादश, चतुर्थपञ्चमव्रतयोरैक्यम् ॥ २७४ ॥
- मह्वाण हिमालिय-अदत्त मेहुणपरिग्गहनिवित्ती ।
 इय पण अणुवयाड, साहुण महवया एए ॥ २७५ ॥

श्राद्धाना हिमाऽनीना-ऽदक्षमैथुनपरिमहनितृनि ।

पत्नानि पञ्चाऽणुव्रतानि, माधूना महाव्रतान्येतानि ॥ २७५ ॥

दिसिविरड भोगउवभो-गमाण तह णत्थदढविरईअ ॥

समइयदेसावगासिय पोमह तिहिसनिभागरया ॥ २७६ ॥

दिग्बिगतिमोंगोपभोग-मान तथाऽनर्थदण्डविरतिश्च ।

सामायिक देशावकाशिक, पौषधोऽनियसविभागो व्रतानि २७६

जिणकप्पियाण चारम, चउदस थेराण मव्वतित्थेसु ।

पणवीम अजियाण, उवगरणमुवग्गहिअमुवरि ॥ २७७ ॥

जिनकल्पिकाना द्वादश, चतुर्दश स्थविराणा मर्वतीर्थेषु ।

पञ्च विंशति सार्थीना-मुपकरणमौषधिकमुपरि ॥ २७७ ॥

पत्त पत्तानधो, पायट्ठणच पायकेमरिया ।

पडलाइ रयत्ताण, च गुच्छओ पायनिज्जोगो ॥ २७८ ॥

पात्र पात्ररध, पात्रस्थापन च पात्रकेशरिना ।

पटलानि रजस्राण, च गोच्छक पात्रनियोग ॥ २७८ ॥

तिन्नेव च पच्छागा, रयहरण चैव होइ मुहपत्ती ।

चार जिणकप्पियाण, थेराण ममत्तकडिपट्टा ॥ २७९ ॥

त्रय एव प्रच्छादका-रजोहरण चैव भवति मुखपट्टी ।

द्वादश तिनकल्पिकाना, स्थविराणां समात्रकटिपट्टा ॥ २७९ ॥

उग्गहणतगपट्टो, अद्धोरू चलणिआ य बोधवा ।

अच्चिभतरवाहिनिय-मणी अ तह कचुण चैव ॥ २८०

- आंगुष्ठिय वेगच्छिय, सघाटी स्वधगरणि उवगरणा ।
 पुविल्लतेर कमठग, -सहिआ अज्जाण पणवीमा ॥ २८१ ॥
 अवप्रहाऽन्तरपट्टो-द्वोरुञ्चलनिका च योद्धव्या ।
 अभ्यन्तरर्त्राहनिय-मनी च तथा कचुकश्चय ॥ २८१ ॥
 उपकक्षिका वैकनिका, सघाटी स्वधगरण्युपकरणानि ।
 पूर्वोक्त्रयोद्देश कमठग-सहितान्यार्याणा पचविंशति ॥ २८१ ॥
 सामाह्य चारित्त, छेत्रोऽद्वावण च परिहार ।
 तद् मुहुमसपराय, अहराय पच चरणाइ ॥ २८२ ॥
 सामायिकचारित्र, छेत्रोऽपन्थापन च परिहारम् ।
 तथा सूक्ष्मसपराय, यथाग्यात पञ्च चरणानि ॥ २८२ ॥
 दुण्ड पण इअराण, तिन्निउ सामाह्य मुहुमअहरवाया ।
 जीवाइ ननतत्ता, तिन्नि हवा देवगुरुधम्मा ॥ २८३ ॥
 द्वयो पञ्चेतरेपा, जीणि तु सामायिकसूक्ष्मयथाख्यातानि ।
 जीवादि ननतत्त्वानि, त्रीण्यथवा देवगुरुधर्मा ॥ २८३ ॥
 सर्वेसि जियअजिया, पुन्न पाव च आमवोअधो ।
 सअरनिज्जरामोक्खा, पत्तेअमणेअहा तत्ता ॥ २८४ ॥
 सर्वेपा जीवाजीसौ, पुन्य पाप चाऽऽश्रवो वन्ध ।
 सअरनिर्जरामोक्षा, प्रत्येकमनक्खा तत्त्वानि ॥ २८४ ॥
 सर्वेहिचउ ममइआ, मम्मम्सुअ देममवविरईहि ।
 भणिआ सागरकोडा-कोडी सेसेसु कम्मेसु ॥ २८५ ॥

मर्वैश्रत्वारि मामायिकानि, मन्म्यक्षुतनेत्रमर्वैरतिभि ।

भणितानि सागरकोटा-कोटीकर्मसु शेषेषु ॥ २८५ ॥

दमिअ १ राइअ २ पस्तिवय ३, चउमामिअ वच्छरीअ नामाओ
दुन्ह पण पडिअमणा, मज्झिमगार्ण तु दो पढमा ॥ २८६ ॥

दैवमिअरत्रिकपात्रिअ-चातुर्माभिर मौरमरिअ नामत ।

द्वयो पञ्च प्रतिअमणानि, मध्यमगाना तु द्वे प्रथमे ॥ २८६ ॥

मूलगुणेषु अ दुण्ह १-२४ सेमाणुत्तरगुणेषु निसिभुत्त ।

दमहा दुण्ह १-२४ भणितो, चउहा अन्नेमि ठिइअप्पो २८७

मूलगुणेषु च द्वयो, शेषाणामुत्तरगुणेषु निसि भुक्कम ।

दगाधा द्वयोभणित, चतुर्द्वीअन्येषा म्थितिवल्प ॥ २८७ ॥

अचेलुक्कुदेमिय, मिजायर रायपिडफिडकम्ममे ।

वय निद्व पडिअमणे, मास पओमअणकप्पे ॥ २८८ ॥

जाचेलक्कुयौदेशिक-अय्यातरराजपिण्डकृत्तिकर्म ।

व्रतअयेष्ठप्रतिअमण, मामपर्युपणाकल्पी ॥ २८८ ॥

सिजायर पिण्डी, चाउज्जामेअ पुरिमजिद्वे अ ।

किडकम्मस्स अ करणे, चत्तारि अवट्टिआ कप्पा ॥ २८९ ॥

अय्यातरस्य पिण्डे, चतुर्णामे च पुरुपयेष्ठे च ।

कृत्तिकर्मणश्च वरणे, चत्वारोअवग्ग्थिता कल्पा ॥ २८९ ॥

पडिकमण १ निनु २ हेसिय ३, चेलुके ४ मास ५
वच्छरिय कप्पे ६ । छद्दा अट्टिडकप्पो, मज्झिमगाण २२
न इअराण ॥ २९० ॥

प्रतिक्रमणनृपोहेपिकाऽऽ-चेलुकेमाससावत्सरिककल्पा ।
पोटाऽस्थितिरल्पो-मध्यमकाना नेतरेपाम् ॥ २९० ॥

पुरिमस्स ९ दुविसुज्झो, चरमस्स अ दुरणुपालणोकप्पो ।
मज्झिमगाण २२ मुणीण, सुविसुज्झो सुहणुपालणओ ॥२९१॥

प्रथमस्य दुर्विशोध्य-श्चरमस्य च दुरनुपाल्य कल्प ।
मध्यमकाना मुनीना, सुविगोध्य सुखाऽनुपाल्य ॥ २९१ ॥

ममइयचउवीमत्थय-वदणपडिकमणकाउसग्गा य ।
पच्चक्काण भणिज, जिणेहि आवस्सय छद्दा ॥ २९२ ॥

ते दुण्ह सय दुकाल, इअराण कारणे इओ मुणिणो ।
पढमिअरवीरतित्थ, रिउजडरिउपन्नवक्कजडा ॥ २९३ ॥

मामायिकचतुविशतिस्सव-वदनप्रतिक्रमणकायोत्सर्गाश्च ।
प्रत्यारयान भणिज, निनैरावइयक् पोटा ॥२९४॥

तद्दुदयो मदा डिकाल-मितरेपा कारणे इतो मुनय ॥
प्रथमेतरवीरतीर्थे, ऋजुजडऋजुप्राज्ञवक्कजडा ॥ २९३ ॥

पचामववेरमण, पच्चिदियनिग्गहो कमायजओ ।
दडत्तिगाउ विरई, मतरमहा सजमो इअ वा ॥ २९४ ॥

पञ्चाऽऽश्रवविरमण, पञ्चेन्द्रियनिग्रह कपायजय ।

शण्डत्रिकाद्विरति, समन्तश्या सचमोऽथवा ॥ २९४ ॥

पुढवि १ दग २ जगणि २ मारुअ ४, वणसइ ५ वि ६
ति ७ चउ ८ पणिंदि ९ अञ्जीवे १० ॥ पेहु ११ प्पेह १२
पमजण १३, परिठवण १४ मणो १२ वई १३ काए १७ ॥ २९५ ॥

पृष्णयुदनाप्रिमारुत-यात्स्पतिद्वित्रिचतु पञ्चेन्द्रियाऽञ्जीवा ।

प्रेयोत्प्रक्षाप्रमार्जन-परिष्ठापनमनोवाङ्मया ॥ २९५ ॥

दुप्पडिलेहिअ दूम, अद्धाणाइ विचित्तगिम्हति ॥

गिण्ड पुत्थयपणग, कालिअनिञ्जुत्तिकोसद्ध ॥ १ ॥

चइ तेमि जीवाण, तत्थगयाण थ सोणिअ हुत्ता ॥

पणिञ्जते धणिअ, गलिञ्ज त अक्खरणुमिउ ॥ १ ॥

राण सील च तपो-भापो एव चउद्विहोधम्मो ॥

सव्वजिणेहिं भणिओ, तहा दुहा सुअचरित्तेहिं ॥ २९६ ॥

गान सील च तपो-भाव एव चतुर्विधो धर्म ॥

सर्वजिनैर्भणित-स्तथा द्विधा श्रुतचारित्राभ्याम् ॥ २९६ ॥

गुरिमतिमत्तियमु, ओहनिजुत्तीडभणिअपरिमाण ॥

सिअण्ण्य, इअराण, वन्नपमाणेहिं जहलद्ध ॥ २९७ ॥

प्रथमाऽन्तिमतीधपु, ओघनियुग्गिभणितपरिमाणम् ॥

श्वेतवस्त्रमितरेषा. उर्णप्रमाणैर्यधान्धम ॥ २९७ ॥

जहजुग कुमरनिन्द-चकीकालेहि होइ गिहिकालो ।
 वयकालाओ केवलि-कालो छउमन्थकालूणो ॥ २९८ ॥
 यथायोग्य कुमरनृपति-चक्रिकालेभयति गृहिकाल ।
 प्रतकालत केवलि-कालश्छदूमस्थकालोन ॥ २९८ ॥
 पुषाण लम्बमेग, त पुषगूण त सगजिणाण ॥
 पुण पुण चउजगूण, तो पुषसहस्सपणवीस ॥ २९९ ॥
 ममलम्बा इगवीस, चउपन्नापनर सङ्गुमचेव ॥
 मङ्गुदुग तो महमा, पणवीस पउणचउवीस ॥ ३०० ॥
 इगवीस चउपन्ना, सनरमया सङ्गुसत्त सङ्गुदुग ।
 तो सत्तमया सयरी, दुचत्तमासाणि वयकालो ॥ ३०१ ॥
 पूर्वाणा लभमेक, तत्पूर्वाङ्गोन तत्सप्तनिनानाम् ॥
 पुन पुनश्चतुरङ्गोन, तत पूर्वमहन्नपञ्चविंशति ॥ ३०१ ॥
 समलक्षा ण्कविंशति-श्चतु पञ्चाशतपञ्चदशसार्द्धसप्तैव ।
 सार्द्धे तत सहस्रा, पञ्चविंशति पादोनचतुविंशति ॥ ३०० ॥
 षट्त्रिंशतिश्चतु पञ्चाश-त्सप्तशतानि सार्द्धमप्त सार्द्धे ॥
 तत सप्तशतानि सप्तति-द्विचत्वारिंशद् वर्षाणि प्रतकाल ॥ ३०१ ॥
 मवाउ चुलसि १ निमयनि २-मठि ३ पन्ना ४ चत्त ५
 तीम ६ वीम ७ म्म ८ ॥ टो ९ एगपुष लक्खा १०, सम
 चुलमी ११ विमयरी १२ मङ्गी १३ ॥ ३०२ ॥ तीस १४

दम १५ एगलकखा १६, परिमाण महम पण नवड १७
 चुल्मी १८ ॥ पणपन्न १९ तीम २० दस २१ डग २२-
 महमा गरिम सय २३ दुगमयरी २४ ॥ ३०३ ॥

सर्वायुश्चतुरातीति १ द्विसप्तति २, पष्टि ३ पञ्चाशत्
 ४ चत्वारिंशत् ५ त्रिंशद् ६ विंशति ७ दश ८ ॥ द्वये ९
 कूर्पर १० समा-श्चतुरातीति ११ द्विसप्तति १३ पष्टि १३
 ॥३००॥ त्रिंशद् १४ दश १५ ऋत्तर्षाणा १६, महस्त्राणि
 पञ्चनयति १७ अचतुरातीति १८ । पञ्चपञ्चाशत् १९ त्रिंशद् २०
 ती २१ क-सहस्त्राणि २२ वर्षशत २३ द्विसप्तति २४ ॥३०३॥

चुल्मीइ गरिम लम्बा, पुव्वग तग्गुणभवे पुव्व ॥
 त मयरिकोडिलकखा, वरिमा छप्पनसहसकोडी ॥ ३०४ ॥

चतुरातीतिवर्षेत्था, पूर्वाङ्क नद्गुण भवेत्तु पूव्वम ॥
 तत्तसप्ततिकोटिलक्षा-वर्षाणिपट्पञ्चाशत्सहस्रकोटी ॥ ३०३॥

पुव्वगहयपुव्व, तुडियग तसकोडिकोडीयां ॥
 गुणमट्टिलकख मगवी-मसहम चत्ता य रिमहाड ॥३०५॥

पूर्वाङ्कहतपूव, तुटिताङ्क वर्षकोटिकोन्व ॥
 एकोनपष्टिलक्षा, सप्तविंशतिसहस्राश्चत्वारिंशत्पभायु ॥३०५॥

माहस्सकिण्हतेरमि, दोसु मिअचित्तपचमी नेआ ।
 चहमाहसुद्धअट्टमि, तद्वचित्तसुद्धनवमी अ ॥ ३०६ ॥

कसिणामग्गहारमि, फग्गुण भद्वय सत्तमी किण्हा ।
 भद्वयमुद्धनरमी, वइमाह उहुलवीया अ ॥ ३०७ ॥
 कसिणा मावण तइया, आमाढे तहय चउदसी सुद्धा ॥
 जासाढकमिणसत्तमि, मिअपचमिचित्तजिद्धेसु ॥ ३०८ ॥
 जिद्धेकमिणातेरमि, उडमाहपडिय मग्गसिअदसमी ॥
 फग्गुणसुद्ध दुजालमि, किण्हा नरमीअ जिद्धस्म ॥ ३०९ ॥
 वइमाहअमिअ दममी, आमाढे मावणेऽट्टमी सुद्धा ।
 वत्तियमारसि सिवमा-ममाइ भणिजा जिणिंदाण ॥ ३१० ॥
 मावस्य कृष्णप्रयोत्ती, द्वयो सितचैत्रपञ्चमी हेया ॥
 वैशाखगुद्धाऽष्टमी, तथा चैत्रे शुद्धनरमी च ॥ ३०६ ॥
 कृष्णा मार्गेशात्ती, फाल्गुनभाद्रपदसप्तमी कृष्णा ।
 भाद्रपदगुद्धनवमी, वैशाखे उहुलद्वितीया च ॥ ३०७ ॥
 कृष्णा धाराणतृतीया, आपाढ तथा च चतुर्दशी शुद्धा ॥
 आपाढकृष्णसप्तमी, मितपञ्चमी चैत्रज्येष्ठयो ॥ ३०८ ॥
 जेष्ठेकृष्णप्रयोत्ती, वैशाखे प्रतिपद् मार्गमितदशमी ॥
 फाल्गुनशुद्धद्वात्ती, कृष्णा नरमी च ज्येष्ठस्य ॥ ३०९ ॥
 वैशाखेऽसितदशमी, आपाढे धारणेऽष्टमा शुद्धा ।
 कार्तिकाऽमावास्या शिवमा-मात्यो भणिता जिनेन्द्राणाम् ॥ ३१० ॥

अभिद्र १ मिगामिर २ अदा ३, पुम्म ४ पुणञ्चसुअ ५
 चित्त ६ अथुराहा ७, जिद्धा ८ मूलं ९ पुच्चा-माना १०

घण्टि ११ चरामहा १२ ॥ ३११ ॥ रेवड १३ रेवड १४
 पुस्मो १५, भरणी १६ कृत्तिय १७ सरैवड १८ भरणी
 १९ । सवण २० स्मिणि २१ चित्त २२ निमा-ह २३ माड
 २४ निणमुक्ख नक्खत्ता ॥ ३१२ ॥

अभिजिन्मृगशीर्षा, पुष्यपुनर्वसु च चित्राऽनुराधा ॥

चैत्रामूल पूर्वा-पादाधनिष्ठोत्तराभाद्रपदा ॥ ३११ ॥

रेवती रेवती पुष्य, भरणी कृत्तिका रेवती च भरणी ॥

श्रवणोऽश्विनीचित्राविशाखा, स्वातिर्जिनमोक्षनश्रघ्राणि ॥ ३१० ॥

मयरो १ चमहो २ मिहुणो, ३ दुसु कक्कड ४ — ५ कण्ह
 ६ दुसु अलीअ ७-८ धणू ॥ १० धणु कुमो ११ तिसुमीणो, १२
 -१३- १४ कक्कड १५ मेसो १६ उत्तह १७ मीणो १८ ॥
 ३१३ ॥ मेसो १९ मयरो २० मेसो २१, तिसु तुल २२-
 २३-२४ एणउ सुक्खरामीओ ॥ कयजोगनिरोहाण, सुक्ख-
 द्वाणा जिणाण इमे ॥ ३१४ ॥

मफरो १ वृषभो २ मिथुनो, ३ द्वयो कर्कट ४-५
 कन्या ६ द्वयोरलि ७-८ र्घनु ९ ॥ धनु १० कुम्भ ११
 म्रिपु मीन, १२-१३-१४ कर्कट १५ मेपौ १६ वृषभ १७
 मीनौ १८ ॥ ३१३ ॥ मेपो १९ मफरो २० मेप-२१ म्रिपु
 तुलै-२२-२३-२४ ते तु मोअरसय ॥ कृतयोगनिरोधाना,
 मोअस्थानानि त्रिनानामिमानि ॥ ३१४ ॥

अट्टावयमि उसहो, वीरो पापाड रेवण नेमी ॥
चपाड वासुपुञ्जो, समेण सेमजिण सिद्धा ॥ ३१५ ॥
अष्टापद ऋषभो-वीरोऽपापाया रेवते नेमि ॥
चम्पाया वासुपूज्य, मम्मते शेषविना सिद्धा ॥ ३१५ ॥
वीरोमहनेमीण, पलिअक सेमयाण उस्मग्गो ॥
पलिअकामणमाण, मदेहमाणा तिभागूण ॥ ३१६ ॥
वीरर्षभनेमीना, पर्यद्ध शेषकाणामुत्तमर्ग ॥
पयङ्कासत्मान, स्पन्देहमानात् त्रिभागोणम् ॥ ३१६ ॥
सवेमि सिरोगाहण, तिभागउणा निआसणपमाणा ॥
पुरिमतिमाण चउदम, छट्ठा सेसाणमामतवो ॥ ३१७ ॥
सर्वेणा शिवाऽग्गाहना, त्रिभागोना निजामनप्रमाणात् ॥
प्रथमात्तिमयोश्चतुर्दश, पष्ठ शेषाणा मासतप ॥ ३१७ ॥
उगहस्स दमसहस्सा, विमलस्म थ उच्च सत्तणतस्म ॥
सतिस्म नवमयाइ, मह्ठिसुपामाण पचमया ॥ ३१८ ॥
पउमस्म तिसय अडहिय, नेमिनिणिदस्म पणमयछतीमा ।
धम्मस्म अडहियसय, छमयाइ वासुपुञ्जस्म ॥ ३१९ ॥
पामस्म तितीममुणी, वीरस्म य नत्थि सहस सेमाण ॥
अडतीम महम चउमय, पणसीई मत्तपरिरारे ॥ ३२० ॥
ऋषभस्य स्यासहस्रा-विमलस्य पट्च मत्ताऽनन्तस्य ॥
शान्तेर्नवगतानि, मह्ठिसुपाश्चयो पञ्चशतानि ॥ ३१८ ॥

पद्मस्य त्रिशत्यष्टाधिका-नमिजिनेन्द्रस्य पञ्चशतपट्त्रिंशत् ॥

धर्मस्याष्टाऽधिकशत, पद्मशतानि वासुपूज्यस्य ॥ २१९ ॥

पार्श्वस्य त्रयस्त्रिंशत् मुनयो-वीरस्म च नास्ति सहस्र शेषाणाम् ॥

अष्टत्रिंशत्सहस्रचतु शतानि, पञ्चाङ्गीति सर्वपरिवार ॥ २०० ॥

अवरणह मिद्विगया-सभवपउमाभमुविहिरसुपुजा ॥

सेसा उमहार्इया, सेयसता उ पुवण्ह ॥ ३२१ ॥

धम्मअरनमीवीरा-ऽपररत्ते पुवरत्तण सेमा ॥

पुव ३ मुक्खअरया-सेसमवि त तु निअनिआउ विणा ३२२

अपराण्हे सिद्धिगता , सभवपद्माभमुविहिरसुपूया ॥

शेषा ऋपमान्िका , श्रेयासान्तास्तु पूर्वाण्हे ॥ २०१ ॥

धर्माऽरनमिवीरा-अपररात्रे पूर्वरत्रे शेषा ॥

पूर्ववन्मोक्षारका , शेषमपि तत्तु निननिनाऽऽयुर्विना ॥ २२२ ॥

साहूणसिद्धिगमण, असग्व१ अड २ चउ४ति ३सखपुरिस५जा ॥

सनायमुमह १ नेमी २, पाम ३ तिम ४ सेम ५ मुक्खाओ ३०३

साधूना मिद्विगमन-मसद्गयाऽष्टचतुस्त्रिमख्यपुरुष यावत् ।

सनातमृपभनेमि-पार्श्वान्तिमशेषमोषेभ्य ॥ ३०३ ॥

तेसिं चिय नाणाओ, मुणीण गयकम्मयाण मिद्विगमो ॥

अतमुहुत्ते दु ति चउ-यरिसेमु इगण्णिणार्इसु ॥ ३२४ ॥

तेषा चैव ज्ञानान्-मुनीना गतकर्मकाणा मिद्विगम ॥

अतमुहुत्ते द्वित्रिचतु-वर्षेण्वेकत्तिनादिपु ॥ ३०४ ॥

सुमुणि सुमावगरुचो, सुकम्बपहोग्यणतिगमरुचो वा ॥
सञ्चनिणेहि भणिओ, पचरिहो मुक्खविणओ वि ॥ ३२५ ॥

सुमुनिसुश्रावरुचो—मोत्तपथो रत्तत्रिकरुचो वा ॥
सञ्चनिनेन्द्रैर्भणित, पञ्चविओ मोक्षविनयोऽपि ॥ ३२५ ॥

दमणनाणचरित्तं, तवेय तह ओत्तयारिए चेत्त ॥
एसो ह्नु मुक्खविणओ, दुहा व गिहिमुणिकिरियरुचो ॥ ३२६ ॥

दण्णानाणचारित्त, तपश्च तथोपकाग्गिा चैव ॥
एप हि मोक्षविनयो—द्विधा वा गृहिमुनिकिरियारुच ॥ ३२६ ॥

पुब्बपणित्ति जिणाण, असरत्तकालो इहासि जा कुधु ॥
पास जा सखिओ, वरिम्महस्स तु वीरस्स ॥ ३२७ ॥

पूर्वप्रवृत्तिर्जिनाना—मसरत्तकालोऽत्रासीदाकुन्धु ॥
पाश्चात्तत्तसरयेयो—उर्ध्वमहम्भ तु वीरस्य ॥ ३२७ ॥

एमेत्त छेअकालो, नवर वीरस्स वीससमसहमा ॥
पामम्म नत्थि सोत्ता, सेससुअपणित्ति जा तित्थ ॥ ३२८ ॥

एवमेव च्छेदकाला—नवर वीरस्य विंशति समा महम्भाणि ।
पार्श्वस्य नास्ति स वा, शेषश्रुतप्रवृत्तिर्यावत्तीर्थम् ॥ ३२८ ॥

जम्माजम्मोजम्मा, मिवसिन्ना जम्म मुक्खओ मुक्खो ॥
इअ चउ जिणतराह, इत्थ चउत्थ तु नायव्व ॥ ३२९ ॥
इह पद्म १ तीस २ दम ३ नव ४, कोडिलक्खा

कोडि महम नर ५ नर ६ ॥ अयरनत्रमोडिसय ७, नव-
 डकोडि ८ नरमोडि ९ इम कोडी ॥ ३३० ॥ अयरमय-
 रिमठावडि, लक्यठवीस महम ऊण पर ॥ १० ॥ चउपन्न
 ११ तीम १२ नव १३ चउ १४, तिअअयरापउणपलिऊणा
 १५ ॥ ३३१ ॥ पलि अद्र १६ कोडि मह-स्म ररिम ऊणोय
 पलिअ चउमागो १७ ॥ ररिमाण कोडि सहमो २८, लकवा
 चउपत्र १९ ठ २० प्यच २१ ॥ ३३२ ॥ पउण चुलसीड
 सहमा २२, अद्राड मयत्ति २३ जतर तिवीसे ॥ २४ ॥
 अयरगमोडि मोडि, वायाल महम्मसरिखणा ॥ ३३३ ॥

जन्मतो जन्म जन्मत, शिव शिवाज्जन्म मोश्रतो मोश्र ।
 इति चत्वारि जिनान्तरा-ण्यत्र चतुर्थं तु ज्ञातव्यम् ॥ ३२९ ॥
 अत्रपञ्चाशत् १ त्रिशद् २ दश ३ नव ४, कोटिलक्ष कोटिमह-
 म्नवतिनत्र ॥ सागरनत्रमोडिगत, नवति कोटिीय काटिरेफ-
 कोटी ॥ ३३० ॥ मागरशनवर्ष पद् पष्टि-लक्ष पद्द्विंशतिमह-
 म्शोना पर ॥ चतु पञ्चाशत् ११ त्रिशद् १२ तय १३
 चतु-स्रयसागरा पादोनपन्थोना १५ ॥ ३३१ ॥ पन्थास १६
 कोटिसहस्र-वर्षोन्नो य पन्थश्चतुर्थभाग । १७ वर्षाणा कोटि-
 सहस्राणि १८, लक्ष चतु पञ्चाशत् १९ पद् २० पञ्च २१
 ॥ ३३२ ॥ पादोनचतुरशीतिमहस्राणि, सार्द्धद्विंशतगिरान्तं प्रयो
 विंगने ॥ मागरैककोटाकोटी, द्विचत्वारिंशत्महस्रवर्षोना ॥ ३३३ ॥

उसह मरीइपमुहा, सिरिवम्म निवाइया गुपामजिणे ॥

हरिसेण विस्मभूर्ई, सीयल ति धमि जिणजीया ॥ ३३४ ॥

सेअसे सिरिकऊ, तिनिट्टमरुभृड अमियतेअधणा ॥
 वसुपुजे नदण न-द सख मिद्धत्थ मिरिवम्मा ॥ ३३५ ॥

सुवण रावणनाम्य-नामा नेमिमि कण्हपमुहा य ।
 पासं अण्ड मच्चट, आणटा वीरिमेणियार्दिया ॥ ३३६ ॥

ऋषभे मराचिप्रमुरा, रीरमेनृपादय मुपार्श्वजिने ॥
 हरिपेणमिश्चभती नीतलतीर्थ जिननीवौ ॥ ३३७ ॥

श्रेयामे श्रात्रेतु-स्त्रिपृष्ठमभूत्यमिततेजोवना ॥
 वामुपुत्रे नन् नन्-शद्धमिद्धावर्धश्रीवर्माण ॥ ३३८ ॥

सुव्रते रावणनाम्य-नामानौ नमौ कृष्णप्रमुराश्च ॥
 पार्श्वेऽनन्वस्तयस्या-नन् वीरे श्रणिकादय ॥ ३३९ ॥

सेणिय १ मुपाम २ पोड्डिल ३-उदाइ ४ सरसे ५ दढाउ ६ मयग य ।
 ७ रघइ ८ सुलमा ९ नीर-म्स १० उद्धतित्थत्तणा नवओ । ३३७

श्रेणिमुपार्श्वपोड्डिलो-दायिदहा दढायु गतवौ च ॥

रेवती मुग्गा वीर-स्य चद्धतीर्थकृत्त्वा नर ॥ ३३७ ॥

भीमारलि १ नियमत्तू २, रुदो ९ विस्मानलो १० य
 सुपड्डो ११ ॥ अयलो १२ अ पुडरिओ १३, अजिअवरो १४
 अजिअनामो य १५ ॥ ३३८ ॥ पदालो १६ तह मच्चड २४,
 एए रदा इगारसगधरा ॥ उमहाजिअसुचिहार्ड, अडजिण
 सिरिवीरतिथमवा ॥ ३३९ ॥

भीमावलिचितशत्र, रूदो विश्वानलश्च सुप्रनिष्ठ ॥

अचलश्च पुण्डरीको-चितवरोऽनितनाभश्च ॥ ३३८ ॥

पतालस्तथा सत्यकि-रेते ऋद्रा एकादशाऽङ्गधरा ॥

श्रपभाऽजितसुरिध्या-शष्टनिनश्रीवीरतीर्थमवा ॥ ३३९ ॥

वज्रण सइव सख, वज्रतियनाहिआण बुद्धाण ।

वदसमियाण वि मय, इमाह मग दरिमणाह रुमा ॥३४०॥

नित्रि उमहस्म तित्थे, जायाइ सीअलस्म ते दुनि ॥

दरिमणमैग पाम-स्म सत्तम वीरतित्थमि ॥ ३४१ ॥

जैन शैव साङ्ख्य, वेदान्तिकनास्तिमाना बौद्धानाम् ॥

वैशेषिकानामपिमत्-मिमानी मत्त र्गानानि क्रमान् ॥ ३४० ॥

त्रीणि श्रपभस्य तीर्थ, जातानि नीतलस्य ते चोभे ॥

दर्शनमेक पार्श्व-म्य मप्रम वीरतीर्थे च ॥ ३४८ ॥

अद्भुत्तरमय सिद्धि, पूया अस्सजयाण हरिवमो ॥

थीस्वोतित्थयरो, कण्हावररुग्गमण च ॥ ३४२ ॥

गन्धमहास्वसग्गा, चमरुप्पाओ अभाविआ परिसा ॥

समिसूरजिमाणागम, अणत्तकालिअ दमच्छेरा ॥ ३४३ ॥

अष्टोत्तरशतसिद्धि, पूजाऽस्यतीना हरिवश ॥

श्रीरूपतीर्थवर, कृष्णाऽपररुक्कागमन च ॥ ३४२ ॥

गर्भापहारोपसर्गा-श्रमरोपातोऽभाविता परिपद् ॥

शानिसूर्यविमानागमन-मनत्तकाले ऋद्राऽऽवर्याणि ॥ ३४३ ॥

मिरिरिमह सुत्रिहिसीयल, मल्लीनेमीण कालि तित्थे वा ॥

जमर्जिसु पणच्छेरा, क्रमेण वीरस्म पचऽन्ने ॥ ३४४ ॥

श्रीश्रपभसुविधिशीतल-मल्लीनेमीना काले तीर्थे वा ॥

अभूवन् पञ्चाश्र्याणि, क्रमेण वीरस्य पञ्चान्यानि ॥ ३४४ ॥

गुरुलघुमज्झमतणुणो, पुरिमा दो चउमयं च अट्टहिय ॥
 मिज्झति एगममए, सुआउ नेओ विसमत्थो ॥ ३४५ ॥
 गुरुलघुमध्यमतनुका, पुरपौद्वी चतु शत चाऽष्टाधिकम् ॥
 मिध्यन्त्यरुसमय, श्रुताग्नेयो विशेषार्थ ॥ ३४५ ॥
 एरुममयण जुगव, उमीमोगाहणाइ ज मिद्धा ॥
 उमहो न्ननरइमुआ, भरहट्टमुजा अ त पढम ॥ ३४६ ॥
 एरुममयत युगप-दुत्तृष्टावगाहनया यत् मिद्धा ॥
 ऋपभोननयतिमुता-भरताप्रसुताश्चतत्प्रथमम् ॥ ३४६ ॥
 सीजलतित्वे हरिणा-मजुयलिगो पुब्बवेरिअमरेण ॥
 रज्ज ठपिगी तरो, हरिवमोसेमपयडत्था ॥ ३४७ ॥
 गीतलतीव हरिय-पयुगलिकः पृत्रवैयमरेण ॥
 गज्ये स्थापिनस्ततो-अरिचअ शेप प्रगटार्यम् ॥ ३४७ ॥
 चकी भरहो मगरो, मघन मणवुमरसतिकुधुअरा ॥
 सुभुममहपउम हरिसे-ण जयनिपोप्रभदत्तोअ ॥ ३४८ ॥
 चकी भरत मगरो, मघना सनत्तुमारगान्ती कुधुरर ॥
 सुभूमो महापद्मो-हरिपेणो जयनृपो ब्रह्मन्तश्च ॥ ३४८ ॥
 पिण्डु तिविद्धु दुपिद्धु, मयभुपुरिसुत्तमेपरिममीहे ॥
 तहपुरिमपुडरीए, दत्ते लकरमण कण्हअ ॥ ३४९ ॥
 विष्णुस्त्रिष्टो द्विष्ट, स्वयम्भु पुरुपोत्तम पुरुपसिह ॥
 तथा पुरुपपुण्डरीको-दत्तो लमण वृणश्च ॥ ३४९ ॥
 हरिजिद्धभायगेनव, बलदेवा अयल विजयभदाअ ॥
 सुप्पहसुम्मणाण-दनदणा रामवलभदा ॥ ३५० ॥

हरिस्त्रेप्रभानरो नव, बलदेवा अचलविचयभद्राश्च ॥

सुप्रममुदर्शनानन्दनन्ना रामबलभद्रौ ॥ ३५० ॥

चउपन्नुचमपुरिमा, इह एए हृति जीवपन्नास ॥

नयपठिनिणहृदि जुआ-तेमट्टि सिलागपुरिस भवे ॥३५१॥

चनु पञ्चागदुत्तमपुरुषा-अत्रैते भवन्ति जीवपञ्चाशत् ॥

नयप्रतिविष्णुभिर्युक्ता-स्त्रिपष्टि शलाकापुरुषा भवेयु ॥ ३५१ ॥

ते आसगीव तारय, मेरय महुकेठवे निसुमेअ ॥

बलिपहराए तह रा-वणे अ नयमे जरामिंधू ॥ ३५२ ॥

तेऽधमीवस्तारको-मेरजोमधुकैटभौ निशुम्भश्च ॥

बलि प्रत्यादस्तथा रा-वणश्च नयमोजरामिंधु ॥ ३५२ ॥

कालमि ने जस्म निणस्म जाया, ते तस्म तित्थमि जिणतरं जे ॥

नेआउ ते तीअ निणस्म तित्थ, निएहिं नामेहिं रुमेण एव ॥३५३॥

काले हि ये यस्य निनस्य जाता-स्ते नस्य तीर्थे च निनान्तरे ये ॥

झेयास्तुतेऽतीतनिनस्य तीर्थे निनेन नाम्नाऽनुक्रमेण एवम् ॥३५३॥

दो तित्थेम मचकि अट्टअ जिणा तो पच केसीजुआ,

तो चफाहिन तिच्चिचकि अ जिणा तोकेमिचकी हरी ॥

तिथमोइगुतोमचकि अ जिणो केमी मचकी जिणो,

चकी केमवसजुओ निणवरो चकीअ तो दो जिणा ॥३५४॥

दो तीर्थेशौ मचक्रिणाषट् च जिनास्तत पञ्च केशियुता-

स्ततश्चक्राधिपौ त्रयश्चक्रिणश्च जिनास्तत केगीचकीहरि ॥

तीर्थेऽण्णस्तत मचकी च निनस्तत केगी मचकी निन-

श्चकीकेशावमयुता निनवरश्चकी ततो द्वौ जिणौ ॥ ३५४ ॥

इह विमयारि सपरहेहा, उड्डु तिरिअ तु ठपसु सगवीसा ॥

इमयारि सउ छवोमा, धरकभवमाइसखकण ॥ ३५५ ॥

इह द्विसप्रतिगत रेगा--ऊर्द्धाम्निरश्चीस्तु स्थापय सप्तविंशतिम् ।

एकसप्तविंशतपट्टविंशति-गृहाणि भवादिसख्याकृते ॥ ३५५ ॥

सुहृगहणदानग्राहण-धारणपुच्छणकएत्ति मगहिआ ।

विणमतरिमय ठाणा-जहामुअ धम्मघोससूरीहिं ॥ ३५६ ॥

सुपप्रहणदानग्राहण-धारणपुच्छणकृते सगृहीतानि ॥

विणमत्ततिशत स्थानानि, यथाश्रुत धर्मघोपसूरिभि ॥ ३५६ ॥

अ मडमोहाइवमा, उणं अहियव इह मए लिहिअ ॥

त सुअहरेहि सब, खमियव्व सोहियव्व च ॥ ३५७ ॥

यमतिमोहादियगात्, न्यूनमधिक चाऽत्र मया लिखितम् ॥

तच्छ्रुतधरैश्च सर्वं, क्षन्तव्यं शोषितव्यं च ॥ ३५७ ॥

तरहमयसगसीए, लिहिअमिण सोमतिलयसूरीहिं ॥

अ भत्थणाए हेम-स्म सघवडनयणतणयस्म ॥ ३५८ ॥

त्रयोदशशतमत्तानीतितमे, लिखितमिदमोमतिलयसूरिभि ॥

अभ्ययनया हेम-स्यसघपत्तिरत्तातनयस्य ॥ ३५८ ॥

सतरिमयपमाणे जो जिणाण्येअ ठाणे,

पडइ सुणइ क्षाणे ठावए वा पहाणे ॥

लह्हुदरिमण नाणे पाविऊण अमाणे,

परमसुहनिहाणे जाइ सो सिद्धिठाणे

॥ ३५९ ॥

सप्तविंशतप्रमाणानि यो जिनस्थानानि,

पठति शृणोति ध्याने स्थापयेद्वा प्रधाने ॥

लघु दर्शनज्ञाने प्राप्य मानेन हीने,
परममुरनिधाने यात्यमौ मिद्विधाम्नि ॥ ३५९ ॥

मत्ततिशतकस्थान-च्छायेय विहिता शुभा ।
बुद्धिप्रमात्रिणी जीयात्-ऋद्धिमागरसुरिणा ॥

प्रशस्ति

श्रीमन्महावीरजिनेन्द्रशामने, प्रशस्तिपात्र तपगच्छपादप ।
अनेकशाखाभिगमौ विराजते, मद्धर्मसुस्वादुफलप्रदायक ॥१॥
तदीयमच्छायममाश्रितोऽभू-च्छ्रीहीरसुरिर्जगदेकपूज्य ।
पट्टे तदीये च परम्परातः, सवेगिपुरयोमुनिनेमिमागर ॥
तत्पादपट्टेऽहपद्पदश्री, मम्यरूक्रियोद्धारविधानदक्ष ।
लक्ष्मीकृताऽऽत्मोन्नतिधर्मधीरो-निर्मानमोहोरविसागरोऽभूत् ॥३॥
तच्छिष्यमुरय मुखमागर सुधी-श्वारित्रचूडामणिशान्तमानस
व्यराजताऽखण्डितगुद्धभावन, मम्यक्त्वतन्मार्थविदासुमन्मत
तत्पट्टपूर्वाचलतिग्मरश्मि, पर शतग्रन्थविधायकोऽभूत् ।
योगीन्द्रपूज्य क्षतर्म्मराशि, कृताग्रधान शिवदक्रियायाम् ॥४॥
सर्वेषु जीवेषु ममानभाव, श्रीबुद्धिपाथोनिधिद्वरिवर्य ।
यद्वाचनम्भोनिधिमज्जनेन, जात पत्रिज जगदण्डमेतत् ॥६॥
तत्पट्टपूर्वाचलभानुमाली, यभूव श्रीमानजिताऽन्घिसुरि ।
गुरुप्रतापेन ततान सोऽपि, ग्रन्थाननल्पान् स्वमतिप्रभावात् ॥
तच्छामने श्रीयुतबुद्धिसुरि-क्रमाऽञ्जरेणूदपि ऋद्धिसुरि ।
छायार्थनाद सुगम ततान, सुखाऽवबोधाय सतां जनानाम् ॥८॥

॥ समाप्तः ॥

॥ श्रीमद्भ्योगनिष्ठपरमगुरुरुद्धिमागरसूरीश्वरेभ्योनमः ॥

आत्म साधना.

(स योगेश्वर मुनि जयसागर)

ॐ अहम्

पद्मगे च सुरेन्द्रे च कौण्डिके पात्मसृष्टि ।
निर्विण्णैपमनस्त्राय श्रीश्रीरक्षामिने नम ॥ १ ॥

वधुर्न न स भगवान् रिपवोऽपि नान्ये,
माश्राप्तं हृष्टचरं गहनमोऽपि वैपाम ।
श्रुत्या वच मुचरितं च पृथग्भिनोय,
वीर गुणाऽतिशयलोलतया मिताः स्म ॥ १ ॥

भावार्थ — श्री भद्रापीठ भगवान् अमारा वधु नथी तेमध
न्य (देवो) पल अमारा शत्रु नथी, अमानो वेडं अकपल
रूपे नाशात् नयेस नथी, परतु वचन अने मुखरितनी विशेष
लेखना आभगी अधिष्ठ गुणोनी लोचुपना वडे भद्रापीठ
देवने अभाये आशय दीधो छे ॥ १ ॥

पद्मपातो न मे शीरे, न द्वेष कपिलादिषु ।
प्रकितमद्वेषनं धर्म्यं, तस्य कार्यं परिग्रह ॥ २ ॥

ભાવાર્થ — શ્રી વીરપ્રભુને વિષે મ્હારો પક્ષપાત નથી તેમજ કપિલાદિકને વિષે દ્વેષ નથી, પરંતુ જેનું યુક્તિ મત-શરૂ સમત-અવિરૂદ્ધ વચન હોય તે દેવનો સ્વીકાર કરવો ॥ ૨ ॥

હરિભદ્રસૂત્રિ

સ્વાગમ રાગમાત્રેણ, દ્વેષમાત્રાત્ પરાગમમ્ ।

ન શ્રયામસ્ત્યજામો વા, કિન્તુ મધ્યસ્થયા દશા ॥ ૩ ॥

ભાવાર્થ — માત્ર રાગથી પોતાના આગમનો અમે આશ્રય કરતા નથી અને દ્વેષમાત્રથી પર આગમનો ત્યાગ કરતા નથી પરંતુ મધ્યમ્ય દષ્ટિ વડે સ્વીકાર અને અનાદર કરીએ છીએ ॥ ૩ ॥

યશોવિજય ઉપાધ્યાય

સ્યાદ્વાદો વર્તેતે યસ્મિન્, પક્ષપાતો ન વિદ્યતે ।

નાસ્ત્યન્યપીડન કિચ્છિત્, જૈનધમ સ ડચ્યતે ॥ ૪ ॥

ભાવાર્થ — જેની અદર આદરા-અનેકાતવાદ રહેલો હોય તેમજ પક્ષપાત ન દેખાતો હોય અને કિચ્છિત્ માત્ર પણ અન્ય પ્રાણીઓનું પીડન ન હોય તે જૈન ધર્મ કહેવાય છે ॥ ૪ ॥

મહાવ્રતધરા ધીરા-મૈક્ષ્યમાત્રોપજીવિન ।

સામાયિકસ્થા ધર્મોપ-વેદાના ગુરવો મતા ॥ ૫ ॥

ભાવાર્થ — પચ મહાવ્રતને ધારણ કરનાર, ધૈર્યવાનુ જેતાક્ષીસ દોષ રહિત એવી ભિક્ષા માત્રથી જીવન કરનારા આઠ પ્રકારના સામાયિક વ્રતમા રહેલા અને ધર્મના ઉપદેશ-કરનારા હોય તેઓ ગુરૂઓ માનેલા છે ॥ ૫ ॥

યોગશાસ્ત્ર.

આત્મીય પરકાર્યો વા, વ સિદ્ધાન્તો વિપશ્ચિતામ્ ।

વૃદ્ધેણઽવાધિતો યસ્તુ, યુક્તસ્તસ્ય પરિમહઃ ॥ ૬ ॥

ભાવાર્થ —વિદ્વાન્ પુરૂષોને ચોતાનો અથવા ' પારકા ક્ષેત્રાને લે છે હોતો નથી, મર્ત્ત્ર દષ્ટ, ઇષ્ટ અને અબાધિત-
૧૫ સ્થિત ને સિદ્ધાન્ત યુક્તિ યુક્ત હોય તેનો સ્વીકાર કરવો શેષ્ય છે ॥ ૬ ॥

મા કાર્યાત્ કોઽપિ પાપાનિ, મા ચ મૂત્કોઽપિ દુ સ્થિત ।

મુચ્યતા ચગદ્યેવા, મતિર્મૈત્રી નિગદ્યતે ॥ ૭ ॥

ભાવાર્થ —કોઈ પણ પ્રાણી પાપ કર્યો મા કરે, કોઈ પણ પ્રાણી દુષ્ટી ન થાયે અને મર્ત્ત્ર જગત્ પણ દુષ્ટી મુક્ત થાયે આવા પ્રકારની ને બુદ્ધિ તે મૈત્રી કહેવાય છે ૭

અપાસ્ત્રાઽરોપનોપાજ્ઞા, ઘસ્તુતરવાઽનલોકિનામ્ ।

ગુણેષુ પક્ષપાતો ય , સ પ્રમોદ પ્રકીર્તિત ॥ ૮ ॥

ભાવાર્થ —નષ્ટ થયા છે અમર દેવ'જેમના અને સત્ય સ્તુત્વના અવલોકનાર એવા પુરૂષોના શુભોમા ને પક્ષપાત કરવો તે પ્રમોદ ભાવના કહી છે ૮

દીનેષ્વાર્તેષુ મીતેષુ, યાચમાનેષુ જીવિતમ્ ।

પ્રતીકારપરા બુદ્ધિ , કારુણ્યમભિધીયતે ॥ ૯ ॥

ભાવાર્થ —દીન-દુષ્ટી, આર્ત-રોગી, બીભ-બીકલ અને જીવિતની યાચના-પ્રાર્થના કરનારાઓને વિષે ઉપકારની બુદ્ધિ રાખવી તેને કારુણ્ય-ગુણો ભાવના કહે છે ૯

મૂરકર્મસુ નિ શદ્ધ, દેવતાગુરુનિન્દિપુ ।

આત્મશસિપુ યોપેક્ષા, તન્માધ્યરખ્યમુર્દારિતમ્ ॥ ૧૦ ॥

ભાવાર્થ — દૂર કર્મોમા, તેમજ દેવ અને ગુરુઓની નિંદા કરનારાઓમા અને પોતાની પ્રશંસા કરનારાઓ વિષે નિ શકપણે જે ઉપેક્ષા કરવી તેને માધ્યસ્થ્ય ભાવના કહી છે ૧૦

(યોગ શાસ્ત્ર)

તદેવ હિ તપ કાર્યં, દુર્ધ્યાન યત્ર નો ભવેત્ ।

યેન યોગા ન હીયન્તે, ક્ષીયન્તે નેન્દ્રિયાણિ ચ ॥ ૧૧ ॥

ભાવાર્થ — જેની અહર દુર્ધ્યાન-આર્ત્ત અને શૌરધ્યાન ન થાય વળી જેથી યોગો હણાય નહીં અને ઇન્દ્રિયો પણ ક્ષીણ ન થાય તેવીજ ખરેખર તપશ્ચર્યા કરવી ૧૧

(મહોપાધ્યાય યગોવિજય)

જ્ઞાનક્રિયામક્તિતપ પ્રયોજન,

સમસ્તિ સલ્લેકમિદ્ જગત્ત્રયે ।

મન સમાધૌ હિ મમસ્તકર્મણા,

નિર્મૂલનાદાત્મગુણપ્રકાશનમ્ ॥ ૧૨ ॥

ભાવાર્થ — ત્રણે લોકમા જ્ઞાન, ક્રિયા, ભક્તિ અને તપ શ્ચર્યાનું પ્રયોજન માત્ર આ એકજ છે કે ચિત્તની સમાધિ થયે છતે સમસ્ત કર્મોનો નાશ થવાથી આત્મિક શુભોને પ્રકાશ થાય છે ૧૨

અનન્નદેસજાયા-અનન્નાહારવહિઅસરીરા ।

જિજ્ઞવયણે પયન્ના-મદ્ધે તે વન્ધુઆ મણિઆ ॥ ૧૩ ॥

ભાવાર્થ—અન્ય અન્ય દેશોમા જન્મેલા, અન્ય અન્ય આહારથી વૃદ્ધિ પામેવા શરીરવાળા અને જિન ભગવાનના વચનોને માનનાર હોય તે અર્થે બધુઓ કહ્યા છે ૧૩

યો ધર્મશીલો જિતમાનરોપો—

વિચાવિનીતો ન પરોપતાપી,

સ્વદારતુષ્ટ પરદારવર્જી,

ન તસ્ય લોકે ભયમસ્તિ ક્ષિણત ॥ ૧૪ ॥

ભાવાર્થ—જે પુરુષ ધર્મશીલ હોય, તેમ જ માન અને શાન્ત-ક્રોધ જેણે છૂટ્યા હોય, વળી વિધાને લીધે જે વિનયવાન હોય અન્ય પ્રાણીને ઉપતાપ-પીડા કરનાર ન હોય, પોતાની મી વિષે સતુષ્ટ હોય અને પરબ્રીનો ત્યાગી હોય તને આ જગતના ક્ષિણત માત્ર પણ ભય નથી ૧૪

નાડ્યામ્બરસ્વે ન સિતામ્બરસ્વે,

ન તર્કગાદે ન ચ તસ્યવાટે ।

ન પદ્મસેવાધયણે ન મુક્તિ,

વ્યાયમુક્તિ વિહમુક્તિરેવ ॥ ૧૫ ॥

ભાવાર્થ—દિગ્ગજરપણામા તેમ જ શ્વેતાબ-પણામા, તર્ક વાદમા, તત્ત્વવાદમા અને પદ્મપાતનો આશ્રય કરવામા મોક્ષ નથી, કિંતુ કપાયોની મુખિને એ જ ખરેખર મુક્તિ-મોક્ષ છે ૧૫

બ-આત્માઓ! આ મનાવના-આત્મવિચારણા એ જ દરેકનું કર્તવ્ય છે નિશ્ચય કહિને હૃદયમા રાખી જે વ્યવહારનું પાલન કરે છે તે પુણ્યવત આત્મા આત્મભાવના ભાવતો આત્મસિદ્ધિ કરે છે, અવ્યવસ્થાની પ્રાપ્તિથી અધિક મેળવવાનું આ દુનીયામા અન્ય

કૂરકર્મસુ નિ શક્ત, દેવતાગુરુનિન્દિપુ ।

આત્મશસિપુ યોપેક્ષા, તન્માપ્યસ્થ્યમુદીરિતમ્ ॥ ૧૦

ભાવાર્થ — કૂર કર્મોમા, તેમજ દેવ અને ગુરુઓ
કરનારાઓમા અને પોતાની પ્રશંસા કરનારાઓ વિરે નિ
જે ઉપેક્ષા કરવી તેને માધ્યમ્ય ભાવના કહી છે ૧૦

(યોગ ૨૧)

તદેવ હિ તપ કાર્યં, દુર્ધ્યાન યત્ર નો ભવેત્ ।

યેન યોગા ન હીયન્તે, ક્ષીયન્તે નેન્દ્રિયાણિ ચ ॥ ૧૧

ભાવાર્થ — જોની અદર દુર્ધ્યાન-આર્ત અને રોદ્રધ્યા
યાય તપી જોથી યોગે હણાય નહી અને ઇન્દ્રિયો પણ દ
ન થાય તેવીજ ખરેખર તપશ્ચર્યા કરવી ૧૧

(મહોપાધ્યાય યશોવિજયજી)

જ્ઞાનક્રિયામક્તિતપ પ્રયોજન,

સમસ્તિ સત્ત્વેકમિદ્ જગત્ત્રયે ।

મન સમાધૌ હિ સમસ્તકર્મણા,

નિર્મૂલનાદાત્મગુણપ્રકાશનમ્ ॥ ૧૨ ॥

ભાવાર્થ — ત્રણે લોકમા જ્ઞાન, ક્રિયા, લક્ષિત અને તપ
શ્ચર્યાનું પ્રયોજન માત્ર આ એકજ છે કે ચિત્તની સમાધિ
થયે છતે સમસ્ત કર્મનો નાશ થવાથી આત્મિક શુભોનો
પ્રકાશ થાય છે ૧૨

અનન્નદેસજાયા-અનન્નાહારવહ્નિઅસરીરા ।

ઝિજ્ઞાસયણે પયન્ના-સધ્ધે તે વન્ધુઆ મણિઆ ॥ ૧૩ ॥

સાવાર્થ—અન્ય અન્ય દેશોમાં જન્મેલા, અન્ય અન્ય
મહા શ્રી કૃદ્ધિ શામેલા મરી વાળા અને કિન ભગવાનના
સ્નેહને અન્યાર હોય તં મન યધુઓ ષ્ટા છે ૧૩

યો ધર્મશીલો જિતમાનરોપો—

વિચાવિનીતો ન પરોપતાર્પી,

સ્વદારતુષ્ટ પરદારવર્તી,

ન તમ્ય લોક મયમસ્તિ કિચ્ચિત્ત ॥ ૧૪ ॥

સાવાર્થ—જે પુરૂષ ધર્મશીલ હોય, તમ જ માન અને
દેવ કાંઈ લેણે છતાં હોય, વગી વિગાને લીધે જે વિનયવાન
દેવ અન્ય પ્રાણીને ઉપાપ-પીડા ક નાગ ન હોય, યોગાની
શ્રી વિર સતુટ હોય અને પ સ્ત્રીને ત્યાગી હોય તેા આ
ધર્મશીલ ગિચિત્ માત્ર પણ ભય નથી ૧૪

નાડ્યામ્બરસ્વે ન સિતામ્બરસ્વે,

ન તર્કવાદે ન ચ તત્ત્વવાદે ।

ન પક્ષસેવાશ્રયણે ન મુક્તિ,

વપાયમુક્તિ કિલ્મુક્તિરેવ ॥ ૧૫ ॥

સાવાર્થ—જિજ્ઞાસુપણામાં તેમ જ પ્રવેતાજગ્ગપણામાં, તર્ક-
વાદમાં, તત્ત્વવાદમાં અને પક્ષપાતનો આશ્રય કરવામાં મોક્ષ
નથી, કિનુ કપાયોની મુક્તિ એ જ ખરેખર મુક્તિ-મોક્ષ છે ૧૫

અન્યાત્માઓ ! આત્મભાવના-આત્મવિચારણા એ જ હૃદયનું
કર્તવ્ય છે નિશ્ચય હૃદયમાં રાખી જે વ્યવહારનું પાલન
કરે છે તે પુણ્યવન આત્મા આત્મભાવના ભાવતો આત્મગિદ્ધિ
કરે છે, સ્વમ્વડપની પ્રાપ્તિથી અલિપ્ત મેળવવાનું આ દુનીયામાં અન્ય

કર્મ અવશેષ નથી આત્માની જ્ઞાનાદિક અખડ સપત્તિ પ્રાપ્ત કરી બધ્યાત્માઓ બાહ્ય સપત્તિઓથી નિષ્પૃહ બને છે દેવેન્દ્ર અને અકેવર્તીઓથી પણ તેઓ અધિક સુખી હોય છે (નિ સૃષ્ટ્ય તૃણરત્ તમદમાસતે) નિ-પૃહતાનુ મૂળ કાળુ આત્મભાવના છે જ્ઞાન, દર્શન અને ચાન્નિયુખ્ત હુ આત્મા અદ્વિતીય-એક ૩, પુદ્ગલભાવથી ભિન્ન છુ, નિશ્ચયનયથી અને સત્ત્વનયની અપેક્ષાએ હુ શુદ્ધ છુ, ભુદ્ધ છુ અને પરિપૂર્ણુ છુ મ્હારુ શુદ્ધ સ્વરૂપ જ્ઞાન, દર્શન અને ચારિત્રમય છે, નિશ્ચયનયે વિપાક કર્મથી ભુદ્ધો છુ, હુ અસખ્યાત પ્રદેશી આત્મા છુ કાયા માયા આદિ વિનશ્વર ધર્મોથી અલગ છુ હુ સ્ત્રી પુરૂષ અને નપુમક વેદ રહિત-અવેદી છુ વળી હુ અરૂપી, અમૂર્ત અવિનાશી અને અખડ જ્યોતિ મન્નિશ્ચદાનદ સ્વરૂપ છુ આધિ વ્યાધિ અને ઉપાધિથી મુખ્ત છુ તેમ જ શુદ્ધ પ્રક્ષ રૂપ છુ છતા હુ અનાદિ કાળથી મિથ્યા પ્રવૃત્તિને લીધે વ્યવહારવી હુ બ લોગવુ છુ, મ્હાગ જન્મમરણનુ કારણ તો અજ્ઞાનતા છે, અજ્ઞાનનાથી ડરેવા ડરો અજ્ઞાનતાએ લોગવ્યા તેવી સમાજ વધાર્યો મહે મ્હારી ભૂલ જાણી નહીં તેથી હુ ખના પ્રસંગો લોગવ્યા નાનની બવિહારી છે, કહુ છે કે—

જ્ઞાન સમાન ધન નહીં, સમતા સમુ નહીં-સુખ,
જીવન સમી આગા નહીં, લોક સમુ નહીં હુ ખ - ॥ ૧ ॥

જ્ઞાની પુરૂષાશ્વાનોશ્વામમા મ્હિન કર્મોનો ન શકરે છે, નિશ્ચયથી હુ અક્રોધી, અમાની, અમાયી, અલોભી, અદ્રેષી, અખેદી, અછેદી, અભેદી એવો સિદ્ધ સ્વરૂપી છુ, જ્ઞાનિ પુરૂષોએ સત્તાએ આત્માને સિદ્ધ સમાન કહ્યો છે જ્યારે તેવા જાવને જાણી કર્મવિપાકથી અલગ થઈશ ત્યારે તેવા શુભ પ્રગટ થશે, માટે કર્મનુ સ્વરૂપ

બાણીને તે ક્રોધાદિ ક્ષાયોથી પાછો ફરીશ ત્યારે જ આત્મધર્મ પ્રગટ થશે અનાદિ કાળથી આત્મા પાચઈદ્રિયોની વિષયવાગ્મનાથી તથા તેમા લુપ્થપણ હોવાથી તથા અઠાર પાપગ્ધાનક, નોકપાય તથા પન્નાવ દશાથી મિથ્યાત્વ, અવિરતિ, કપાય, યોગ અને પ્રમાદ એ કર્મઘના હેતુથી અલગ ન થાઉં ત્યા સુધી સમાર છે અને સસાં એજ દુખનુ કાગ્ણુ છે માટે એમ જાણી હે આત્મન્ ! તુ ત્હારા શુદ્ધ ધર્મનો વિચાર કર અને તેમાજ સદા મમ રહે, જેથી તુ સદા આનંદ લોગવીશ શુદ્ધ આનંદ એજ આત્માનો નાશાત્કાર છે મનાદિકાગથી દ્રવ્યસુખ તેમજ દ્રવ્ય ધન મેળવવા હુ મેશા રહે જખના કરી છે પરતુ ખરૂં સુખ અને ખરૂં ધન તે ભાવ છે તે ત્હારી સ્વત્તામા નહેલુ છે ત્હે તે મેળવવા ઉપયોગ કર્યો નથી તેથી તુ અસભવિત નાશવત દ્રવ્ય-ધન તેની લાલચમા પડીને અસતોષી ધર્મ પાપગ્ધાનક મવતો પુફલ વસ્તુ પોતાની નહીં જ્ઞાય પોતાની માનતો તેમા આમજન ધર્મ કર્મરૂપી શુભાશુભ વર્ગણાઓનો ભાર લઈને કેાગટ ભાગે થાય છે હે આત્મા “ ચેત ચેત કાળ જપાટા લેત ” તુ ત્હારા શત્રુઓની સાથે જહે છે તેથી ત્હને સુખને જદલે દુખજ મળશે. માટે હે આત્મા ! તુ ત્હારૂં શરણ સ્વીકાર માત્રુ શરણુ એક વીતરાગજ છે, ખીજ કોઈ શરણુ કવ્વા યોજ્ય નથી, વીતરાગની ઉપાસનાથી નાગકુમારને કેવળજ્ઞાન પ્રાપ્ત થયુ ગવણે તીર્વ કર ગોત્ર બાધ્યુ દમયતી આદિ મહાસતીઓએ મમ્યકત્વની પ્રાપ્તિ અને સુખો મેળવ્યા

1 વીતરાગના ધ્યાનથી વીતરાગતા પ્રાપ્ત થાય છે

“ નાત્યન્નુત સુવનમૂપણમૂત ! નાય !,

મૂતૈર્ગુણૈર્મુવિ ભવન્તમમિષ્ડુવન્ત ।

તુલ્યા ભવન્તિ ભવતો નનુ તેન વિન્ધા,

ભૂત્યાધિત ય શ્દ નાત્મસમ કરોતિ ” ॥ ૧ ॥

(ભક્તમરણ્યો ૧૦)

ભાવાર્થ—જગતના અવકાશભૂત-મમાન એવા છે નાથ ! મત્ય-શ્રેષ્ઠ ગુણોવટે આ દુનિયામા આપની ન્તુતિ કરતા ભ-યા તમાઓ આપના સન્ધા થાય છે, એમા મશય નથી, અથવા તેથી શુ ? આવોકમા જે પ્રભુ આધિતજનને સમૃદ્ધિવટે પોતાના મમાન શુ નથી કરતા ! અર્થાત્ પ્રે છે એમ જાણી જિન ધર્મ અને ગુણી પુરૂષોના વચનમાજ તુ આદર કર ’

“ સદ્ગુણેષ્વાત્ર કાર્ય , કલ્યાના શિક્ષણે તથા ।

અર્હત્પ્રણીતધર્મે ચ, વિદ્યાયા વિનયે નયે ॥ ૧ ॥ ”

“ શ્રેષ્ઠ ગુણોમા સર્વોત્તમ ધર્મકલાઓ ગીળવામા તેમજ અગ્નિ તે પ્રરૂપેલ ધર્મમા, વિદ્યા વિનય અને નીતિમા આદર કરવો યોગ્ય છે ”

વળી શુદ્ધ ભાવથી ભાવના કર, શુદ્ધ પ્રેમ ત્હારામાજ તુ રાખ તેથી ત્હાર ક યાણ થશે માયા મુખનુ કારણ પણ એજ છે બાકી કેવળ વિનયનાની જાણ છે સસારમા જન્મ મરણ કર્માધીન છે, જે જે અશે કર્માધીન વ્યરૂપનો અનુભવ તુ કરીશ તેટલા અશે કર્મનો વિનાશ કરી ગર્હીશ બાજ ભાવના અને દશ વિધ યતિ ધર્મને સમજવો જોઈએ ભાવના ભાવવાથી સસાર મોહ છુટે છે અને યતિધર્મ આદરવાથી શ્રેય થાય છે અનિત્ય ભાવના (૧) અશરણુ ભાવના (૨) મચાર ભાવના (૩) એકત્વ ભાવના (૪) અન્યત્વ ભાવના (૫) અશુચિ ભાવના (૬) આશ્રવ ભાવના

(૭) સવૃ ભાવના (૮) નિર્જરા ભાવના (૯) લોક ભાવના
 (૧૦) બોધિ ભાવના (૧૧) ધર્મ ભાવના (૧૨) “ યતિધર્મ—
 ક્ષમા (૧) માર્દવ (૨) આર્જવ (૩) મુક્તિ (લોભથી
 મુક્ત થવું) (૪) તપ (૫) મયમ (૬) મત્ય (૭) શૌચ
 (૮) આર્કિચન્ય (૯) બ્રહ્મચર્ય (૧૦) આ દશ ધર્મ મહાન્
 પુણ્યશાલી આત્માને પ્રાપ્ત થાય છે હે આત્મન્ ! તું સદા દશ
 ધર્મો મેળવવા યત્ન કર હે આત્મન્ ભાવ મરણ ક્ષણે ક્ષણે
 થાય છે અન્મ મરણ આ જીવે ઘણીવાર કર્યા માટે એને
 અટકાવવા પ્રયત્ન કર સજામ મરણ કર, જેથી ફરી જન્મ
 મરણ ન થાય અણુમણુને પારણામ રાખવો આત્મા
 નિર્જરા કરી મોક્ષ પ્રાપ્ત કરી શકે અનેક મહાત્માઓએ
 આત્મસાક્ષીએ ગુરૂ સામે આવોચના કરી આત્મશુદ્ધિ કરી છે
 પચવિધ સ્વાધ્યાય કરવો નિંદા, વિકથા, પ્રમાદ આદિ પચ
 મિથ્યાત્વ દૂર કરવા પ્રવૃત્તિ કર નયની અપેક્ષાએ નવતત્ત્વ,
 ચાર નિષેપ, પ્રમાણ, પદ્મવ્ય અને સમભગી એ સર્વ બંધવા
 યોગ્ય વસ્તુને બાણીશ તો તહાડ સ્વરૂપ સ્વયમેવ તહને સમ-
 બંધે તહારે તુ શુદ્ધ દર્શન પામ્યો નથી ત્યા મુધી સુદેવ
 મુગુરૂ અને મુધર્મની સાચી સેવા લક્ષિત અને આરાધના
 થઈ નહીં, શકે સમ્યક્ત્વ વિનાની ક્રિયા એકડા વિનાના મિડાની
 માફક નિષ્ફલ નીવડે છે સમક્ષિતથીજ સદ્ગુણની પ્રાપ્તિ થાય છે
 અને સદ્ગુણની પ્રાપ્તિથી મમદષ્ટિપણ પ્રાપ્ત થાય છે

મમદષ્ટિ આત્માજ મૈત્રી, પ્રમોદ, ક્રોધ તથા માધ્યસ્થ્ય
 એ ચાર ભાવનાઓને વસ્તુત લાવી શકે છે ચાર મહાન્ ભાવ-
 નાતુ સ્વરૂપ શાસ્ત્રકાં એકજ શ્લોકમા દર્શાવે છે

“ પરહિતચિન્તા મૈત્રી, પરદુ સવિનાશિની કરુણા ।

પરમુપહુષ્ટિર્મુદિતા, પરનોપોપેક્ષણમુપેક્ષા ” ॥ ૧ ॥

ભાવાર્થ—“ અન્ય લોકોના હિતનું ચિંતન કરવું તે મૈત્રી શાવના તેમજ પરના દુષ્ટને વિનાશ કરનારી ચિંતા તે કઠ્ઠા ભાવના, પર-અન્ય પ્રાણીઓના મુખમા સતોષ માનવો તે મુદિતા ભાવના, અને પારકા દોષોનું વિસ્મરણ કરવું તે ઉપેક્ષા ભાવના એમ ચાર પ્રકારનું ભાવના સ્વરૂપ જાણવું ૧

“ સર્વ મિત્ર કૃત્રિ ચિંતવો માહેલડીરે, કોઈ ન જાણે ગતુ તો,
રાગદ્રેષ એમ પગિહરી માહેલડીરે, કીજે જન્મ પવિરતો ”

મમપરિણામી ગાત્રમા હ મેશા ઉચ્ચ દશા પ્રાપ્ત કરવાની ભાવના બા યા કરે છે તેમજ યોગશાસ્ત્રમા કહ્યું છે કે-

ત્યક્તસગો જીર્ણવામા-મલક્લિત્રક્લેવર ।

મજન્માધુકરી વૃત્તિ, મુનિચર્યા કદા શ્રયે ? ” ॥ ૧ ॥

ભાવાર્થ—ત્યા । ક્યો છે આમારિક નગ જેણે, તેમજ છુટું છે વસ્ત્ર જેના, નગી મળવડે વ્યાસ છે શરીર જેનું, અને માધુકરી વૃત્તિ (જોયરી) ને નેનતો એવો હું મુનિચર્યાનો ક્યારે આશ્રય કરી । ?

ત્યન્ન દુ શિલસમગૈ, ગુરુપાદરજ સ્પૃશન્ ।

વદાઽહ યોગમભ્યસ્યન્, પ્રમવેય ભવચ્છિદે ? ॥ ૨ ॥

ભાવાર્થ—દુ શીલ-દુષ્ટ-અભાવ, અથવા દુરાચારીઓના સમર્થનો ત્યાગ કરવો, તેમજ ગુરૂમહારાજના ચરણરજનો સ્પર્શ કરવો અને યોગનો અભ્યાસ કરવો એવો હું સસારનો છેદ કરવા માટે ક્યારે ગકિતમાન થઈશ ? ૨

મહાનિશાયા પ્રવૃત્તે, કાયોત્સર્ગે પુરાદ્ભવિ

સ્તમવત્સ્વન્મકપર્ણે, ધૃષ્ટા કુર્યુ કદા મયિ ॥ ૩ ॥

ભાવાર્થ — મહારાત્રિમા નગરથી બહાર કાયોત્સર્ગિમાં પ્રવૃત્ત-ચિત્તર ગ્હેલા અટોલ આગને ગ્હેલા મ્હાગ વિષે વૃષભો (બાદો) સ્તભની માફક મ્કધ ઘર્ષણુ કયાટે કરશે ? ॥૩॥

ધને પદ્મામનાસીન, પ્રોહસિયતમૃગાર્મકમ્ ।

કદાડઽઘાસ્યન્તિ યક્ત્રે મા, જરન્તો મૃગયૂષપા ॥૪॥

ભાવાર્થ — વનની અદર પદ્માસનવાળી બેઠેલા અને જેના ખોળામા મૃગલાએના બાળકો રહેલા છે એવો મ્હુને મુખને વિષે વૃદ્ધમજોના ટોળાના અધિપતિએ કયાટે મુઘશે ? ॥૪॥

શ્ચત્રૌ મિત્રે સૃણે સ્ત્રીણે, સ્વર્ણેડશ્મનિ મળૌ મૃદ્ધિ ।

મવે મોક્ષે ભવિષ્યામિ, — નિર્વિશેષમતિ કદા ॥૫॥

ભાવાર્થ — ગત્રુ અને મિત્રમા, તૃણુ અને સ્ત્રી સમૃદ્ધમા મુવર્ણ અને પાપાણુમા, મલ્લિ અને મૃત્તિકામા તેમજ સસાર અને મોક્ષમા સમાન બુદ્ધિવાળો હું કયારે થઈશ ? ॥૫॥

“ કશ્ચિત્કાલ સ માવી જિનવચનરતો યગ્ર યુક્તો યતીન્દ્રૈ—

ગ્રામાદૌ માસવરુપ સ્વચનનનસમો મુક્ત્ત્વોમાડમિમાન ।

પુણ્યા પુણ્યાડતિશાયિપ્રવરગુણયુતૈર્જ્ઞાનિમિ સેવિતા તાં,

મિશ્ના નિ મગચેતા પ્રશમરસરતોડહ ધમિષ્યામ્યજસમ ” ॥૬॥

ભાવાર્થ — તેવા પ્રકારનો કોઈ સમય આવશે ? કે જેની અદર છનેશ્વર લગવાન કથિત વચનો—આગમ મિદ્ધાન્તોમા પ્રીતિવાળો, તેમજ સ્વજન અને અન્યજનમા સમાન દષ્ટિવાળો, લોભ અને અભિમાનથી રહિત, પૌર્ણુલિક મગ રહિત ઓ ચિત્ત જેલુ અને પ્રથમ-શાતરસમા રક્ત-પ્રીતિમાનુ એવો હું શામાં દિકને વિષે મુનીંદ્રો સાથે માસ કન્ય કરીને પુણ્યા અતિશય

વાળા ઉત્તમ ગુણો વડે યુક્ત એવા જ્ઞાની મહાત્માઓએ એવેલી-
આદર કરેલી પવિત્ર તે પ્રસિદ્ધ ભિક્ષા પ્રત્યે અર્થાત્ ભિક્ષામાટે
હ મેશા ભ્રમણ કરારે કરીશ ? ॥ ૬ ॥

શુભો માનવિવર્જિતો વ્રતરત પટ્કાયરશ્લોચત ,

કૃત્વા સાધુવિહારિતા ઘમરસો નિ સજ્જચિત્ત ક્ષમી ।

ત્યક્ત્વાઽહઠ્ઠતિનિશ્ચલેન મનસા ધ્યાયન્ પન્ નૈર્વૃત્ત,

સ્વાસ્ત્યેઽહ તુ ક્વદા શિલાતલગતો મન્યાય માર્ગે દિશન્ ॥૭॥

ભાવાથ —“ મન-ચયન અને ઠયાવી શુભ, માન રહિત,
પત્ય મહાનતોમા રક્ત-પ્રીતિમાન, પટ્કાયની વક્ષામા ઉદમ
શીવ, સાધુના આચાર પ્રમાણે વિહાર કરી શાત ભાવનામા
રમ માનતો, અર્થા પૌલિક સગથી વિમુક્ત ચિત્તવાળો,
ક્ષમામાન, અચકાર નહિત નિશ્ચલ મનવડે નિવૃત્તિ-મોક્ષપદ્ધતિ
ધ્યાન કરતો તેમજ લચ જનને મોક્ષમાર્ગનો બોધ કરતો
હુ શિલાતલ ઉપર ઠયારે બેશીશ ? ” ગાહૂલ

દુષ્ટા મોહ સમસ્ત, નિરવધિવિશદ, જ્ઞાનમુત્પાદ્ય લોકે,

તીર્થે નિર્વાણમાર્ગે, શુભતરફલદ, મન્યાસાધોય કૃત્વા ।

ગત્વા લોમાન્તદશ, કલિમલગહિત, સર્વજ્ઞમાતિશાયિ,

લપ્સ્યેઽહ મોક્ષમૌરય, સહજનિચગુણ કોઽપિ કાલ મ માવી ? ॥૮॥

ભાવાર્થ —“ સમસ્ત મોહનો ક્ષય કરી, અપાર અને
નિર્મળ એવા જ્ઞાન (કેવલજ્ઞાન) ને પ્રાપ્ત કરીને, તેમજ લચ
પ્રાણીઓના સમુદાય માટે અતિશય શુભ ફલ આપનાર અને
નિર્વાણ-મોક્ષના માર્ગરૂપ તીર્થને પ્રવર્તાવી, કલિમલ-અટકર્મ
રહિત, લોકાત દેશ (સિદ્ધથિલા) પ્રત્યે જઈને, સર્વ પ્રકારના

સુખથી અધિક એવા અને સ્વાભાવિક આત્મિક શુભોની ખીલ-
વણીવાળા મોક્ષસુખને હું પ્રાપ્ત કરૂં તેવા પ્રકારનો કોઈ પણ
સમય આવશે ? ”

આવી સુદર ભાવના ભાવવાથી આત્મજ્ઞાન, આત્મધર્મ અને
સાચા આત્માનુભવ પ્રાપ્ત થશે એટલું જ નહીં પણ સત્યસુખ-
નિરૂપાધિક સુખની પ્રાપ્તિ થશે, માટે હે ચેતન ! ક્ષણમાત્ર તું
પ્રમાદ કરીશ નહીં, સદા તું શુદ્ધ ઉપયોગમા રહેજે, બહિ-
રાત્મા, અતરાત્મા અને પરમાત્મા એ ત્રણ પ્રકારના આત્માના
સ્વરૂપ છે પૌદ્ગલિક વસ્તુઓમા મહાગપણાની બુદ્ધિ તથા
શરીર, કુટુંબ, ધનધાન્ય આદિ આત્માથી ભિન્ન વસ્તુઓમા
આસક્તિ રાખે તે બહિરાત્મા છે તેમજ જે પ્રાણી શરીર
ઉપર આત્મબુદ્ધિ ધારણ કરે છે એના સુખમા આનંદ માગી
મોજમજમા પૂર્ણતયા રસ લે છે એને પોતાનું સર્વદા માને છે
એના ઉપર માયા મમતા રાખી એમાજ મદા બધાયેલો રહે
છે તે બહિરાત્મા સમજવો શરીર અને ઘઘથી એટલે તમામ
પૌદ્ગલિક વસ્તુઓથી અસખ્યાત પ્રદેશી આત્મા અવગ છે
તેમજ દશ પ્રાણુઓ રહિત, અગ્ની, અવિનાશી, નિર્ભય શુદ્ધ
ચિદાનંદ આત્મા શરીરમા રહેલો છતાં બહિરાત્માના દષ્ટા
તરીકે આસક્તિ રહિત જે છે તે અતરાત્મા બહુનો
કાયાદિક પરવસ્તુ-પૌદ્ગલિક ઉપર મમત્વ ન રાખતા તેના
સાક્ષી રૂપે દ્રષ્ટા તરીકે રહે તેને અતર આત્મા સમજવો
યથાખ્યાન ચારિત્ર પાળી ચાર ધાતિકર્મ ખપાવી ક્ષીણ મોહી
બની કેવલજ્ઞાન પ્રાપ્ત કરે તે પરમાત્મા બહુવો સકળ
ઉપાધિના ત્યાગ પૂર્વક જ્ઞાનાનંદમા સદા સમણુ કરે અને અર્તા
દ્વિય શુભનું સર્વોત્તમ સ્થાનક થાય તેજ પરમાત્મા સમજવો.

યોગીરાજ આનંદધનજી શ્રીમુમતિનાથના અવનમા કથે છે કે—

“ આત્મ ભુક્તે હો ડાયાદિક મદ્યો, ખલ્લિનાતમ અધરૂપ	સુશાની
દાયાદિકનો હો સાખી ધર રહ્યો, અતર આતમ રૂપ.	સુશાની.
જાનાનદે હો પૂરણ પાવનો, વરજિત મખજ ઉપાધિ	સુશાની
અર્તીદ્રિય ગુણ ગણ મલિ આગર, ઇમ પરમાતમ માધ	સુશાની
મુમતિચરણ કર આતમ અગ્નિ ॥ ”	

અતરાતમા નિષ્કામ લાભે પરમા માતુ અમરણ કસ્તો ધતો
સ્વયમેવ પન્માત્મ સ્વરૂપ થાય છે મસાર અમુદની પેક્ષીપાર
મહોચે છે મકવ કર્મ ક્ષીણ કે છે આતમન્ ? ઉત્કૃષ્ટ-મધ્યમ
અને અધમ એ ત્રણ પ્રકારની બુદ્ધિમા આલ બે પ્રકારની
ગ્રાહ્ય છે અને છે-રી ત્યજવા યોગ્ય છે

મહોપાવ્યાય યથોવિજયજી પણ કહે છે કે—

ગુણી ચ ગુણરાગી ચ, ગુણદ્વેષી ચ સાધુપુ ।	
દ્યુનન્તે વ્યક્તમુત્કૃષ્ટ-મધ્યામાઽધમવુદ્ધય	॥ ૧ ॥
તે ચ ચારિત્રસમ્યક્ત્ત્વ-મિખ્યાદર્શનમૂમય	
અનો દ્વયો પ્રકૃત્યૈવ, વર્તિતવ્ય યથાઘલમ	॥ ૨ ॥

। શ્વાવાર્થ—સાધુઓને વિષે ઉત્કૃષ્ટ બુદ્ધિવાળો ગુણી હોય
છે, મધ્યમ બુદ્ધિવાળો ગુણરાગી અને અધમ બુદ્ધિવાળો ગુણી

દેવી -પદ રીતે મલનાય છે વળી તે ઉત્કૃષ્ટ મધ્યમ અને અધમ બુદ્ધિવાળા તેઓ અનુક્રમે ચારિત્ર, મમ્યકત્વ અને મિથ્યાવર્થનના અધિકારી થાય છે, એ કાન્ધુથી સ્વભાવથી જ સમ્યક્ચારિત્ર અને સમ્યક્દર્શનજનક ઉત્કૃષ્ટ અને મધ્યમમાં પોતાની શક્તિ પ્રમાણે પ્રવૃત્તિ કરવી ॥ ૨ ॥

આભાવિક વિવેકદષ્ટિ જેને પ્રાપ્ત થાય છે તે જ ખરેખર જીવનમાર્ગમાં પ્રવૃત્તિ કરે છે તે જ સર્વદા દેખતો ગણાય છે ઉન્માર્ગે પોતે જતો નથી તેમ બીજાઓને જતા નિવારે છે જેમ કે—

एष हि चक्षुरमल सहजो विवर्ष-

स्तद्वद्भिरेव मह सवमतिद्वितीयम् ।

एतद्द्वय भुवि न यस्य स तत्त्वतोऽन्ध-

स्तस्याऽपमार्गचलने सखु कोऽपराध ॥ ૧ ॥

ભાવાર્થ—મનુષ્યોને આભાવિક વિવેક એ જ એક નિર્ભંગ નેત્ર છે અને તે વિવેકવાળા પુણ્યો માથે મહવાસ કરવો તે બીજી નેત્ર છે આ જગત્મા આ બંને નેત્રો જેને નથી તે પુરૂષ વસ્તુત અધ છે અને તે અવળે રસ્તે ગમન કરે તેમા તેનો ખરેખર કઈ પણ અપરાધ ગણાય નહીં ॥ ૧ ॥

માથો વિવેક જ્યારે પ્રગટ થાય છે ત્યાં શ્રમણપણ્ય પ્રાપ્ત થાય છે શ્રમણજીવનની મહત્તા અને પ્રશંસા અનેક શાસ્ત્રોમા દષ્ટિગોચર થાય છે જેમ કે—

समसत्तुषधुवगो-समसुहदुक्रयो पसमनिदसमो ।

समलोढ्वक्चणो पुण-जीविदमरणे समो समणो ॥ ૧ ॥

ભાનાર્થ—શત્રુવર્ગ અને બધુવર્ગ પ્રત્યે જેને સમાન ભાવ છે—એકને પર અને બીજાને સ્વકીય નથી સમજતો, વળી સુખદુઃખમા પણ સમાન ભાવ-એકને જોઈ ખુશી અને બીજાને જોઈ ક્રોધ નથી થતો પ્રશંસા અને નિંદામા સમાનતા એટલે ઉત્કર્ષ અને અપકર્ષને મનમા ધારતા નથી, તેમ જ જીવન અને મરણમા જેને સમભાવ હોય છે અને સુખર્ષ તથા દેહામા જેનો સમાનભાવ હોય તે માથે શ્રમણ બાણવો

વળી તેવા પ્રકારનું શ્રમણપણ જ્ઞાન અને શુદ્ધિયાના અભ્યાસથી અવશ્ય પ્રાપ્ત થાય છે અભ્યાસીને શુ દુષ્કર હોય ?

કહ્યું છે કે—

અભ્યાસેન ક્રિયા મર્વા, અભ્યાસાત્સકલા વલા ।

અભ્યામાદ્ ધ્યાનમૌનાદિ, નિમઘ્યાસસ્ય દુષ્કરમ્ ॥ ૧ ॥

ભાવાર્થ—અભ્યાસથી સર્વ ક્રિયાઓ સિદ્ધ થાય છે તેમ જ સમગ્ર કાળો અભ્યાસથી પ્રાપ્ત થાય છે અને ધ્યાન તથા મૌનાદિક યોગ પણ અભ્યાસથી જ સિદ્ધ થાય છે, અભ્યાસ કરનારને કંઈ પણ આ દુનિયામા દુષ્કર નથી ॥ ૧ ॥

હે આત્મનું! અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર અને અનંત તપ-વીર્ય તથા અનંત ઉપયોગ એ જ તારા મૂળ ધર્મો અને આત્મિક શુભો તેમ જ સાચા આભૂષણો છે, તેમા જ સમજૂતા કરવાથી નિર્જગ શશો જેથી તું કર્મથી હલકો થઈશ તેમ જ સર્વ નિર્જગ, અને મોક્ષ એ ત્રણ તત્ત્વો તારે ધારણ કરના યોગ્ય છે

વ્યવહારથી ગૃહસ્થને પુણ્ય તત્ત્વ પ્રિય હોય છે, પરંતુ

સાધુને તેની ઈચ્છા વગ્વી ઘટે નહી, જો ગૃહસ્થ પોતાના નિત્ય નિયમોને આરાધે અને પોતાનું કર્તવ્ય સમજી ઉપયોગ પૂર્વક ધર્મ સેવના કરે તો આગ્નિ મેળવવા યોગ્ય બને છે આગ્નિધારી બની મોક્ષ મેળવે છે ગૃહ-ધર્મલાભા ધર્મ સેવનાર દેવ પણ ધાય છે પોતાના વૃ કર્મો હુ મેશા ગૃહસ્થે પણ કરવા જમકે—

દેવપૂજા ગુરુપાસ્તિ , સ્વાધ્યાય મયમસ્તપ ।

તન ચેતિ ગૃહસ્થાના, પટ્નર્માણિ દિને દિને ॥ ૧ ॥

ભાવાર્થ—“ દેવપૂજા, ગુરુની સેવા, સ્વાધ્યાય, ધાર્મિક શાસ્ત્રનું અધ્યયન, મયમ-વૈરાગ્ય ભાવના, તપશ્ચર્યા, અને દાન એ ૭ કર્મો ગૃહસ્થોને પ્રતિ દિવને કરવાના કહ્યા છે ૧

ન કય દીણુદ્ધરણ , ન કય માહમ્મિઝાણ ઘચ્છલ્લ ।

હિઝયમિ વીયરાઓ, ન ધારિઓ હારિઓ જમ્મો ॥ ૨ ॥

ભાવાર્થ—દીન જનોનો જોણું ઉદ્ધાર ન કર્યો, તેમજ સાધર્મિક જનોનું જોણું વાત્સલ્ય (સેવાભક્તિ) ન કર્યું અને હૃદયમાં જોણું વીતરાગ ભગવાન ધારણું નથી કર્યા તેણું પોતાનો જન્મ કેવળ વ્યર્થ ગુમાવ્યો જાણવો ૨

સ્વાભાવિક ગુણ ધ્યાને તેની સેવના ધાય તો તેમાં-તે ઉપર આમંત્રિત ભાવ કરવો નહીં, તેજ ઉત્તમ જીવન બનાવવામાં હિતકારી છે, પુણ્યથી દેવદેવે દ્ર ચક્રવર્તીપણાની પદવીઓ મળે છે, હતા સાધુજીવનની ઉત્તમતા એથી વધારે છે, ઉપાધ્યાયજીના વચનો તરફ ધ્યાન આપીએ કે—

સુરિનો વિપર્યસ્ત્પ્તા—ને દ્રોપેન્દ્રાદયોઽપ્યહો ? ।

મિશ્રુરેક સુલ્લી લોકે, જ્ઞાનવૃત્તો નિરજ્જન ॥ ૧ ॥

ભાવાર્થ—આશ્ચર્ય છે કે વિપયોમા ગચ્છી મારી રહેલા ઈદ્ર અને ઉપેદ્રાદિક પણુ મુખી નથી, પણુ જ્ઞાનથી તૃપ્ત અને અનાસક્ત એવો એક ભિષુ-મુનિ જગત્મા મુખી છે કારણકે અપરિવ્રહી હોવાથી વગી કહ્યું છે કે—

“અમતુદ પરિવ્રહ ભર્યા, મુખીયા ન ઈદ્ર નરિદ મણુલે ।
મુખી એ અપરિવ્રહી, માધુ મુજસ સમ કદ સણુલે ।
પરિવ્રહ મમતા પરિહરે ”

હે આત્મા ! તુ મોહભાવમા પડીને પૌદ્ગલિક વસ્તુને મ્હારી ક્ષી મુગ્રાય છે પણુ તુ નિશ્ચયથી પૌદ્ગલિક ભાવથી મર્વથા લિન છે મ્હારાપણુ મારીને આલક્ષિભાનથી મસારમા પરિ ભ્રમણુ ક વુ પડે છે જડનમ્તુના મગથી જડપણુ પ્રાપ્ત થાય છે તુ ચેન છે, આત્મા છે, ત્હારો મ્વભાવ જડનભાનથી લિન છે, મારી સમજણુ મેગની પુદ્ગલ ભાવ ઉપથી પ્રેમ ઉતારી ત્હારા શુદ્ધ આત્મા ઉપર પ્રેમ ધા છુ કર, મર્વે શુપોમા મમગી થઇ પરમાત્માને જ્ઞે, ત્હારામા મર્વ આત્માએને આત્મરૂપે તુ જ્ઞે, જેથી ત્હને પૂર્ણ જ્ઞાન પ્રાપ્ત વાય દરેક શ્વાત્માએએ પાપ જન્ય બધને તોડવા માટે પોતાના અધિ કાર પ્રમાણે ચત્ન કરવો કહ્યું છે કે—

વિદ્યાતીર્થે પઠિતમતય સાધય સત્યતીર્થે,

સેવાતીર્થે મલિનમનમો દાનતીર્થે ધનાત્પ્યા ।

લજ્ઞાતાર્થે કુલ્યુવતયો-યોગિનો જ્ઞાનતીર્થે, -

નીતૌ તીર્થે ધરણિપતય વલ્મપશ્ચાલ્યન્તિ ॥ ૧ ॥

ભાવાર્થ—વિદ્યાન્ પુરૂપો વિદ્યારૂપ તીર્થમા, માધુએ સત્ય

રૂપ તીર્થમા, મલિન બુદ્ધિવાળા પુરૂષો મેવાભક્તિરૂપ તીર્થમા,
ધનવાન લોકો દાનરૂપ તીર્થમા, કુલીન સ્ત્રીઓ લગ્ન-મર્યાદા
રૂપ તીર્થમા, યોગીઓ જ્ઞાન તીર્થમા અને રાજાઓ નીતિરૂપ
તીર્થમા પાપને ધોઈ નાખે છે ॥ ૧ ॥

દાન, શીલ, તપ અને ભાવના એ ચાર પ્રકારનો ધર્મ તીર્થકર
દેવોએ કહેલો છે એ ધર્મ આચરનાર પ મ જ્ઞાની અને આત્મ
યોગી બને છે, અનુદૂલ અને પ્રતિદૂળ ઉપસર્ગોને તે દૃઢતાવી
સહન કરે છે, એવી પન્મ દશા પ્રાપ્ત થાય તે માટે પ્રયત્ન કરવો
ચિન છે જેથી આત્મયોગીપણુ મિદ્ધ થાય છે અને આત્મ
યોગીઓ જગત્ની ધમાલ વચ્ચે નિજનદમા રહે છે કહ્યુ છે કે—

ચળ્ડાલ કિમય દ્વિજાતિરથના ગુદ્ધોડય કિ તાપસ ,

કિવા તત્ત્વનિવિષ્ટનિર્મલમતિયોગીશ્વર કોડપિ કિમ ।

इत्तुत्पन्नविरूपजल्पमुखरै सभाज्यमाना जनै—

ને કુદ્ધા પયિ નૈવ તુષ્ટમનસો યાન્તિ સ્વય યોગિન ॥ ૧ ॥

ભાવાર્થ—ગુ આ ચડાળ નતિનો છે ? અથવા ગુ
પ્રાક્ષણુ છે ? મિના શુદ્ધ છે ? અથવા તાપમ-તપસ્વી છે ?
અથવા તત્ત્વવેદી શુદ્ધ અત કરણવાળો છે, મિવા કોઈ પણ
યોગીશ્વર છે ? એમ વિવિધ પ્રકારના વિક્ષપનાદમા મુખ્ય-
વાચાળ બનેલા મનુષ્યોથી સભાવના કરાયેલા યોગીઓ પોતે
ક્રોધ કરતા નથી તેમ જ અતુષ્ટ પણ થતા નથી કિંતુ શુદ્ધ
માર્ગે ચા-ચા કરે છે ॥ ૧ ॥

તેમ જ—

एक पूना रचयति नर पारिजातप्रसूनै ,

કુદ્ધ વળ્ડે ક્ષિપતિ મુજગ હન્તુમામસ્તનોડન્ય ।

તુલ્યા ઘૃત્તિર્ભવતિ ચ તયોર્વસ્ય નિત્ય સ યોગી,

મામ્યાઽઽરામ વિશતિ પરમજ્ઞાનદત્તાવકાશમ ॥ ૧ ॥

ભાનાર્થ—એક પુરુષ પાણિતલ (ક પૃષ્ઠ) ના પુષ્પોવટે પૂત ૨૨ ઠે મને અન્ય પુરુષ કોધાયમાન થઈ માત્રવાની ઇચ્છાથી કઠમા મર્ષ નાખે છતાં પણ તે બનેને વિષે જેની તુલ્ય-સમાન વૃત્તિ થાય છે તે થોડી મહામા, પન્ન-૦ કૃષ્ણજ્ઞાને આપ્યો છે અવગણ જન એવા નમતા ૨ ૦ ધાનમા પ્રવેશ કરે છે ॥ ૧ ॥

।ગ બને દે અને ફરકવા માટે સમત્ત્વનો સ્વીકાર કરવો જોઈએ.

મોહવાદ્દિમપાક્તું, સ્વીક્તુ સયમશ્રિયમ ।

છત્તુ રાગદ્દુમોચાન, સમત્ત્વમવલમ્બ્યતામ ॥ ૧ ॥

ભાવાર્થ—મોહ રૂપી અગ્નિને દૂર કરવા માટે તેમ જ મયમ રૂપ લક્ષ્મીનો સ્વીકાર કરવા માટે બને રાગરૂપી વૃષ્ટોથી રોલિત બગીચાને નિમૂલ કરવા માટે મનત્ત્વભાવનું અવલબન કરવું જેથી આત્મભાવના સ્વયમેવ સિદ્ધ થાય છે આત્મભાવના ભાવનાર ભગત-ચક્રીએ કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યું બાહુબગીને માનનો ત્યાગ થવાથી કેવળ લક્ષ્મી પ્રાપ્ત થઈ સમત્ત્વ દૃષ્ટિ રાખવાથી અર્જુન માળી અને હૃદયપ્રહારી બને મહા હૃદયારા હતા છતાં તેમણે શ્રમણત્વ સ્વીકારી સમભાવ ધારણ કરી છ માગમા કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યું તેમ જ ગીવાતીચાર બને અડકોગીક જેવા દૂર સ્વભાવનાજા હોવા છતાં તેમણે સમભાવમા આવી સ્વર્ગમુખ મેળવ્યું ગજસુકુમાલના મસ્તક ઉપર સોમલ પ્રાણણે માટીની પાગ બાધી ધગધગતા અગારા મૂક્યા છતાં પણ સમભાવના બળે તેમને કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું અવતીસુકુમાળ સુકોશવમુનિ બધકમુનિ મેતારજ

મુનિ આદિ મહાપુરુષોએ ઘો- ઉપમર્ગો મહન કરી આત્મ-
 સિદ્ધિ મેળવી છે તે પણ સમભાવનો જ મહિમા છે દમદત
 રાજર્ષિ મમતા મામાયિકમા રહેલા હતા તે સમયે પાડપોએ
 ભાવપૂર્વક વદનપૂજન કર્યું અને ઠો-વોએ પવરાઓથી ઢાકી
 દીધા તો પણ તે સમભાવમા રહ્યા તો તે પરમ સુખના
 ભાગી થયા છે આત્મનું તુ આવા અનેક મહાપુરુષોના
 જીવનઆદર્શો વિચારી મ-પાશે પણ આવા પ્રકારનું ઉત્તમ
 જીવન જીવવા પ્રયત્ન કર સમારનો મોહ મૂકી સ્વભાવમા રહી
 આત્મ-વડપની તુ વિચારણા કર શ્રી મહાવી-પ્રભુએ માણ્યાર
 (૧૦૧) વર્ષ અને એક પક્ષ-પખવાડીયા સુધી મૌન રહી અનેક
 અનુકૂળ પ્રતિજ્ઞા ઉપમર્ગો મહન કરી પન્મ પૂર્ણ જ્ઞાન-કેવળ
 જ્ઞાન પ્રાપ્ત કરી લય આત્માઓને જે આત્મગુણો ઉપદેશ
 કર્યો હતો તે ઉપદેશ સુધર્માશ્રમીએ આચાર્ય આદિ સિદ્ધાન્ત
 રૂપે ઉપદેશ કર્યો, અનેક નિર્ઝય મહાપુરુષોએ તેમજ આચાર્ય
 મહાગાન્તઓએ ત-નુમાર ઉપદેશશ્રયો દ્વારા ઉપદેશ આપ્યો તે
 પરમ હિતની છે અને સ્વસ્વડપની આખી કનનનાર-માક્ષાત્કાર
 કરાવનાર છે, માટે છે આત્મનું તુ પરમ આદર પૂર્વક પરમ
 શ્રદ્ધા પૂર્વક શ્રવણ કર, મનન કર, નિશ્ચય કર, તે પ્રમાણે
 પ્રવૃત્તિ કર તો તુ અન્ય કયાલુનો ભોક્તા ધર્મશ

શિવમસ્તુ મર્વજગત, પરહિતનિરતા મવન્તુ મૂતગણા ।

દોષા પ્રયાન્તુ નાગા, મર્વજ સુલ્લીમવન્તુ લોમા ॥ ૩ ॥

- ઝ જ્ઞાન્તિ ૩

વિ. મ ૧૯૯૫
 તા ૪-૩-૩૩
 વિજાપુર

લે પરમ ગુરુદેવ શ્રી બુદ્ધિસાગરસૂરીશ્વરજીનો
 - લઘુનમ રિધ્ય મુનિ જયમાગર

॥ श्रीमद्-ऋद्धिसागरसूरिगुणाष्टकम् ॥

गुणेषु रक्तं श्रुतधर्ममक्तं, सम्यक्क्रियाकाण्डलता-
 पयोद । म्याढादमुद्राप्रथितप्रभात, सूरि मदाऽऽस्तामिह
 ऋद्धिसागर ॥ १ ॥ तत्त्वार्थिना तत्त्वधनप्रदाता, धर्मा-
 र्थिना धर्मगुणैरुदाता । मोक्षार्थिना तत्प्रधनप्रदीणः, सूरि-
 श्रियास्तामिह ऋद्धिसागर ॥ २ ॥ जितान्तरारिर्जयशील
 भावः, शीलप्रभाभासुरशान्तमूर्तिः । वशीकृताश्चाऽश्वगणध-
 कासत्-सूरि सदा राजति ऋद्धिसागरः ॥ ३ ॥ अनन्य-
 कीर्याकलितस्वरूपः, मच्छास्त्रबोधप्रधने पटीयान् । सदा
 शुभध्याननिविष्टेता, सूरिः श्रिया राजति ऋद्धिसागर
 ॥ ४ ॥ चारित्रमार्गं विशद विशाल, विधाय सम्यक् स्वमति
 प्रभानात् । प्रवर्तयैस्तत्र जनाननेकान्-सूरि श्रिया राजति
 ऋद्धिसागरः ॥ ५ ॥ दयामय धर्ममनिन्नीय, दिशन् जना-
 नार्यगुणान्प्रहर्षेन् । भूतानुकम्पा कलितस्वमारः, सूरि
 श्रिया राजति ऋद्धिसागर ॥ ६ ॥ आनन्दिताऽऽन्मापर-
 मात्मनिष्ठः, परप्रवादोक्तिविमूढभावः । श्रीजैनमिद्धान्तवि-
 चारविज्ञः, सूरि श्रिया राजति ऋद्धिसागर ॥ ७ ॥
 जखण्डिताऽनन्तमुनिश्रियाऽलः, विराजमानो विरतिप्रधानः ।
 विभासमानो विदुषा समाजे, सूरि श्रिया राजति ऋद्धिसागर
 ॥ ८ ॥ हेमेन्द्रसागरमुनिप्रथित पृथिव्या, विस्तारमेतु
 गुणभाजनमष्टकं तत् । किं नास्ति भूरिगुणिना गुणभावनेह,
 शर्मप्रदानपदुरत्तमशीलभाजाम् ॥ ९ ॥

